

ઈજિપ્તના કેરોના ચર્યામાં ભીષણ
આગમાં કુલ મૃતકાંક 41 થયો

PAGE NO. 19

પરદેશમાં દેશની મહેક એટલે



સ્વદેશ

કેનેડાથી પ્રસિદ્ધ થતું સર્વોત્તમ ગુજરાતી સાપ્તાહિક SWADESH

FOR BUYING, SELLING & LEASING
Investment In Real Estate Can Make Your Future Better...

FOR SELLERS
Free Home Staging Consultation
Professional Photography & Virtual Tour
Attractive Advertising
Social Media Marketing
Customized Feature Sheet
Weekly Open House
Assist in Mortgage & Legal Services

FOR BUYERS
Team of Strong Mortgage Brokers
Team of Lawyers
Professional Home Inspectors
Step by Step Guidance Through out Buying Process

AMIT SHAH
Sales Representative
Dir: 647-995-5640
amit4ghomes@gmail.com

KOMAL SHAH
Sales Representative
Dir: 647-624-5640
komal4ghomes@gmail.com

Homekey236@gmail.com
Web: www.amitshah.ca

FRIDAY, 19 AUGUST, 2022 Vol. 19, No. 33 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

મહારાષ્ટ્રમાં હથિયારો ભરેલી બોટ મળતાં એલર્ટ જારી

26/11 જેવા હુમલાની આશંકાથી સુરક્ષા વધારાઈ, બોટ ઓસ્ટ્રેલિયન બનાવટની હોવાના પુરાવા મળ્યા

રાયગઢ

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના હરિહરેશ્વરના સમુદ્રતટ પાસે ગુરુવારે સવારે એક શંકાસ્પદ બોટ મળી આવતા હડકંપ મચી ગયો હતો. હોડીમાં AK 47 રાયફલો, કેટલાકથે કારતુસ અને કેટલાક વિસ્ફોટક પણ મળી આવ્યા હતા. જેને પગલે સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું હતું. સ્થાનિક લોકોની આ અંગે પોલીસે પૂછપરછ પણ કરી હતી. જે સ્થળેથી આ બોટ અને લાઈફબોટ મળી આવ્યા છે તે સ્થળ મુંબઈથી ૨૦૦ કિ.મી. અને પુનાથી ૧૭૦ કિ.મી. દૂર છે.

પોલીસે આ બોટમાંથી શસ્ત્રો અને વિસ્ફોટકો મળી આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ નૌકા

ઓસ્ટ્રેલિયન બનાવટની હોવાનું પણ સ્પષ્ટ વંચાય છે. હરિહરેશ્વર અને તેની બંને બાજુમાં સમુદ્રતટે વસ્તી બહુ પાંખી છે. સમુદ્ર તટથી સહ્યાદ્રિ ગિરિમાળા વચ્ચેના પ્રદેશમાં ઝાડી ઘણી છે વળી સહ્યાદ્રી ઉપર પણ ઝાડી છે. તેથી સમુદ્ર મારફત પાકિસ્તાનથી ભારત આવવું આતંકીઓને અનુકૂળ રહે તેમ છે. ૨૬ નવે. ૨૦૦૮ના દિવસે મુંબઈમાં પ્રચંડ આતંકી હુમલો થયો હતો તે આતંકીઓ સમુદ્ર માર્ગે જ આ વિસ્તારની આસપાસ ઉતર્યા હતા તેમણે મુંબઈમાં જુદા જુદા સ્થળે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તેમણે બે હોટલ, એક હોસ્પિટલ અને રેલ્વે સ્ટેશનને નિશાન બનાવ્યા હતા તેમાં ૧૬૦નાં મૃત્યુ થયા હતા. બુધવારે

પણ આવેલી બોટ સંબંધે પોલીસ માને છે કે કદાચ ૨૬-૧૧ ના હુમલા જેવું કાવતરું હોઈ શકે તેવી શક્યતાને પગલે રાજ્યભરમાં એલર્ટ જારી કરી મુંબઈ તથા અન્ય શહેરોમાં નાકાબંધી કરી ચેકિંગ વગેરે શરૂ કરાયું હતું. જોકે, બાદમાં યુરોપ જવા નીકળેલા ઓસ્ટ્રેલિયન નાગરિકની બોટ ઓમાન પાસે ખોટકાયા બાદ ભરતીમાં મુંબઈ તરફ ઘસડાઈ આવ્યાની સ્પષ્ટતા થતાં સલામતી એજન્સીઓએ હાશકારો અનુભવ્યો હતો. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર હજી પણ તેઓ કોઈ જોખમ લેવા માગતા નથી અને તમામ એજન્સીઓને સતર્ક રાખી તમામ શક્યતાઓની તપાસ ચાલુ રખાશે.



ABOWATH REAL ESTATE GROUP
VALUING REAL ESTATE, OVERSEAS TRANSACTIONS, EVERY SCHOOL & TITL

MAAZ ABOWATH
BROKER
416 893 4585
More info on PAGE 2
વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

AIR CANADA Airline Tickets - Whole Sale Price
KLM Travel Insurance With Discount
AIR FRANCE Free Oath Commissioner Services
QATAR All Inclusive
SWISS Vacation Tour Packages
LUFTHANSA
BRITISH AIRWAYS

Fast + Best Services
VISA, PASSPORT, OCI

INTERSKY TRAVEL 20 YEARS
514-389-7070

✓ Residential ✓ New Condos ✓ Investments ✓ Commercial

દુરામાં યાદ રાખશો
Zakir Patel
Broker
Cell: 416-561-7973
Office: 416-287-2222

RE/MAX COMMUNTY
Realty Inc., Brokerage
Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email: patelzakir82@gmail.com

જમશેદપુરમાં કેદીની હત્યા બદલ 15ને ફાંસીની સજા

2019માં જેલમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી : અન્ય 7ને 10 વર્ષની જેલ

જમશેદપુર

૨૦૧૯માં જમશેદપુરની ઘાઘીડીડ સેન્ટ્રલ જેલમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસામાં એક કેદીની હત્યા બદલ ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લાની કોર્ટે ૧૫ લોકોને ફાંસી સજા ફટકારી છે. એડિશનલ પબ્લિક પ્રોસેક્યુટર રાજીવ કુમારે જણાવ્યું છે કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ-૪ રાજેન્દ્ર કુમાર સિંહાની કોર્ટે ૧૫ લોકોને આઈપીસીની કલમ ૩૦૨ (હત્યા) અને ૧૨૦-બી (ગુનાહિત કાવતરું) હેઠળ અપરાધી

ઠેરવીને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે અન્ય સાત લોકોને દસ વર્ષની જેલની સજા ફટકારી છે. તેમને આઈપીસીની કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) હેઠળ દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

કેસ અંગે મળતી વિગતો એવી છે કે, ૨૫ જૂન, ૨૦૧૯ના રોજ જેલમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં મનોજકુમાર સિંહ સહિત બે કેદીઓને ગંભીર ઈજા થઈ હતી. બંને કેદીઓને હોસ્પિટલ લઈ જતી વખતે

મનોજકુમાર સિંહનું રસ્તામાં જ મોત થયું હતું. આ હિંસાના સંદર્ભમાં પરસુદિહ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં કોર્ટમાં કાર્યવાહીને અંતે ૧૫ લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે તે પૈકી બે ફરાર છે. કોર્ટે રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસને બે ફરાર આરોપીઓને શોધવાની પ્રક્રિયા શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. વધુમાં આ ઘટનામાં અન્ય સાત આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારાઈ હતી.

SUPER VISA INSURANCE
Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply.... Ask NOW for a free quote..

Sanjiv Puri
Insurance Broker
Ph.: 416-890-3232
Email: sanjivpuri@rogers.com

StarLife
Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

Need mortgage financing?
Look no further. Let me make it happen.

RBC Royal Bank

BHAVIN PATEL
Mobile Mortgage Specialist
Royal Bank of Canada
bhavin.patel@rbc.com
mortgage.rbc.com/bhavin.patel Cell: 647-502-8069
Serving Greater Toronto Region Fax: 416-253-9461

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે ચરભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. ક્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

ROMULUS IMMIGRATION RCIC
GLOBAL REACH CANADIAN CORE...

STUDY PERMITS, VISITOR VISA, PR & CITIZENSHIP APPLICATION

- Refugee Case and Appeal
- P.R. Applications
- Citizen Applications
- Work Permit applications
- Family Sponsorships
- Super visa
- Student Visa
- Humanitarian & Compassionate
- Grounds Applications (H&C)
- Immigration Appeals
- Express Entry
- Business visitor
- Post Graduate
- Work Permit (P.G.W.P)
- Canadian Experience Class
- Oath commissioner Services
- Provincial Nominee Application (PNP)

RCIC MOHIT AHUJA **RCIC ANKITA AHUJA**
info@romulusimmigration.com, 438-795-4690, 438- 836-7400

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

Avni Shah
B.A., JD
Barrister & Solicitor
ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

કેનેડાનું હાઉસિંગ માર્કેટ ઠંડુ, જુલાઈમાં વેચાણ 5.3% ઘટ્યું

ટોરોન્ટો

કેનેડાનું હાઉસિંગ માર્કેટ જુલાઈમાં ઠંડું ચાલી રહ્યું હતું. જૂનની સરેરાશ કિંમત 665,850 ડોલરની સરખામણીમાં ઘરની સરેરાશ કિંમત 629,971 ડોલર હતી. આ આંકડો જે ગ્રેટર ટોરોન્ટો એરિયા અને વાનકુવરનાં બજારોને બાદ કરતાં વધુ 104,000 ડોલર જેટલો ઓછો છે. ઘરના વેચાણનું પ્રમાણ પણ મહિના દરમિયાનના આધારે 5.3 ટકા જેટલું ઘટ્યું હતું. કેનેડિયન રિયલ એસ્ટેટ એસોસિએશન (CREA) દ્વારા સોમવારે જાહેર કરાયેલા માસિક હાઉસિંગ આંકડાકીય અહેવાલ અનુસાર પાંચ મહિના પહેલાં હાઉસિંગ પ્રવૃત્તિ ધીમી પડી ત્યારથી વેચાણમાં આ સૌથી નાનો ઘટાડો દર્શાવે છે. અહેવાલમાં નોંધાયું છે કે, હાઉસિંગ પ્રવૃત્તિ રોગચાળા પહેલાંની સ્થિતિમાં પાછી આવી રહી છે. હાઉસિંગ માર્કેટ રોગચાળાના બે વર્ષ પછી સ્થિર થઈ રહ્યું છે, જેને કારણે રેકોર્ડ સેટિંગ વેચાણ કિંમતો અને વેચાણ વોલ્યુમો સાથે



હાઉસિંગ પ્રવૃત્તિ રોગચાળા પહેલાંની સ્થિતિ તરફ વળવા માંડી

કેનેડિયન હાઉસિંગ પ્રવૃત્તિમાં ગરમાટો આવી ગયો છે. બેંક ઓફ કેનેડાએ 2022ની શરૂઆતમાં વ્યાજ દરોમાં વધારો કર્યો, મોરગેજના ભાવમાં વધારો કર્યો અને ખરીદદારોને તેમના પૈસા માટે ધક્કો આપ્યો ત્યારે આ ગરમાટો ઓછો થઈ ગયો હતો. જીટીએ, ગ્રેટર વાનકુવર અને ફેઝર વેલી, કેલગરી અને એડમોન્ટને ઘરના વેચાણમાં ઘટાડો કર્યો હતો, જે તમામ સ્થાનિક બજારોના ત્રણ ક્વાર્ટરમાં જોવા મળ્યો હતો, એમ CREAના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. CREA અધ્યક્ષ જીલ ઓડિલે રાષ્ટ્રીય આંકડાકીય અહેવાલમાં જણાવ્યું હતું કે, જુલાઈમાં અમે થોડા મહિનાઓથી એવું વલણ જોઈ રહ્યા છીએ કે વેચાણ ઘટ્યું છે અને દેશના કેટલાક મોંઘા વિસ્તારોમાં છેલ્લાં બે વર્ષમાં ભાવ સૌથી વધુ વધ્યા હોય તેવા સ્થળોએ પણ ભાવમાં ઘટાડો થયો છે. CREAના વરિષ્ઠ અર્થશાસ્ત્રી શોન કેથકાર્ટના જણાવ્યા અનુસાર, નવી લિસ્ટેડ પ્રોપર્ટીમાં પણ 5.3 ટકાનો ઘટાડો થયો હતો.

ઓન્ટેરિયો શિક્ષણ ખાતું ઓછા પગારવાળા કર્મચારીઓને બે ટકાનો વધારો આપશે

કેનેડાના યુનિયન ઓફ પબ્લિક એમ્પ્લોઈઝ સાથે વાટાઘાટો બાદ વિધિવત દરખાસ્ત રજૂ થઈ

ઓન્ટેરિયો

ઓછા પગારના શૈક્ષણિક કર્મચારીઓના પગારમાં બે ટકાનો વધારો કરવાની ઓફર ઓન્ટેરિયોએ ચાર વર્ષ માટે રજૂ કરી છે. આ યોજનાનો લાભ ૪૦૦૦૦ યુએસ ડોલરથી ઓછા પગારવાળાઓ માટે છે. જ્યારે બાકીનાઓને આ વધારો ૧.૨૫ ટકાના દરે મળશે. આ દરખાસ્ત સોમવારે કેનેડાના યુનિયન ઓફ પબ્લિક એમ્પ્લોઈઝ સાથેની વાટાઘાટો બાદ રજૂ થઈ હતી. જેમાં શિક્ષકોના ચાર મોટા યુનિયનો સાથેની વાતચીત બાદ આ નિર્ણય લેવાયો હતો. અગાઉના કરારો બિલ ૧૨૪ તરીકે ઓળખાતા હતા. જે સરકારે ૨૦૧૯માં પસાર કર્યા હતા. જેમાં પગાર વધારાનો દર ત્રણ વર્ષ માટે એક ટકા હતો. પ્રિમીયર ડગ ફોર્ડે તાજેતરમાં કહ્યું હતું કે, આ વખતે

સરકાર વધારાના એક ટકાની જાહેરાત કરશે અને સીયુપીઈના લોરા વોલ્ટને કહ્યું હતું કે, તે અને તેના સાથીઓ મજાકમાં કહેતા કે કદાચ ૧.૨૫ ટકાનો તો વધારો મળશે. શૈક્ષણિક કર્મચારીઓના પગારમાં કાપનું મુખ્ય કારણ કુળાવો છે એમ પણ વોલ્ટને કહ્યું હતું. તેઓ ઓન્ટેરિયો સ્કુલ બોર્ડ કાઉન્સિલ ઓફ યુનિયન્સના પ્રમુખ પણ છે. તેમણે કહ્યું હતું કે, આ વધારો દરેક કર્મચારીને વર્ષ ૮૦૦ ડોલર જેટલો મળી શકશે. જેને પગલે કર્મચારીને વર્ષ ૩૮૦૦૦ ડોલર મળશે. અન્ય યુનિયનોએ પણ એવી રજૂઆત કરી હતી કે, કુળાવાને કારણે જીવનધોરણ ખર્ચાળ બની રહ્યું છે. જૂન માસમાં કુળાવાનો દર વધીને ૮.૧ ટકાએ પહોંચ્યો હતો. સીયુપીઈ ૫૫ હજાર કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં બાલવાડીના કર્મચારીઓનો પણ સમાવેશ છે.

સરઢવ પરિવાર કેનેડાના સ્નેહમિલન સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી



ટોરોન્ટો

સરઢવ પરિવાર કેનેડાનો સ્નેહમિલન સમારંભ અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ તારીખ 14 ઓગસ્ટ 2022ને રવિવારના રોજ ઉત્સાહ, ઉમંગ અને ભવ્યતા સાથે યોજાયો હતો. કાર્યક્રમમાં મૂળ સરઢવ ગામ (તા.જા.ગાંધીનગર) ના વતની અને હાલ કેનેડાના ટોરોન્ટો વિસ્તારમાં રહેતા 115 ભાઈઓ બહેનો અને 14મી ઓગષ્ટે સવારે 10 કલાકથી આગમન, રજીસ્ટ્રેશન, ચા, કોફી, નાસ્તા સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. 11-10 કલાકે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિસ્તારમાં ફરકતા રાષ્ટ્રધ્વજો અને શૌર્યગીતોના શૌર્ય એ વાતાવરણને ઉષ્માસભર બનાવી દીધું હતું. બધા જ પરિવારજનો રાષ્ટ્રભાવથી ઓતપ્રોત થયા હતા. આ પ્રસંગે ગામના અગ્રણી નવિનભાઈ પટેલે આઝાદીની ચળવળ અંગે પ્રાસંગિક વાતો કરી દેશની આઝાદી માટે જાન કુરબાન કરનાર

શહીદોને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. વંદેમાતરમ અને ભારત માતા કી જયના નારાઓથી વાતાવરણ ગાજી ઉઠ્યું હતું. કાર્યક્રમ બાદ તુરંત જ નિલા અને હેમાએ ભૂલકાઓને રમતો રમાડી હતી. બીજીતરફ ભાઈઓ બહેનોના ગુપ્ત બનાવી દોડ, લંગડી, લિંબુ ચમચી, ઉભી- ખો વિગેરે રમતોની હરિકાઈ યોજાઈ હતી. વિજેતાઓને વડીલોના હસ્તે ઈનામ વિતરણ થયા હતા. બપોરે સ્વાધ્યાય પરિવારના ભાઈઓએ શેરી નાટકની પ્રેરણાદાયક પ્રસ્તુતિ કરી હતી. સીમા, જુલી. નિમિષા, ભાવના વગેરે બહેનોએ ગરબાનું આયોજન કરતા ગરબાની રમઝટ જામી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આકાશ, રાહુલ, મેહુલ, વિનય, ભાવેશ અને નિતીનકુમારનો સહયોગ રહ્યો હતો. શ્રી સરઢવ ગામ વિકાસ મંડળના પ્રમુખ ડો. કે.ટી.પટેલ, કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખ ગિરીશભાઈ પટેલ અને ગામના સરપંચ કિરીટભાઈ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી.

કોવિડનો સાલ્વિયા ટેસ્ટ નેઝલ સ્વેબની તકલીફમાં રાહત કરશે

નેઝલ સ્વેબને બદલે કપમાં લાળ આપવાનું વધુ સરળ

ટોરોન્ટો

કોવિડની મહામારી શરૂ થઈ હતી ત્યારે નીલ સેકસ્વીના પુત્ર મથુનો હાથ ભાંગી ગયો હતો અને એને તત્કાળ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તે સમયે પીસીઆર ટેસ્ટ ફરજિયાત હોવાથી એનો સ્વેબ ટેસ્ટ થયો તો એની આંખમાંથી પાણી વહેવા માંડ્યું હતું અને એને ઘણી તકલીફ થઈ હતી. સેકસ્વી કહે છે કે, ત્યારથી એ આવા ટેસ્ટથી ડરે છે. નાના બાળકોના ટેસ્ટ માટે કોઈ અન્ય વિકલ્પ હોવો જોઈએ એવું બધાને લાગતું હતું. કોવિડ-૧૯ની મહામારી દરમિયાન આ ટેસ્ટથી ઘણાંને તકલીફ થતી હોવાથી

હવે એ ટેસ્ટ માટે નવો વિકલ્પ શોધવામાં આવ્યો છે. જેને કેનેડાના અરોગ્ય વિભાગે મંજૂરી આપી છે. ગયા શનિવારે જ સેકસ્વી એની પત્ની એનિટા અને પુત્રી લીહ જ્યારે ટોરોન્ટોમાં પીસીઆર ટેસ્ટ કરાવવા ગયા, ત્યારે એમને એક કપમાં મોંની લાળ આપવા કહેવાયું, જેમાંથી મશીનમાં લાળનું ટેસ્ટિંગ થાય છે જેથી લાળના સેમ્પલ લેવા માટે નાક અને મોંમાં સ્વેબ નાંખવાની જરૂર પડતી નથી. એ જોઈને સેકસ્વીએ કહ્યું હતું કે, આ તો વધુ સરળ છે. આ ટેસ્ટની શોધ અમેરિકન કંપની માઈક્રોજેમ આઈએનસીએ કરી છે અને ટેસ્ટનું નામ એસએએલ-૬૮૦ રાખવામાં આવ્યું છે. સાલ્વિયા આધારિત પીસીઆર ટેસ્ટ છે જે માત્ર ૩૦ મિનિટમાં પરિણામ આપી શકે છે.

THINKING OF BUYING, SELLING OR INVESTING?

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટ ની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.
મોર્ટગેજ જોઇએ છે? અમે મદદ કરી શકીએ છીએ!

CALL 416 893 4585 TODAY!!!

SUBHRO CHAKRABORTY
SALES REPRESENTATIVE

SUDHIR PARMAR
SALES REPRESENTATIVE

Call us **TODAY** for all of your Real Estate needs and get honest, reliable and professional Service you can count on.

- ✓ Residential
- ✓ New Construction
- ✓ Investment
- ✓ Commercial

MOHAMMAD ABOWATH
SALES REPRESENTATIVE

MAAZ ABOWATH
BROKER - TEAM LEADER

IBRAHIM ABOWATH
SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

RE/MAX
#1 with ABOWATH your Local REALTOR

ઓન્ટેરિયોમાં જૂના કોન્ડો હોમ્સના રીપેરિંગનો ખર્ચ વધુ રહેવાના સંકેત

ઇન્સ્ટીટ્યૂટ ઓફ આર્કિટેક્ચર દ્વારા સરવે, બોર્ડને અનામત ભંડોળની ચકાસણી કરવા સલાહ

ટોરોન્ટો

કેનેડાની કેનેડીયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ આર્કિટેક્ચર દ્વારા હાથ ધરાયેલા સરવેમાં એવું જાણવા મળ્યું છે કે, ઓન્ટેરિયો પ્રાંતમાં સૌથી વધુ પ્રચલિત કોન્ડોનિયમ પ્રકારના જે મકાનો જૂના થઈ ગયા છે એના રીપેરિંગ પાછળનો ખર્ચ ખૂબ વધારે હશે. ઓન્ટેરિયોમાં ૧૫ ટકા લોકો કોન્ડો હોમ્સમાં રહે છે. નવા બની રહેલા મકાનોમાં પણ અડધાથી વધુ કોન્ડો હોમ્સ જ હોવાથી એનું પ્રચલન વધુ છે. પ્રાંતમાં અત્યારે અંદાજે નવ લાખ કોન્ડો છે જેનું સંચાલન ૧૧ હજાર કોન્ડો કોર્પોરેશન કરે છે. કેટલાક કોન્ડો ૩૦ વર્ષથી વધુ

સમયથી છે. એટલે ભવિષ્યમાં એના રીપેરિંગનો મોટો ખર્ચ થવાની શક્યતાને ધ્યાને રાખી કોન્ડો બોર્ડને પોતાના અનામત ભંડોળની ચકાસણી કરવાની સલાહ આ સરવેક્ષણ બાદ આપવામાં આવી છે. મેક્લેન્ડોશ પેરી નામક એન્જનીયરીંગ કંપની સાથે સંકળાયેલા જોન જફ્ફે કોન્ડો બોર્ડના અનામત ભંડોળના વહિવટના નિષ્ણાંત હોવાને નાતે બોર્ડના સંચાલકોને સલાહ આપતા કહ્યું હતું કે, જૂના થઈ રહેલા કોન્ડોમાં આકસ્મિક સમારકામની જરૂર ઉભી થાય તો એ ખર્ચને પહોંચી વળવા બોર્ડ પાસે પુરતું ભંડોળ હોવું જરૂરી છે. મોટાભાગના કોન્ડો કોર્પોરેશન પાસે એનો સાચો

અંદાજ નહીં હોવાને કારણે યોગ્ય રીતે જાળવણી કે સમારકામ કરાવી શકતા નથી. પરિણામે ભવિષ્યમાં એ ખર્ચ વધવાની શક્યતા રહે છે. આવા આકસ્મિક મોટા ખર્ચને પહોંચી વળવા કોન્ડોના મેન્ટેનન્સને અચાનક વધારવું પડે છે. દર મહિને કોન્ડોના માલિકો જે મેન્ટેનન્સ આપતા હોય છે એનો યોગ્ય વહીવટ થાય તો અનામત ભંડોળ બચી શકતું હોય છે. પણ જેમ જેમ મકાન જુનું થતું જાય તેમ તેમ એની જાળવણીનો ખર્ચ વધતો જવાનો છે, એ વાતને ધ્યાને રાખીને જો મેન્ટેનન્સ લેવામાં આવતું હોય તો જ્યારે મોટું સમારકામ કરાવવાનું આવે ત્યારે મુશ્કેલી ઓછી થઈ શકે છે.

કેનેડામાં ફુગાવાનો દર 12 મહિનામાં પ્રથમ ઘટ્યો છતાં ચિંતા યથાવત

જૂનમાં ફુગાવો 8.1 ટકાએ 39 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો

ઓન્ટેરિયો

ઓન્ટેરિયો : કેનેડામાં ફુગાવાનો દર જુલાઈમાં ઘટીને 7.6 ટકા થયો હતો. સ્ટેટિસ્ટિક્સ કેનેડાના મંગળવારના અહેવાલ મુજબ, 12 મહિનામાં પ્રથમ વખત આ દર અગાઉના મહિના કરતાં ઘટ્યો છે. જૂનમાં ફુગાવો 8.1 ટકાએ 39 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જેમાં ગેસોલિનના ભાવ આ દરમાં વધારો કરવા માટે સૌથી વધુ જવાબદાર છે. તેનાથી વિપરીત, એજન્સીના કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અનુસાર, જુલાઈમાં માસિક ધોરણે ગેસોલિનના ભાવમાં ઘટાડો થયો હતો. ગ્રાહકોએ જુન મહિના કરતાં જુલાઈમાં ગેસોલિન

માટે 9.2 ટકા ઓછા ચૂકવવા પડ્યા હતા. એપ્રિલ 2020થી માસિક ઘટાડો જોવા મળ્યો નથી. ઓન્ટેરિયોમાં ગેસના ભાવમાં 12.2 ટકાનો માસિક ઘટાડો જોવા મળ્યો હતો. જે પ્રાંતીય સરકારે 1 જુલાઈના રોજ ગેસ અને ઈંધણના કરમાં ઘટાડો લાગુ કર્યા પછી કોઈપણ પ્રાંતમાં સૌથી વધારે છે. પરંતુ કેટલાક ગ્રાહકોએ આ ખર્ચને પહોંચી વળવા માટે જીવનશૈલીમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે. અર્થશાસ્ત્રીઓ દ્વારા અપેક્ષિત નીચે તરફનું વલણ સૂચવે છે કે, હવે ફુગાવો ઊભો થવા માંડ્યો છે પરંતુ તે હજુ પણ બેંક ઓફ કેનેડાના 2.2 ટકાના લક્ષ્યાંકથી ઘણું દૂર છે. ફ્લાઈટ (25.5 ટકા જેટલો વધારો), નેચરલ ગેસ (12.4 ટકા) અને હોટેલમાં રોકાણ (10.1 ટકા) જેવી સેવાઓની ઊંચી કિંમતો પર્યટકોના દરમહિને થતા વધારામાં નોંધપાત્ર ફાળો આપતા પરિભળો હતા.

વિશ્વ સમાજમાં શાંતિ સ્થાપવા માટે ધર્મની ભૂમિકા” અંગે ચર્ચા પરિષદ



ઓન્ટેરિયો

એહેમદીયા મુસ્લિમ વુમન એસોસિએશન ટોરોન્ટો દ્વારા “વિશ્વ સમાજમાં શાંતિ સ્થાપવા માટે ધર્મની ભૂમિકા” અંગે કોન્ફરન્સ યોજાઈ હતી. 14 ઓગસ્ટ, 2022ના રોજ યોજાયેલી આ કોન્ફરન્સમાં હિન્દુત્વ, ક્રિશ્ચિયાનિટી, જ્યુઈઝ, શીખ અને ઈસ્લામ ધર્મના વક્તાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. હિન્દુત્વના પ્રતિનિધિ તરીકે પ્રીતિ હિતેન ઠાકરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ચિંતન ભાવસાર પણ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. પ્રીતિ હિતેન ઠાકરે એ હિન્દુ ધર્મની મૂળભૂત વાતને બખૂબી વણી હતી. તેમણે સનાતન ધર્મ જે દુનિયાનો સૌથી જુનો ધર્મ છે જેનાં એક બિલિયન માનનારા લોકો છે અને જેનો ઈતિહાસ દસ હજાર વર્ષ કરતાં પણ જુનો છે તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ધર્મ, પંથ

અને હિન્દુત્વ વિશે ઊંડાણથી સમજ આપીને ધર્મ અને પંથ વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો હતો. તેણીએ કહ્યું હતું કે, દુનિયામાં માત્ર હિન્દુ ધર્મ જ એક એવો ધર્મ છે કે જેમાં શિવ અને શક્તિ બંનેને સમાન સ્થાન આપ્યું છે. સનાતન ધર્મ સર્વ ધર્મ સમભાવની અને દરેક વ્યક્તિને સમાન સન્માન આપવાની વાત કહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બધા ધર્મના લોકોએ એકબીજા સાથે વાતચીત દ્વારા સંવાદ વેળાઓમાં પોતાના ધર્મની વાતો કરી સૂચનો રજૂ કર્યા સાધવાની કોશિશ કરવી જોઈએ અને કોઈ પણ સંજોગોમાં કોઈપણ પ્રકારની હિંસા કે જાનહાનિનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવો જોઈએ. કોન્ફરન્સમાં ક્રિશ્ચિયન, જ્યુઈઝ, શીખ અને ઈસ્લામ ધર્મના વક્તાઓએ પણ આ જ પ્રમાણે પોતપોતાના ધર્મ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સૌએ વૈશ્વિક શાંતિ કેવી રીતે લાવી શકાય તે અંગેના સૂચનો આપ્યા હતા.

ઝડપથી પાસપોર્ટ મેળવવા નક્કી ટ્રાવેલ પ્લાનનો સહારો લઈ રહેલા કેનેડીયનો

બુકીંગ કેન્સલ કરાવી કેટલાક લોકો રિફંડ મેળવી લે છે, હાલ 10 લાખથી વધુ અરજી પેન્ડીંગ

ઓન્ટેરિયો

પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાના વિલંબને ટાળવા કેનેડીયનો હવે નવા નુસ્ખાઓ શોધી રહ્યા છે. હાલમાં પાસપોર્ટ વિભાગ સામે પડતર કેસોનો ભરાવો છે, જેને પુરો કરવા વધુ સ્ટાફની જરૂર પડે એમ છે. ૧૧મી ઓગસ્ટે હજુ ૧,૦૮૨,૫૬૦ પાસપોર્ટ અરજીઓ પેન્ડીંગ છે. જે પૈકી ૫૫૦૦૦ અરજીઓ એપ્રિલથી પડતર છે. સર્વિસ કેનેડાએ જણાવ્યું હતું કે, આ અરજીઓની પ્રાથમિકતા નક્કી કરવા વધુ સ્ટાફ અને વધુ પ્રોસેસિંગ સ્ટેશન બનાવવા પડે એમ છે. મોટાભાગની અરજીઓ સાથે ટ્રાવેલ પ્લાન જોડવા

હોય છે. હાલમાં ૩૪૦૦૦૦ અરજીઓ પડતર છે, પાસપોર્ટ સર્વિસના કેરીના ગોલ્ડે આવી પાસપોર્ટ અરજીઓ સાથેના ટ્રાવેલ પ્લાન નક્કી હોવાનું શોધી કાઢ્યું હતું. સમયસર પાસપોર્ટ માટે લોકો નક્કી ટ્રાવેલ પ્લાન રજૂ કરે એ નિરાશાજનક બાબત છે. દરમિયાન ટોરોન્ટોમાં રોબર્ટ નામક વ્યક્તિએ મીડિયા સમક્ષ કબુલ્યું હતું કે, તેણે ૫૦૦ અરજદારો ગેરહાજર હતા તેમની જગ્યાએ લાઈનમાં ઉભા રહેવા માટે ૫૯ દિવસ સુધી ૧૦ જણાને રોક્યા હતા. જેના બદલામાં તેને રોજના ૧૦૦૦ ડોલર મળતા હતા. આ લોકો નક્કી

ટ્રાવેલ પ્લાન સાથેની અરજી રજૂ કરી પાસપોર્ટ ઝડપથી મેળવી લેતા હતા. જે બુકીંગ કરાવ્યું હોય એને ૨૪ કલાક પછી કેન્સલ કરાવીને રીફંડ મેળવી લેતા હતા. મોટાભાગે લોકો ટોરોન્ટોથી ન્યુયોર્ક કે ટોરોન્ટોથી મિયામીની ટીકીટો બુક કરાવતા હતા. ઘણા ટ્રાવેલ એજન્ટો અને એર કેનેડા ફ્લાઈટનું બુકીંગ પાસપોર્ટ નંબર વિના પણ કરતા હોવાથી કેન્સલ ટીકીટોનું પુરૂ રીફંડ પણ મળી જાય છે. ઘણાં હેલીફક્સ કે સેન્ટ જોન્સથી પાસપોર્ટ મેળવી લેતા હતા. સેન્ટ જોન્સના એક ફોટોગ્રાફર રોબર્ટ યંગને પાસપોર્ટ સાર્જનના ફોટોગ્રાફ્સ માટે તત્કાળ બોલાવવામાં આવ્યા હતા.

GSSM દ્વારા સપ્ટેમ્બરમાં સેકન્ડ વોલ્કેથોનનું આયોજન

મીસીસોગા

ગુજરાતી સીનિયર્સ સમાજ ઓફ મીસીસોગા દ્વારા સેકન્ડ વોલ્કેથોનનું આયોજન 11મી સપ્ટેમ્બરના રોજ કરાયુ છે. ગુજરાતી સીનિયર્સ સમાજ ઓફ મીસીસોગા દ્વારા ત્રિવિયમ હેલ્થ પાર્ટનરની ત્રણ હોસ્પિટલો “કેરિડ વેલી, મીસીસોગા હોસ્પિટલ

અને કવિનસ હેલ્થ સેન્ટર “ માટેના ફંડ રેઈઝિંગ માટે આ કાર્યક્રમ મીસીસોગા પાર્કવેલી, એરીયા B ખાતે યોજાશે. સવારે 8:30 વાગે નાસ્તા થયા બાદ 9:30 કલાકે કાર્યક્રમની શરૂઆત થશે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે નામ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તથા Donations પણ

સ્વીકારવામાં આવશે. વધુ વિગત માટે ફંડ રેઈઝિંગ કમિટીના કનભાઈ પટેલ, કલાબેન પટેલ (647 402 6150), દિલીપભાઈ પટેલ (647 990 3178), સોશિયલ મીડિયાના પ્રવુભાઈ શાહ (519 760 3938)નો સંપર્ક કરવા આયોજકો દ્વારા વિનંતી કરાઈ છે.

કોરોના સંક્રમણના ભય વચ્ચે ફ્લુની મોસમ પહેલાં રસી મૂકાવવા અનુરોધ

ટોરોન્ટો

ઓન્ટેરિયોના ડોક્ટરો લોકોને વહેલી તકે રસીકરણ કરાવવાની સલાહ આપી રહ્યા છે. હાલમાં અનેક પડકારો વચ્ચે COVID-19 અને ઈન્ફ્લ્યુએન્ઝા સહિતની બિમારીઓ ફેલાવાની આશંકા છે. ત્યારે એક ચિકિત્સક જણાવ્યું હતું કે, તેઓને પરિસ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા દેખાઈ રહી છે. ઓન્ટેરિયો મેડિકલ એસોસિએશન દ્વારા હોસ્ટ કરવામાં આવેલ વર્ચ્યુઅલ પેનલમાં ચિકિત્સકોએ આગામી મહિનાઓમાં રોગચાળા અને અન્ય હેલ્થ કેરના મુદ્દાઓ વિશે વાત કરી હતી. સેન્ટ જોસેફ હેલ્થકેર હેમિલ્ટન ખાતે ચેપી રોગોના નિષ્ણાત ડૉ. જૈન યાગલાએ જણાવ્યું હતું

કે, અન્ય દેશોમાં આ વર્ષે ઈન્ફ્લ્યુએન્ઝા સ્પાઈક્સ જોવા મળ્યા છે અને ઓન્ટેરિયોમાં પણ કંઈક આવું જ થવાની સંભાવના છે. હવે તહેવારોમાં જ્યારે લોકો ઘરની અંદર વધુ સંખ્યામાં ભેગા થશે ત્યારે કોરોનાના કેસોમાં પણ સંભવિત વધારો થશે. તેમણે કહ્યું, મને લાગે છે કે વૈશ્વિકરણ, વૈશ્વિક મુસાફરી બધું પાછું ફર્યું છે અને તેને કારણે ઓન્ટેરિયોમાં ફ્લુ વધુ પ્રમાણમાં ફેલાવાની શક્યતા છે. તેમણે લોકોને ઈન્ફ્લ્યુએન્ઝાની રસી લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચિકિત્સક ડૉ. એન્ટુ પેટ્રોસોનિયાકે જણાવ્યું હતું કે, તેઓ અપેક્ષા રાખે છે કે નજીકનાં સમયમાં હોસ્પિટલોની સ્થિતિ વધુ ખરાબ થશે.

SUPER VISA MEDICAL INSURANCE Up to 45% DISCOUNT with deductible

VISITOR TO CANADA INSURANCE

LIFE INSURANCE

MORTGAGE /LINE OF CREDIT INSURANCE

AGE	\$ 250,000		\$500,000		\$1000,000	
	Male	Female	Male	Female	Male	Female
30 Yrs	\$ 8.00	\$ 12.00	\$ 11.00	\$ 18.00	\$ 20.00	\$ 27.00
40 Yrs	\$ 11.00	\$ 15.00	\$ 14.00	\$ 21.00	\$ 25.00	\$ 36.00
50 Yrs	\$ 25.00	\$ 35.00	\$ 32.00	\$ 45.00	\$ 60.00	\$ 85.00
60 Yrs	\$ 60.00	\$ 80.00	\$ 107.00	\$ 150.00	\$ 190.00	\$ 236.00

Rates Quotes are Preferred Plus Non Smoker Term 10 With Medical Test & Rates are Subject to Change.

- NO MEDICAL TEST LIFE INSURANCE (લાં સુધી કે તમને ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, કેન્સર હોય અથવા બીજી કોઈ કંપની દ્વારા તમામ ઇન્ચ્યોરન્સને ડિક્લાર્ડન કર્યું હોય) (up to age) 85
- LIFE INSURANCE FOR REFUGEES, STUDENTS, KIDS, ON WORK PERMIT
- GURANTEED MONEY BACK (Life, Critical Illness & Disability Insurance)
- Corporate owned Life and Critical Insurance
- Key Person Insurance • RRSP • RESP • TFSA

Call For HONEST ADVICE 416.320.4614

www.financialhutltd.co Email : - Davindersinghfhl@gmail.com

Davinder Singh Chawla
TOLL : 1866.623.0865

તંત્રી સ્થાનેથી

શ્રીલંકાના બંદરે ચીનના અઘતન જહાજની એન્ટ્રી, ભારત ચિંતાતૂર


 તંત્રી - પ્રકાશક
 સ્વદેશ

શ્રીલંકાની સરકારે ચીનના સર્વેક્ષણ અને સંશોધનનું કામ કરતા જહાજ યુઆંગ વાંગને અમેરિકા અને ભારતના વિરોધની દરકાર કર્યા વિના પોતાની સીમામાં રોકાણની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ શ્રીલંકાના હમ્બાન્ટોટા બંદરે આ જહાજ આવી પહોંચ્યું છે. આમ તો હમ્બાન્ટોટા બંદરનું સંચાલન ચીન કરે છે અને ચીને આ જહાજ ગયા અઠવાડિયે હમ્બાન્ટોટા બંદરે મોકલવાનું નક્કી કર્યું હતું. પરંતુ ભારતે વિરોધ કરતાં શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે મંજૂરી આપી ન હતી. પરંતુ એક અઠવાડિયામાં જ લંકાનું વલણ બદલાતા ભારતની ચિંતા વધી છે. ભારતને શંકા છે કે સમુદ્રમાં સંશોધનના બહાને ચીનનું આ જહાજ જાસૂસી કરશે.

મોટી સરકાર ચીનની ખોરી દાનત સમજતી હોવાથી તેણે વિરોધ કર્યો. ચીનનો ડોળો હિંદ મહાસાગર પર છે. ચીને પાકિસ્તાન અને માલદીવ્સમાં ઘૂસીને હિંદ મહાસાગર પર કબજો કરવાની વ્યૂહરચના અપનાવી છે. ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)ના બહાને ચીન પાકિસ્તાનના ગ્વાદર બંદર સુધી આવી ગયું હતું. ગ્વાદર બંદર અરબી સમુદ્રમાં છે કે જે હિંદ મહાસાગરનો ભાગ જ છે. ચીને માલદીવ્સમાં પગપેસારો કરીને માલદીવ્સના રદ્દમાંથી ૧૬ ટાપુ પર લશ્કરી થાણાં નાખ્યાં છે. આ ઉપરાંત ચીને છેલ્લાં કેટલાંક વરસોથી હિંદ મહાસાગરમાં જાસૂસી અને લશ્કરી પ્રવૃત્તિઓમાં બેફામ વધારો કર્યો છે.

ભારતની વાતને અમેરિકા સહિતના પશ્ચિમના દેશોનો પણ ટેકો છે. અમેરિકાએ પણ સત્તાવાર રીતે ચીનના હાલના પગલા સામે વાંધો લીધો છે. વિક્રમસિંઘેની છાપ ભારતતરફી છે તેથી સૌપ્રથમ તો તેમણે ચીનને મંજૂરી નહોતી આપી પણ અઠવાડિયામાં જ તેનું વલણ બદલાયુ હતું. શ્રીલંકાના આ પગલા પાછળ તેની આર્થિક કટોકટી જવાબદાર છે. તેને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના પેકેજની જરૂર છે. ચીને આ પેકેજ પર બ્રેક મારવાની ધમકી આપીને વિક્રમસિંઘેનું નાક દબાવ્યાનું મનાય છે. જહાજને મંજૂરી આપ્યા બાદ વિક્રમસિંઘે સરકારે દાવો કર્યો છે કે, અમે બીજી સરકારોના જહાજોને પણ આ સવલત આપીએ જ છીએ. તેથી તેમાં અચરજ પામવા જેવું કંઈ નથી. જહાજ ૨૧ ઓગસ્ટ સુધી હમ્બાન્ટોટામાં રોકાણ કરશે. જો કે, તે કોઈ પણ પ્રકારનું સંશોધન કે બીજી પ્રવૃત્તિ નહીં કરે. હવે બંને દેશ વચ્ચે શું રંધાયુ છે તે બાબતથી ભારત ચિંતામાં છે.

ચીને ભારતને આડકતરી ધમકી પણ આપી છે કે, હમ્બાન્ટોટામાં શું થાય છે એ ચીન-શ્રીલંકાનો પ્રશ્ન છે. કોઈ ત્રીજા દેશે તેમાં રસ લેવો જોઈએ નહીં. યુઆંગ વાંગ પ આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમોને પાળીને કામગીરી કરે છે અને કોઈ પણ દેશની સલામતી કે આર્થિક હિતોને જરાય અસર કરતું નથી. ચીને એવી વાતો પણ કરી કે, શ્રીલંકા આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે, ત્યારે ચોક્કસ દેશો સલામતીની ચિંતાના નામે તેને દબાવી રહ્યા છે. જો કે, ચીન ભલે ગમે તે કહે પરંતુ તેના પર કોઈ દેશ ભરોસો રાખી શકે તેમ નથી. ચીને ઘણાં સમયથી ભારતની ફરતે જમીન અને દરિયાઈ સહદે ધીમે ધીમે પ્રસાર અને પ્રવૃત્તિ વધાર્યા છે.

ચીને ભારતના પાડોશી દેશો સાથે સારો સંબંધનો ડોળ કરીને આ ખેલ ચાલુ રાખ્યો છે. વર્તમાન સમયમાં શ્રીલંકા માલદીવ્સ, સેશેલ્સ અને જીબૂતી જેવા પ્રદેશ આ રીતે ચીનની જાળમાં ફસાયેલા છે. વળી, તેનું યુઆંગ વાંગ પ જહાજ તો જાસૂસી માટે જાણીતુ છે. આ જહાજમાં પાંચ સેટેલાઈટ અને ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ ટ્રેકર છે. તેમાં એવાં સેન્સર છે કે ભારત કોઈ પણ બેલિસ્ટિક મિસાઈલનું ટેસ્ટિંગ કરે તો તેની તરત ખબર પડી જાય. ભારત સામાન્ય રીતે ઓરિસ્સાના કઠિ અબ્દુલ કલામ આઈલેન્ડ ઉપર મિસાઈલ પરિક્ષણ કરે છે. પણ આ લોકેશન ખાનગી છે. ચીન જહાજની હાઈ-ટેક ક્ષમતાનો ઉપયોગ કરીને મિસાઈલની રેન્જ અને એક્યુરસી પણ જાણી શકે છે. આ ઉપરાંત જહાજની સમુદ્રના સર્વેની સિસ્ટમના આધારે ભારતીય સબમરીનો વિશે પણ બધી માહિતી ચીનને મળી જાય તેમ છે. ટૂંકમાં હિંદ મહાસાગરમાં સુરક્ષા માટે ભારતે જે કંઈ વ્યવસ્થા કરી છે, તેની બધી માહિતી ચીન પાસે સરળતાથી પહોંચી જાય તેવી શંકા ભારતને છે.

ચીન ઘણાં વર્ષોથી ભારત સાથે સીધો અથવા તો આડકતરી રીતે સંઘર્ષ કરતુ રહ્યું છે. આથી ચીનના કોઈ પણ પગલા સામે ભારત શંકા સેવે તે સહજ છે. જો કે, ચીનને કોઈ રીતે રોકી શકાય તેમ નથી તે ભારતની લાચારી છે. અત્યારે જે હમ્બાન્ટોટા બંદર પર ચીનનું જહાજ લાંગરેલું છે એ બંદર ચીનની કંપનીએ બનાવ્યું છે પણ તેમાં શ્રીલંકાએ મોટો ભોગ આપવો પડ્યો છે. ચીનની કંપનીએ બંદર વિકસાવવા માટે ૧.૪ અબજ ડોલર શ્રીલંકા પાસેથી વસૂલ્યા છે. જેને કારણે મોટુ આર્થિક ભારણ શ્રીલંકાને માથે આવી ગયુ. આખરે ૧.૧૨ અબજ ડોલર ચૂકવવાની તૈયારી બતાવવાઈ પરંતુ શ્રીલંકા પાસે નાણાં જ નહોતાં તેથી લાખના બાર હજાર કરીને પણ લંકાએ ચીનની વાત માનીને લંકાને બંદર સોંપી દેવું પડ્યું હોવાનું મનાય છે.

ચીને હિન્દ મહાસાગરમાં બીજા નાનકડા દેશ જિબૂતીમાં પણ લશ્કરી મથક સ્થાપી દીધું છે. સેશેલ્સને ભારતે પોતાની તરફ કરીને આર્મી બેઝની સ્થાપના કરવા મનાવેલું પણ ચીને ફાયર મારીને સેશેલ્સમાં પણ આર્મી બેઝ ઉભો કરી નાખ્યો છે. ટૂંકમાં ચીને હિંદ મહાસાગરમાં આવેલા ભારતની નજીકના તમામ દેશોને પોતાના પડખે લઈને લશ્કરી થાણાં સ્થાપી દીધાં છે. સ્વાભાવિક રીતે જ ચીન ભારત પર દબાણ પેદા કરવા જ આ પ્રવૃત્તિ કરે છે. હિંદ મહાસાગરમાં ચીનના ઝંડાવાળાં ૩૦૦ જેટલા મરચન્ટ વેસલ્સ અને ૩૦૦ જેટલાં માછામારી એટલે કે ફિશિંગ વેસલ્સ ફરતાં હોય છે. તેમની વચ્ચે ચીન પોતાનાં જાસૂસી જહાજોને ઘૂસાડી દે છે. ૨૦૨૦થી અત્યાર સુધીમાં ચીનનાં આવાં ૫૩ કહેવાતી સંશોધનની કામગીરી કરતાં જહાજ હિંદ મહાસાગરમાં દેખાયાં છે.

ચીનનો ડોળો હિંદ મહાસાગરમાં ધરબાયેલા પોલીમેટલિક સહકારી સહિતની ખનિજોના ખજાના ઉપર પણ છે. મહાસાગરમાં મોટા પ્રમાણમાં પેટ્રોલીયમનો જથ્થો પણ છે. આ સ્થિતિમાં ભારતે પોતાની સુરક્ષાને મજબૂત કરવી પડે અને સતર્ક રહેવું પડે તેમ છે. અમેરિકા સહિતના દેશો ચીન સામેની લડાઈમાં ભારતના પડખે હોવાની વાતો કરે છે, પણ તેમની કરની અને કથનીમાં મોટો ફરક રહ્યો છે.

mano1968@yahoo.ca

ARISTO PEST CONTROL

Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com

✓ Mice

✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL

✓ Cockroach

✓ Bedbug

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI

✓ Animal Control

✓ Bird Control

✓ WASPS and

✓ Hive Removal

24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And Discounted Rates

CALL SANKET TRIVEDI - 647.339.3926

Government Licensed Structural Exterminator

DIVINE YOGA

By Geeta

Children Yoga Class

Every Tuesday 5-6 PM

Adult Yoga Class

Every Saturday 9-10 AM

Join today on-ZOOM!

: Classes Available :

One to One Individual and Therapeutic

Geeta Tailor

416-456-2261

Contact Geeta at
 divineyogabygeeta@gmail.com
 IG & FB: @divineyogabygeeta

દમણ કોસ્ટગાર્ડનું દિલધડક ઓપરેશન બોટમાં ફસાયેલાં ૧૧ ખલાસીને બચાવ્યા

વલસાડ

નવસારી જિલ્લાના કિખાપુરની તુલસીદેવી બોટના ૨ માલિકો તથા ૧૧ ખલાસીઓ મચ્છીમારી માટે બુધવારે મુંબઈ ખાતે જતા હતાં. ત્યારે વલસાડના દરિયામાં ૧૩ નોટીકલ માઈલ અંદર કે જ્યાં તોફાની પવન સાથે મોજા ૧૭ થઈ ૧૮ ફૂટ ઉચા ઉછળતા હતાં તે જગ્યાએ અચાનક બોટનું એન્જીન બંધ થઈ જતાં બોટમાં પાણી ભરાવા માંડ્યું હતું.

બોટમાલિક કૌશિક ટંડેલે વાયરલેસની

મદદથી સુરત કંટ્રોલ અને વલસાડ મત્સ્ય ઉદ્યોગ વિભાગ પાસે મદદ માંગી હતી. વલસાડ મત્સ્ય ઉદ્યોગની ટીમે દમણ કોસ્ટગાર્ડને જાણ કરતા, કોસ્ટગાર્ડના જાબાંઝ ઓફિસરોની ટીમે આજે બપોરે ૧૧-૩૮ થી ૧૨-૦૦ વાગ્યા દરમિયાન ચેતક હેલિકોપ્ટરમાં દિલધડક ઓપરેશન હાથ ધરીને કુલ ૧૧ ખલાસીઓને રેસ્ક્યુ કરીને દમણ કોસ્ટગાર્ડ કંટ્રોલરૂમ ખાતે લઈ જવાયા હતાં. તમામ ખલાસીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.

અદાણી લોજિસ્ટિક્સે નવકાર કોર્પોરેશન પાસેથી વાપીનો ICD રૂ. 835 કરોડમાં હસ્તગત કર્યો

અમદાવાદ

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી લોજિસ્ટિક્સ લિ. એ નવકાર કોર્પોરેશન લિમિટેડ પાસેથી વાપીના તુમ્બ ખાતેનો ICD રૂ. 835 કરોડની એન્ટરપ્રાઇઝ કિંમતે હસ્તગત કરવા માટે એક નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યાં છે. આ સોદામાં 0.5 મિલિયન TEU હેન્ડલ કરવાની ક્ષમતા સાથે કાર્યરત ICD ના સંપાદનનો સમાવેશ થાય છે. તુમ્બ ICD પાસે પશ્ચિમ ડેરીકેટ્ડ ફેઈટ કોરીડોર સાથે ચાર રેલ હેન્ડલિંગ લાઈનો અને એક ખાનગી ફેઈટ ટર્મિનલ છે અને તેમાં કસ્ટમ નોટિફાઈડ જમીન અને બોન્ડેડ વેરહાઉસની સવલત છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.ના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણ સમયના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે તુમ્બ એ દેશના સૌથી વિશાળ ICD પૈકીનો સૌથી વધુ ધમધમતો ડેપો છે. રેલવે દ્વારા માલ સામાનનું પરિવહન સડક માર્ગ કરતાં પાંચ ગણું વધુ બિનપ્રદુષિત હોવા ઉપરાંત ફેટ કોરીડોર સાથે તેની એક્સેસનો બીજો મુખ્ય ફાયદો એ છે કે તે સરેરાશ ટ્રાન્ઝીટના સમયમાં બચત કરે છે.

મોદી સૌથી મોટા જાદુગર, ગુજરાતમાં કેજરીવાલની રાજનીતિ નહીં ચાલે : રામદાસ અઠવાલે

નવસારી

શનિવારે નવસારીમાં એક ખાનગી કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી રામદાસ અઠવાલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી મોટા જાદુગર છે. મફતની રાજનીતિ કરતા આમ આદમી પાર્ટીના કેજરીવાલ દિલ્હીમાં ફાલ્યા, પણ ગુજરાતમાં ફાવશે નહીં. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કેજરીવાલની મફતની રાજનીતિનો જાદુ નહીં ચાલે. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતમાં મોટી પકડ હોવાથી ભાજપ અહીં 2/3 સીટો જીતશે. અમારી પાર્ટીનો પ્રધાનમંત્રી મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન છે.

Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week



Preventing the Spread of COVID-19 : Our disinfectant services that we offer are:


- 1 Spray Services
- 2 Fogging Services
- 3 Sanitation Services

All Pest Control:

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants. Total Interior & Exterior Pest Control

Removal:

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornets, Yellow Jackets



Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

ઓવરધાનયાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી, છોલેપુરી, કટલેસ, ખાસ્તા કચોરી, સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી (with sweet & Farsan) \$9.00 +Tax

Limited થાળી (without sweet & Farsan) \$7.50 +Tax



CATERING SPECIAL

\$ 14.99 10 items +Tax
Sweet, Farsan, Subji, Kathor, Puri, Dal, Rice Papad, Pickle, Kachumber

Franchise Opportunity in GTA

Call us for details

રસોઈકામ કરી શકે તેવા બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

ઉ. ગુજરાતમાં અનરાધાર : 14 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો

જૂનાગઢમાં 6 ઈંચ, ગીરનારમાં 9 ઈંચ વરસાદ, તળાવ છલકાતા પાણી ઘૂસ્યા

અમદાવાદ

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદી માહોલ સર્જાયો છે. ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. મોટાભાગના તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં આભઝટયુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ જિલ્લામાં 14 ઈંચ સુધીનો વરસાદ પડી ગયો છે. બનાસકાંઠાના મોટાભાગના જિલ્લાઓમાં 6 ઈંચથી વધુ વરસાદ પડતાં વર્ષ-2017ના પૂર જેવા દેશ્યો જોવા મળી રહ્યાં છે. બીજી તરફ આજે સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં



અને દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયાં છે. જૂનાગઢ શહેરમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે જ્યારે ગીરનારમાં 9

ઈંચ સુધીનો ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં 7.92 ઈંચ અને નવસારી જિલ્લાના ખેરગામમાં 7.88 ઈંચ વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢ જિલ્લામાં ગઈકાલ સુધીમાં સાડા સાત ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. વલસાડ, ચીખલી અને ધરમપુરમાં સાડા 6 ઈંચ જ્યારે કચ્છના લખપતમાં 5.64 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બુધવારે દિવસ દરમિયાનના 12 કલાકમાં રાજ્યના કુલ 226 તાલુકાઓ વરસાદી માહોલ સર્જાયો હતો.

નર્મદા ડેમમાંથી પાણી છોડાયું: ભરૂચ પર સંકટ

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૫.૬૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી ૨૬ ફૂટથી વધુ પહોંચતા જીલ્લામાંથી કુલ ૮૦૦થી લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે નર્મદા નદીમાં તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ ઉપર પુરનું સંકટ ઉભું થતા પાલિકા તંત્ર હસ્તકમાં આવ્યું છે અને નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા કુટુંબના ૧૮૬ જેટલા નાગરિકો અને પશુધનનું સ્થળાંતર કરાયું છે

આણંદ જિલ્લામાં કાંઠાના ગામોને એલર્ટ કરાયા

આણંદ: કડાણા જળાશયમાં પાણીની આવક વધતા કડાણા બંધનું લેવલ ૭૦ ટકાથી ઉપર જતા વોર્નિંગ સ્ટેજ જાહેર કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લા ડીગ્રાસ્ટર વિભાગ દ્વારા અધિકારીઓને ખાસ એલર્ટ રહેવા સૂચનાઓ સાથે કાંઠાના ગોમોને પણ સતર્ક રહેવા આદેશ કરાયા હતા.

ખેડામાં કિશોરીનું ગળું કાપી હત્યા કરનાર અંતે ઝડપાયો

ખેડા

તારાપુર હાઈવે પર આવેલા ત્રણ ગામમાં ૧૬ વર્ષની છોકરી બસ સ્ટેન્ડ પાસે આવેલા પાર્લરમાં કોલ્ડડ્રિંક લેવા માટે ઉભી રહી હતી, આ દરમિયાન ગામના જ ૪૬ વર્ષના રાજુ નામના શખ્સે તેની જાહેરમાં ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આરોપીએ સગીરાના ગળા પર ઘાતકી રીતે ચાકુ ફેરવી દીધા બાદ તેના હાથ પર પણ ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલી કૃપાને સારવાર માટે ૧૦૮ની મદદથી ખેડા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી પરંતુ તેનો ઈલાજ શરુ થાય તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. હત્યારો વિકલાંગ હોવાની અને અપરણિત હોવાની ચર્ચા થઈ રહી છે, રાજુ માનસિક રીતે અસ્થિર હોવાની પણ વાત સામે આવી રહી છે. પોલીસે હાલ તેની ધરપકડ કરી છે.

સોજિત્રા અકસ્માતમાં MLAના કૌટુંબિક જમાઈની ધરપકડ : માનવ વધનો ગુનો

ડાલી ગામ પાસે કાર, રિક્ષા અને બાઈક વચ્ચેની ટક્કરમાં 6 નાં મોત થયાં હતાં

આણંદ


સોજિત્રા તાલુકાના ડાલી ગામના પાટિયા નજીક મંગળવારે સાંજે પુરપાટ ઝડપે જઈ રહેલ કીઆ કારના ચાલકે એક રીક્ષા તથા મોટરસાયકલને અડકેલે લેતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. બીજી તરફ મોટરસાયકલ પર સવાર બોરીયાવીના બે યુવકોને પણ ગંભીર ઈજાઓ થવાના કારણે બંનેના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. આ અકસ્માતને પગલે

સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સોજિત્રા પોલીસે પણ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરતા ડાલી નજીક ટ્રીપલ અકસ્માત સર્જનાર કાર ચાલક કેતનભાઈ રમણભાઈ પઢિયાર સોજિત્રાના કોંગ્રી ધારાસભ્યના કૌટુંબિક જમાઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રાત્રિના સુમારે કેતનભાઈ પઢિયારની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ માનવ વધની કલમ-૩૦૪ મુજબ ગુનો નોંધી પ્રાથમિક તપાસ કરતા કેતનભાઈ પઢિયાર નશો કરેલ હાલતમાં કાર ડ્રાઈવ કરતા હોવાનું ખુલ્યું હતું. સાથે સાથે કારમાંથી એમએલએ ગુજરાત લખેલ બોર્ડ પણ મળી આવ્યું હોવાની માહિતી પોલીસ પાસેથી જાણવા મળી હતી.

સોખડાની કંપનીમાં ગેસ ગળતરથી કર્મચારીનું મોત

આણંદ

ખંભાત તાલુકાના પાધરીયા વિસ્તારમાં રહેતા મહિપતસિંહ તખતસિંહ સિંધા સોખડા ખાતે આવેલ કરૂણ ઈન્ટરમીડિયેટ પ્રા.લિમિટેડ કંપનીમાં નોકરી કરતા હતા. જેઓ રાત્રિના સુમારે કંપનીમાં ફરજ ઉપર હાજર હતા ત્યારે ક્લોરિન ગેસના ગળતરને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જેથી ફરજ પરના સાથી મિત્રો દ્વારા તેઓને સારવાર અર્થે લઈ જવાયા હતા. જો કે મહિપતસિંહને સારવાર મળે તે પહેલા જ તેઓનું મરણ થઈ જવા પામ્યું હતું. યુવકને કાર્ડિયાક સેન્ટર ખાતે લઈ ગયા હોઈ ગ્રામજનોના ટોળેટોળા ત્યાં ઉમટી પડ્યા હતા. દરમિયાન આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જનરલ હોસ્પિટલ ખાતે આ મૃતક યુવકનું પી.એમ. કરવામાં આવ્યું હતું.



UNLOCK HIDDEN GEMS IN REAL ESTATE

CALL US TO FIND PROPERTY WITH POSITIVE CASH FLOW

ZIVASA
Realty Inc., Brokerage

647.972.1000

www.zivasa.com



Bhagat Dhull



Bharat Batra



Harit Gaba



Himanshu & Anshu Batta



Rajiv Arora



Rajesh Khurana
Broker

ડ્રગ્સનું ઉત્પાદન ઝડપાતા ફાર્મા-કેમિકલ કંપનીઓ પોલીસના રડારમાં

ડ્રગ્સ શોધવા પોલીસે હવે બાતમીદારોને સક્રિય કર્યા : વડોદરા નજીક 2151 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું

વડોદરા

પાનોલી અને સાવલી તાલુકામાં ડ્રગ્સનું ઉત્પાદન થતી કેક્ટરીઓ ઝડપાતા હવે મધ્ય ગુજરાતમાં આવેલી કેમિકલ અથવા ફાર્મા કંપનીઓ તંત્રના રડારમાં આવી ગઈ છે. ચાર દિવસ પહેલા પાનોલી ખાતે આવેલી ઈન્ડિનિટી કંપની અને બાદમાં સાવલી તાલુકાના મોકસી ખાતેની નેક્ટર કેમ કંપનીમાં ગુજરાત એટીએસ અને સ્થાનિક એસઓજીને સાથે રાખીને પોલીસે તા.૧૬ની મળસ્કેથી મેગા સર્ચ ઓપરેશન કરી રૂ.૨૧૫૧ કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ફાર્મા કંપનીઓની આડમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરવું તેવો પ્લાન ગુજરાત પોલીસે ખૂલ્લો

કરી દીધો છે.

મધ્ય ગુજરાતની કેક્ટરીમાં ડ્રગ્સના ઉત્પાદનના પગલે આ પંથકમાં આવેલી ફાર્મા અને કેમિકલ કંપનીઓ સ્થાનિક પોલીસના રડારમાં આવી ગઈ છે. કોઈપણ કંપનીમાં ડ્રગ્સને લગતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી હોય તો કાર્યવાહી કરવા માટે હવે બાતમીદારો બનાવી સક્રિય કરી દીધા છે. માત્ર પોલીસની જ ફાર્મા કંપનીઓમાં ડ્રગ્સના ઉત્પાદન માટે જવાબદારી રહેતી નથી પરંતુ સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની પણ જવાબદારી બનતી હોવાથી પોલીસતંત્ર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ પાસેથી જરૂર પડશે તો વિગતો પણ મેળવવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

સપ્લાયરને શોધવા મુંબઈ પોલીસ સાથે ઓપરેશન

વડોદરા: વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં એસઓજી દ્વારા ડ્રગ્સના ચાર મોટા કેસ કરવામાં આવ્યા છે જે તમામ કેસોમાં મુંબઈનું કનેક્શન ખૂલ્યું છે જેથી વડોદરા એસઓજી દ્વારા મુંબઈ પોલીસ સાથે ડ્રગ્સ સપ્લાયરને શોધવા સર્ચ ઓપરેશન કરવામાં આવનાર છે. હરણીરોડની શાંતિકુંજ સોસાયટીમાંથી પકડાયેલા રૂ.૧૫ લાખના ડ્રગ્સ સાથે ગોરંગ શાહ પકડાતાં તેણે મુંબઈની વર્ષા રાઠોડ પાસે ડ્રગ્સ મેળવતો હોવાનું ખૂલ્યું હતું જેથી નવી મુંબઈ ખાતે રહેતી ડ્રગ્સ સપ્લાયર વર્ષાની ઘરપકડ કરાઈ હતી. વર્ષાની કબૂલાતને પગલે પોલીસ મુંબઈના અબ્દુલ્લાને શોધી રહી છે. આ જ રીતે ગોલ્ડન ચોકડી પાસેથી એસઓજીના પીઆઈ સી બી ટંડેલ અને આર એ પટેલે બિચ્છુ ગંગના તનવીર તેમજ પાર્થ સહિત ચાર જણાને રૂ.૮ લાખના પાર્ટી ડ્રગ્સ સાથે પકડ્યા હતા.

બોરસદ નગરપાલિકામાં વિવાદ ઠારવા ભાજપ મોવડી મંડળ મેદાને આવ્યું

આણંદ

બોરસદ નગરપાલિકાના પ્રમુખ આરતીબેન પટેલ વિરુદ્ધ પાલિકાના બાર જેટલા કાઉન્સિલરોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. જો કે અપક્ષ તથા વિરોધ પક્ષના આ કાઉન્સિલરો દ્વારા કરાયેલ અવિશ્વાસની દરખાસ્ત પાછળ સત્તાધારી ભાજપ પક્ષના કેટલાક અસંતોષી કાઉન્સિલરોનો ટેકો હોવાની વાતો વહેતી થઈ હતી. જેને લઈ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપ્યો હતો. હવે સત્તાધારી પક્ષના જ કેટલાક કાઉન્સિલરોના ઈશારે અવિશ્વાસની દરખાસ્ત કરાઈ હોવાની વાતો વહેતી થતા જિલ્લા તથા પ્રદેશ કક્ષાના અગ્રણીઓ દ્વારા તાજેતરમાં જ ભાજપના વીસ કાઉન્સિલરો સાથે ગુપ્ત બેઠક યોજી સમગ્ર મામલાને ઠારવા માટે પ્રયાસો હાથ ધરાયા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપશે : અશોક ગેહલોત

રાજસ્થાનના CM અને કોંગ્રેસના નેતાનો વડોદરામાં હુકાર

વડોદરા

શહેરમાં સયાજીનગર ગૃહ ખાતે મંગળવાર કોંગ્રેસ દ્વારા મારું બુથ મારું ગૌરવ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મધ્ય ગુજરાતના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વડોદરા આવ્યાં હતાં.

અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, કોંગ્રેસે ગુજરાતમાં યોજાયેલી ગત વિધાનસભા ચૂંટણીમાં સારી ટક્કર આપી હતી. હવે આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ પુરી તાકાતથી

ચૂંટણી લડશે. ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલો થશે. આ ચૂંટણી રસપ્રદ બનશે. ગુજરાત મોડલની પોલ ઉઘાડી પડી ગઈ છે. ગાંધીના ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ બેરોકટોક વેચાય છે. ગુજરાતની જનતા પરેશાન છે.

દેશમાં ED, IT અને CBIનું શાસન છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, મધ્ય ઝોનના પ્રભારી અને AICC સેક્રેટરી ઉષાબેન નાયડુ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવા, વગેરે હાજર રહ્યાં હતાં.

વડોદરામાં રાજસ્થાનના મુખ્યમંત્રી સામે દેખાવો થતાં 70ની અટકાયત

વડોદરા

રાજસ્થાનમાં પાણી પીવા મુદ્દે શિક્ષકના મારથી વિદ્યાર્થીનું મોત નીપજતા કડક કાર્યવાહીની માંગ સાથે વડોદરામાં સ્વયં સૈનિક દળ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા 70 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

રાજસ્થાનમાં પાણી પીવા મુદ્દે શિક્ષકે દલિત વિદ્યાર્થીને ઢોર માર મારતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. દરમિયાન મંગળવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વડોદરાના અકોટા ખાતે આવેલ સર સયાજીનગર ગૃહ ખાતે રાજકીય કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચવાના હોય સર સયાજીરાવ નગર ગૃહ ખાતે સ્વયં સૈનિક દળે વિરોધ નોંધાવ્યો હતો.

SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES

CANADA
IMMIGRATION

icccrc
IMMIGRATION CONSULTANTS OF
CANADA REGULATION COLLEGE

CRCIC
COUNCIL OF REGULATORS

Immigration Practitioner
Ami Mehta

Meet Canada's
Leading Immigration & Education
Expert !

JOB FAIR OVERSEAS
EDUCATION

FREE ONE ON
ONE SEMINAR

STUDY OR WORK
SETTLE ABROAD

📅 **28th Aug.**
Sunday

🕒 **Time**
10 AM - 6.30 PM

:- Venue :-

Fortune Park Galaxy Hotel, N.H. No. 8,
G.I.D.C (Vapi Gunjan) Vapi- 396 195, Gujarat.

REGISTER NOW +91 9825556911, +91 9428973911

: Baroda Office :
101-102 Siddharth Complex, Alkapuri

Ahmedabad Office :
Iscon Emporio Satellite

Canada Office : 499, Main St. South
Unit -94, Brampton 416-745-2466



રાજકોટના દિવ્ય રામવનનું લોકાર્પણ લોકમેળાનો પણ દબદબાભેર પ્રારંભ

રાજકોટ

રાજકોટમાં આજી ડેમ ચોકડીથી ગોંડલ હાઈવે તરફ જતા કિસાન ગૌશાળા પાસે 47 એકરની વિશાળ હરિયાળી જમીનમાં દિવ્ય રામવનના દ્વાર પ્રજાજનો માટે ખુલ્લા અને ત્યારબાદ બે વર્ષના બ્રેક બાદ રેસકોર્સમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા સાંસ્કૃતિક લોકમેળો મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રાંધણછઠના દિવસે બન્ને મહત્વના હરવાફરવાના સાંસ્કૃતિક સ્થળો ખુલ્લા મુકાતા લોકોની ભીડ ઉમટી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બન્ને સ્થળે ચાર-પાંચ મિનિટના ટૂંકા પ્રવચનમાં રામવનમાં જણાવ્યું અર્બન ફોરેસ્ટ કે જેને રામવન નામકરણ થયું છે તેનાથી શહેરોની ઓક્સીજનની જરૂરિયાત પૂરી થાય છે, છોડમાં રણછોડ, પૂષ્પમાં પરમેશ્વર આપણી સંસ્કૃતિ સાકાર થાય છે. પર્યાવરણ રક્ષા પર ભાર મુકી તેમણે કહ્યું કે આજે રાજકોટમાં 23 ઈલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કરાયું છે, રાજ્ય સરકાર જાહેર પરિવહનમાં ઈલેક્ટ્રીક વાહનો વધારવા માંગે છે.

લોકમેળાનું ઉદ્ઘાટન કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું ભારતની સનાતન હિન્દુ સંસ્કૃતિ ભગવાન શ્રી રામ અને કૃષ્ણ સાથે જોડાયેલી છે, વિશ્વભરમાં તેમની પૂજા થાય છે, મેળો કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે યોજાય છે તો રાજકોટમાં રામવન ભગવાન રામને સમર્પિત છે. લોકમેળા આપણી સંસ્કૃતિનું પ્રતિક છે, સંસ્કૃતિને જીવંત રાખે છે.



ભુપેન્દ્ર પટેલે કહ્યું- ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી બે ઘટના સાકાર થઈ, લોકમેળાએ સંસ્કૃતિને જીવંત રાખી

રેસકોર્સ અને આજી ડેમ પાસે બન્ને સ્થળે મંચ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા ઉપરાંત સરકારના મંત્રીઓ જીતુ વાઘાણી, રાઘવજી પટેલ, અરવિંદ રૈયાણી, બ્રિજેશ મેરજા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના હાજર રહ્યા હતા.

લમ્પી વાયરસનો તરખાટ યથાવત, પશુપાલકોમાં કચવાટ ભાવનગરમાં 100% રસીકરણ છતાં લમ્પીના 246 કેસ, 19 પશુના મોત

ભાવનગર

લમ્પી વાયરસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે તેથી પશુપાલકોની મૂશ્કેલી વધી છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં લમ્પી વાયરસના વધુ ૨૪૬ કેસ નોંધાયા હતા અને ૧૯ પશુઓના મૃત્યુ થયા હતાં. લમ્પી વાયરસના લક્ષણો વાયરસને અટકાવવા માટે સરકારી તંત્ર દ્વારા ૧૦૦ ટકા રસીકરણની કામગીરી કરી છે

છતાં લમ્પીના કેસ અને મૃત્યુઆંક વધતા પશુપાલકો ચિંતિત છે.

ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં લમ્પી વાયરસના વધુ ૨૪૬ કેસ નોંધાયા છે અને ૧૯ પશુના મોત નિપજયા હતાં. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ ૨૮૨૨ કેસ નોંધાયા છે અને કુલ ૨૭૪ પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ભાવનગર જિલ્લાના

ગારિયાધાર, ઉમરાળા, પાલિતાણા, સિહોર, વલ્લભીપુર, ઘોઘા, તળાજા સહિતના ૧૦ તાલુકામાં લમ્પી વાયરસના કેસ નોંધાતા પશુપાલકોમાં નારાજગી વધી રહી છે. ૧૦ તાલુકામાં ૩૨૮ ગામ અસરગ્રસ્ત છે. ગાય-બળદ સિવાય અન્ય પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાયા નથી. ગાય-બળદને શરૂઆતમાં તાવ આવે છે અને ત્યારબાદ ફોડકા થાય છે જે

લમ્પી વાયરસના લક્ષણો છે. અત્યાર સુધીમાં કુલ ૨,૨૭,૮૬૭ ગાય-બળદનુ રસીકરણ કરવામાં આવ્યું છે તેમ પશુપાલન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. લમ્પી વાયરસને અટકાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા ઘણા દિવસથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ તેમ છતાં લમ્પીના કેસ અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે તેથી પશુપાલકોમાં કચવાટ ફેલાયો છે.

328 ગામમાં વાયરસનો
કહેર : કુલ 2822 કેસ,
274 પશુના મોત

સૌરાષ્ટ્રમાં 10થી વધુ ડેમો ઓવરફ્લો ભાદરમાં એક દિવસમાં 2 ફૂટની આવક ભારે વરસાદનાં પગલે 25 જેટલાં જળાશયોમાં પાણીની આવક

રાજકોટ

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે. દસ જેટલા ડેમો ઓવરફ્લો થતા હેઠવાસનાં ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનાં બીજા નંબરનાં સૌથી મોટા ભાદર - 1 ડેમમાં પાણીની જોરદાર આવક શરૂ થતા એક જ દિવસમાં બે ફૂટ જેટલી સપાટી વધતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રનાં 25થી વધુ ડેમોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે.

વિરામ બાદ રાજકોટ સહિતનાં જિલ્લામાં

મેઘમહેરથી જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. રાજકોટ સિંચાઈ વર્તુળનાં હેઠળનાં દસ જેટલા ડેમો ઓવરફ્લો થતાં હેઠવાસનાં ગામોને એલર્ટ કરાયા છે.

રાજકોટ જિલ્લાનાં વાછપરી 70 ટકા અને મોજ 90 ટકા ભરાયો છે. ઉડ - 2 નાં 6 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે જ્યારે વેણું - 2નાં બે દરવાજા 1 ફૂટ, છાપરવાડી - 1નો એક દરવાજો એક ફૂટ, ભાદર - 2 નાં સાંજે 4 દરવાજા 3.50 ફૂટ ખોલવામાં આવતા પાંચ તાલુકાનાં ગામોને સાવચેત કરાયા છે. આ ઉપરાંત કરમાળ, સુરવો, વર્તુ - 2 , કાબરકા છલકાયા છે.

સૌરાષ્ટ્ર જાફરાબાદના પાંચ માછીમારોનું હેલીકોપ્ટરથી રેસ્ક્યૂ

રાજુલા

શનિવારે જાફરાબાદથી માછીમારી કરવા નીકળેલા માછીમારોના કાફલાની બોટનું મધદરિયે એન્જિન ફેઈલ થઈ જતાં કોસ્ટગાર્ડ અને નેવીના હેલીકોપ્ટરે દરિયા વચ્ચે બોટનું લોકેશન શોધી પાંચ માછીમારોને એરલિફ્ટ કરી બચાવી લીધા હતા. જ્યારે અન્ય ત્રણ માછીમારોને રેસ્ક્યૂ ટગ દ્વારા બંધ બોટ સાથે લાવી બચાવ્યા હતા. શનિવારે જાફરાબાદથી સુરેશભાઈ ભાલિયાની તીર્થનગરી નામની બોટમાં આઠ માછીમારો સવાર થઈને દરિયો ખેડવા નીકળ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી.

કચ્છના સૌથી ઉંચા શિખર કાળા ડુંગર પર તિરંગો લહેરાવાયો

કચ્છ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાનના ભાગરૂપે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાવડાથી કાળા ડુંગર સુધી તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા રેલી ખાવડા, દિનારા, ક્રોબાણા જેવા સરહદી ગામોમાંથી પસાર થઈ કાળા ડુંગર ખાતે સમાપ્ત થઈ હતી. કાળો ડુંગર એ કચ્છ જિલ્લાનું ખૂબ મહત્વનું અને સૌથી ઉંચું શિખર છે. ૩૦૦ મીટર લાંબા તિરંગાથી વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. આ રેલી દરમિયાન ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.



First Flight
FFCL Couriers Inc.

ડુનીયાના કોઈપણ
દેશમાં ડોક્યુમેન્ટ્સ
અને પાર્સલ મોકલવા
માટે પણ સેવા ઉપલબ્ધ

તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ

<p>1 LB \$20 વધુ દર LB ના \$6 11 LB \$55 વધુ દર LB ના \$6 23 KG \$185, વધુ દર KG ના \$10 30 KG \$230, વધુ દર KG ના \$10</p>	<p>ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે કરી આપીશું (Extra Charge)</p>
--	--

**જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની
હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ**

Brampton (West)	Scarborough	Mississauga
<p>519, Ray lawson boulevard , Unit-3, Brampton ON L6Y 0N2 Chandni Chowk Plaza, ATN Wireless Board Door Open Last Unit Ours Phone 647-761-1317, 647-657-9631 -----: MON-FRI : ----- 11.00 AM to 7.00 PM : SAT-SUN : 1.00 PM to 6.00 PM</p>	<p>WE ARE RE-OPENING 880 Markham Road, Unit-8 Main Intersection Markham Road & Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex, Phone 647-761-1317 647-657-9631 905-673-9631 -----: MON-THU : ----- 2.00 PM to 7.00 PM FRIDAY WEEKLY OFF : SAT-SUN : 11.00 AM to 6.00 PM</p>	<p>WE MOVED TO 6800 REXWOOD ROAD, UNIT - D : Phone : 905-673-9631 647-761-1317 647-657-9631 -----: SAT-SUN :----- 11.00 AM to 5.00 PM -----: MON-FRI : ----- 9.30 AM to 5.00 PM ----: WEEKENDS :---- 11.00 AM TO 5.00PM</p>

૬૪૭-૭૬૧-૧૩૧૭ www.firstflightcanada.com



**સ્વદેશ
CANADA**
Registration # 869127209
Publication Mail Agreement /
Email : info@swadesh.news

Return Undeliverable Canadian Address To :


Shree Balaji Inc.
MAILING ADDRESS
23 Lyric Road,
Brampton ON L6S 0B4.
416-996-7755

Registered Address
713, Markham Road, Scarborough M1H 2A8.

Editor & Publisher : Manoj Gandhi
Director : Nilesh Tailor
Sub Editor : Chhaya Gandhi
Montreal Bureau : Vijay Patel (514-826-7442)

GUJARAT OFFICE MAC AGENCIES : F-9, Jolly Square, Ram Chowk,
Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT (INDIA)

Designed By
Sabir Daroga
Mevada Piyush
Firoz Shaikh



બ્રહ્માસ્ત્ર ફિલ્મ જવાના ડરથી કરણની ઊંઘ હરામ

ટવીટ પર બોયકોટ બ્રહ્માસ્ત્રનો ટ્રેન્ડ શરૂ થતાં ફિલ્મ ફલોપ જવાના ડરથી કરણ બોહર ની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેણે ફિલ્મ ડાયરેક્ટર અચાન મુખર્જીને પાઠવેલી બર્થ ડે વિશમાં પણ લખ્યું છે કે બ્રહ્માસ્ત્ર માટે તે તારો જીવ રેડી દીધો છે પણ 9મી સપ્ટેમ્બરે શું થશે તે ખબર નથી. લાલસિંહ ચઢ્યા ફલોપ જવા પાછળ તેના બોયકોટનું એલાન પણ બહુ મોટાપાયે કારણભૂત હોવાનું હવે ફિલ્મ વિશ્લેષકો પણ સ્વીકારી રહ્યા છે. આથી જ કરણે ને 500 કરોડનું રોકાણ ધરાવતી બ્રહ્માસ્ત્ર વિશે ડર પેહો છે.



સ્પર્શ

FRIDAY, 19 AUGUST, 2022

09

200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ જેક્લિનને આરોપી બનાવી

મુંબઈ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 200 કરોડથી વધુના સુકેશચંદ્ર શેખર મની લોન્ડરિંગ કેસમાં બોલીવૂડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડીઝને આરોપી તરીકે દર્શાવવામાં આવી છે. ઈડીએ આ કેસમાં ચાર્જશીટ તૈયાર કરી દીધી છે અને તેમાં આરોપી તરીકે એક નામ જેક્લિનનું પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેક્લિનની તત્કાળ ધરપકડ થવાની શક્યતા નથી કારણકે હજુ ઈડીએ આ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવાની બાકી છે. એ પછી કોર્ટ ચાર્જશીટને માન્ય કરશે. જોકે, હવે જેક્લિન ભારત છોડીને વિદેશ નહીં જઈ શકે એ નક્કી છે. આ કેસમાં ભૂતકાળમાં જેક્લિનની અનેક વખત પૂછપરછ થઈ ચૂકી છે. ઈડીનો આરોપ છે કે સુકેશ ચંદ્રશેખરે ઠગાઈ તથા ખંડણીના કેસમાં જે રૂપિયા એકત્ર કર્યા હતા તેમાંથી જ તેણે જેક્લિનને કરોડો રૂપિયાની ભેટ સોગાદ આપી હતી. અગાઉ ઈડી દ્વારા જેક્લિનની સાત કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી લેવામાં આવી છે આ ઉપરાંત અગાઉ તેને મુંબઈ એરપોર્ટથી વિદેશ જતા પણ અટકાવવામાં આવી હતી.



જેક્લિન ફર્નાન્ડીઝના વકીલનો દાવો : અભિનેત્રી 'પડયંત્રનો શિકાર' બની છે

નવી મુંબઈ: બોલીવૂડની અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડીઝને મહાઠગ સુકેશ ચંદ્રશેખરના વિરુદ્ધ કરોડો રૂપિયાની મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવવામાં આવી છે. પ્રવર્તન નિદેશાલય (ED)ના અનુસાર, 36 વર્ષીય એક્ટ્રેસને સુકેશ પાસેથી 5.71 કરોડ રૂપિયાના ગિફ્ટ મળ્યા હતા. આ કેસમાં હવે વધુ એક વળાંક આવ્યો છે જેમાં જેક્લિન ફર્નાન્ડીઝના વકીલે દાવો કર્યો છે કે અભિનેત્રી કોઈના પડયંત્રનો શિકાર બની છે. મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થયાના એક દિવસ બાદ વકીલનું નિવેદન આવ્યું છે. ચંદ્રશેખરને સંડોવતા ખંડણીના કેસમાં મની ટ્રેઈલની તપાસ કરી રહેલ કેન્દ્રિય તપાસ એજન્સી ED દ્વારા દિલ્હીની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં અભિનેત્રીનું નામ આપવામાં આવ્યું છે. અદિતિ સિંહ અને ફાર્માસ્યુટિકલ કંપની રેનબેકસીના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ પાસેથી 215 કરોડ રૂપિયાની ઉચાપત કરવા બદલ દિલ્હી પોલીસે ચંદ્રશેખરની ધરપકડ કરી હતી.

રાજુ શ્રીવાસ્તવ બ્રેઈન ડેડ જેવી સ્થિતિમાં, ઈશ્વરના ચમત્કારની જ આશા



દિલ્હીમાં હાર્ટ એટેક બાદ એઈમ્સ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ લગભગ બ્રેઈન ડેડ જેવી હાલતમાં છે અને હવે ઈશ્વર કોઈ ચમત્કાર કરે તેવી પ્રાર્થના થઈ રહી છે. ગુરુવારે રાજુ શ્રીવાસ્તવના સલાહકાર અજિત સક્સેનાએ મીડિયાને જણાવ્યું હતું કે તબીબોના જણાવ્યા અનુસાર રાજુનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. તેના હૃદયની તકલીફો પણ વધી છે. પરિવારજનો પણ સમજી શકતા નથી કે આ શું થઈ રહ્યું છે. હવે ઈશ્વર કોઈ ચમત્કાર દાખવે તેવી આશા રાખવામાં આવી રહી છે. માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર રાજુના મગજના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જવાથી સોજો આવ્યો છે. તેના એમઆરઆઈમાં મગજના કેટલાક ભાગોમાં ધાબાં જોવાં મળ્યાં છે. જમમાં એક્સરસાઈઝ કરતી વખતે હાર્ટ એટેક આવ્યા બાદ પચીસ મિનિટ સુધી રાજુના મગજને આ વ ર થ ક ઓ કિ સ જ ન મળ્યો ન હતો. તેના લીધે મગજને બહુ ડેમેજ થયું છે.

ડર્ટી પિક્ચરનો બીજો ભાગ બનશે, હિરોઈનની શોધ શરૂ

મુંબઈ : વિદ્યા બાલનની ડર્ટી પિક્ચરે ભારે ધૂમ મચાવી હતી. તેનો 'મૈ એન્ટરટેનમેન્ટ ડું' ડાયલોગ ભારે લોકપ્રિય બન્યો હતો. હવે ડર્ટી પિક્ચરનો બીજો ભાગ બનવાનો છે. જોકે, તેમાં મુખ્ય રોલમાં વિદ્યા બાલન નહીં હોય. તેની જગ્યાએ નવી અભિનેત્રીની શોધ ચાલી રહી છે. ડર્ટી પિક્ચર સાઉથની બોલ્ડ હિરોઈન સિલ્ક સ્મિતાની જિંદગી પર આધારિત હોવાનું કહેવાય છે. તેમાં મુખ્ય પાત્રને નિધન પામતું બચાવાયું છે. આથી એ જ ફિલ્મની વાર્તા આગળ ધપાવી શકાય તેમ નથી. ફિલ્મની પ્રોડ્યુસર એકતા કપૂરે તેને બદલે કોઈ અન્ય હિરોઈનની

જીવનકથા પરથી બીજો ભાગ બનાવવાનું નક્કી કર્યું છે. મુખ્ય હિરોઈનના રોલ માટે કંગના રણોતનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જોકે, કંગના પોતે હાલ ઈમરજન્સીના

પોતાની રાષ્ટ્રવાદી તરીકેની ઈમેજ પર ફટકો પડવાનો ડર લાગે છે. એ પછી એકતાએ તાપસી પટ્ટુ અને કિત્તી સેનનનો પણ સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં સ્ત્રી પાત્ર જ મુખ્ય હશે અને તેની ફરતેનાં અન્ય તમામ પાત્રો ગોણા હશે. આથી બહુ પાવરફૂલ ફિમેલ સેન્ટ્રિક રોલ ભજવી શકે તેવી અભિનેત્રીની તલાશ છે. મૂળ ફિલ્મ રજત અરોરાએ લખી હતી. પરંતુ હવે હસીન દિલરુબા સહિતની મહિલા કેન્દ્રિત ફિલ્મોની લેખિકા કનિકા ધિલ્લોન પાસે બીજો ભાગ લખાવવામાં આવી રહ્યો છે.



સિંગર રાહત ફતેહ અલી ખાનને નશાની હાલતમાં બ્રેઈનને ચાહકો આઘાતમાં



નવી દિલ્હી: પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનનો એક વિડિયો વાયરલ થયો છે અને તેમાં તે નશામાં ધૂત દેખાઈ રહ્યા છે. નશાની હાલતમાં તે પોતાના મેનેજર સાથે વાત કરતા નજરે પડે છે અને તેમની આ હાલત જોઈને ચાહકો ભડકી ઉઠયા છે. આ પાકિસ્તાની સિંગરે બોલીવૂડમાં પણ ઘણા યાદગાર ગીતો ગાયા છે. તેમણે પોતાના કાકા ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનને 24મી પુણ્યતિથિ પર શ્રધ્ધાંજલી આપી હતી અને આ પોસ્ટને 24 કલાક પણ થયા નથી ત્યાં તો રાહતે નવો વિવાદ સર્જ્યો છે. વાયરલ વિડિયોમાં રાહત ફતેહ અલી ખાન પોતાના કાકા નુસરત ફતેહ અલી ખાનના ખભા પર હાથ મુકેલા દેખાય છે. એ પછી તે મેનેજર હાજી ઈકબાલ નકીબને ગળે મળીને બોલતા સંભળાય છે કે, આપણે એક છે અને એક રહીશું. પાક સિંગરની હાલત જોઈને ટિવટર પર લોકોને ચિંતા પણ થઈ હતી. વિડિયોમાં જોઈ શકાય છે કે, તેમની જીભ પણ થોથવાઈ રહી છે અને તે જોઈને ઘણાને લાગ્યું હતું કે રાહતે યો ક્ક સ નશામાં છે.

મિસિસ ફલાણીમાં સ્વરા ભાસ્કર 9 રોલમાં જોવા મળશે

મુંબઈ : અભિનેત્રી સ્વરા ભાસ્કરની મિસિસ ફલાણી નામની ફિલ્મની જાહેરાત થઈ છે. તેમાં તે એકસાથે નવ રોલમાં જોવા મળશે. સ્વરાએ ખુદ સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું પોસ્ટર પ્રગટ કરી પોતાના નવ રોલની જાહેરાત કરી હતી. આ એક મહિલા પ્રધાન ફિલ્મ હશે. ફિલ્મમાં નવ વિવિધ વાર્તાઓનો સમાવેશ હશે, ફિલ્મની દરેક વાર્તામાં સ્વરા ૩૫ થી ૪૫ વરસ સુધીની પરિણીત મહિલાના રોલમાં જોવા મળશે. અમુક વાર્તાઓમાં તે ૧૦ થી ૧૫ વરસના સંતાનની માતાના રોલમાં પણ હશે. સ્વરા ફિલ્મની દરેક વાર્તામાં મુખ્ય રોલમાં જોવા મળશે. છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડમાં એક જ થીમ પર અલગ અલગ વાર્તાઓ સાથેની એન્થોલોજી



ફિલ્મમાં એકસાથે નવ ભૂમિકા ભજવી ચૂક્યા છે. કમલા હસને દશાવતાર ફિલ્મમાં દસ રોલ ભજવ્યા હતા. તેની સરખામણીએ સ્વરાએ તો જુદી જુદી વાર્તાના અલગ અલગ પાત્રો જ ભજવવાનાં છે.



॥ संस्कृति ॥



હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર શાણેશાણ માણો !!
રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો સ્માવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.

5000 રૂપિયાથી શેરોમાં રોકાણ શરૂ કરનારા ઝૂનઝૂનવાલા પાસે 44 હજાર કરોડની સંપત્તિ

રાકેશ ઝૂનઝૂનવાલા : રોકાણકારોના અસલી હીરો

રવિવારે વહેલી સવારે રાકેશ ઝૂનઝૂનવાલાનું નિધન થઈ જતાં ભારતમાં શેરબજાર સાથે સંકળાયેલા લાખો લોકોને આંચકો લાગ્યો. ઝૂનઝૂનવાલાએ ગયા અઠવાડિયે 'અકાસા' એરલાઈન સાથે ઉડ્ડયન ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો હતો. તેના પરથી જ સ્પષ્ટ છે કે, ઝૂનઝૂનવાલાને પોતે લાંબું જીવશે એવો વિશ્વાસ હતો પરંતુ આ વિશ્વાસ સાચો ના પડ્યો. ઝૂનઝૂનવાલાની ઉંમર માત્ર ૬૨ વર્ષ જ હતી. રાકેશ ઝૂનઝૂનવાલાનો જન્મ મારવાડી પરિવારમાં થયો હતો. તેમના પિતા મુંબઈમાં ઈન્કમ ટેક્સ કમિશનર હતા. મેડિકલ ટેકનોલોજીનો વિકાસ અને ધનવાન ઝૂનઝૂનવાલાની આર્થિક સ્થિતિ જોતા તેઓ ગમે તેટલી મોંઘી સારવાર મેળવી શકે તેમ હતા. આથી અચાનક જ તેમના મોતની સમાચાર આવે તેવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. કેટલાક સમયથી તેમની તબિયત ખરાબ રહેતી હતી. અને મોટાભાગે સ્વિલ ચેરમાં રહેતા હતા.

ડાયાબિટીસને કારણે તેમના પગ સૂચી ગયા હતા. યુટ્યૂબ પર વાઈરલ થયેલા વીડિયોમાં તેઓ 'કજરા રેકજરા રે' ગીત ઉપર ડાન્સ કરવા માગે છે, પણ સ્વિલચેર પરથી ઊભા થઈ શકતા નથી, તેનો રંજ તેમના ચહેરા પર દેખાયો હતો. ઝૂનઝૂનવાલાને કેટલાક સમયથી સિગાર અને શરાબની લત લાગી ગઈ હતી. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે "હું માછલીની જેમ દારૂ પીઉં છું. જો મારી પાસે અત્યારે જેટલા રૂપિયા છે, તેના કરતાં ૧૦-૧૫ ટકા જેટલા રૂપિયા હોય તો પણ મારી જિંદગીમાં કોઈ ફરક પડશે નહીં."

હું અત્યારે જેવાં કપડાં પહેરું છું, તેવાં જ કપડાં પહેરીશ. અત્યારે જે કાર વાપરું છું, તેવી જ કારમાં ફરીશ અને અત્યારે જે દારૂ પીઉં છું તે જ દારૂ પીશ. મને લાગે છે કે મારે થોડી સંયમિત જિંદગી જીવવી જોઈતી હતી. તેમણે પોતાની જિંદગીના છેલ્લા ૬ મહિના પૈકી ૪ મહિના બ્રીચ કેન્ડી હોસ્પિટલના બિછાના પર ગુજાર્યા હતા. રાકેશ ઝૂનઝૂનવાલાના મરણમાંથી તેમના ચાહકોએ બોધપાઠ ગ્રહણ કરવાની પણ જરૂર છે.

જો કે, આ જ માણસ શેરબજારના રોકાણકારો માટે હિરો પણ છે. કોલેજકાળમાં ૫૦૦૦ રૂપિયાથી શેરોમાં રોકાણ શરૂ કરનારા રાકેશ ઝૂનઝૂનવાલાની આજે ૪૪ હજાર કરોડની સંપત્તિ છે. ઝૂનઝૂનવાલાએ શેરોમાં રોકાણમાં હંમેશા નૈતિકતા સાથે કરીને એક નવો આદર્શ સ્થાપિત કર્યો છે. ભારતમાં શેરબજારના રોકાણકારોમાં હર્ષદ મહેતા અને કેતન પારેખ જેવા લોકો પણ એક સમયે હીરો બની ગયા



હતા. જો કે, તે બંનેએ બેંકોનું કરી નાંખીને સંપત્તિ એકઠી કરી અને તેથી તેમનો કુળો ફૂટી ગયો. જયારે રાકેશ ઝૂનઝૂનવાલાએ કદીય અનૈતિકતા ના આચરી, તેથી તેમનો કુળો મોટો થતો ગયો, કદી ફૂટ્યો નહીં. શેરમાર્કેટમાં રોકાણકારોની જીભે ઝૂનઝૂનવાલાનું નામ સતત રમ્યા કરતું, ઝૂનઝૂનવાલા શેરબજારમાં શું કરે છે તેના પર સૌની નજર રહેતી હતી. તેથી બહુ મોટાવર્ગમાં તેઓ લોકપ્રિય હતા. સામાન્ય રોકાણકારો શેરબજારમાં પૈસા ગુમાવી રહ્યાં હોય ત્યારે પણ ઝૂનઝૂનવાલાની કમાણી ચાલુ રહેતી. ઝૂનઝૂનવાલાને ઘણા બિગ

પ્રાસંગિક
ધવલ શુક્લ

શેરોના ભાવ ઘટે ત્યારે ખરીદવા અને વર્ષો સુધી ધીરજ રાખવી એ તેમની ખાસિયત હતી, આ ખાસિયતે જ તેમને ભારતીય શેરબજારના જાદુગર બનાવ્યા

બુલ કહે છે પણ વાસ્તવમાં ઝૂનઝૂનવાલા બેરીશ હતા. શેરોના ભાવ ઘટે ત્યારે ખરીદવા અને ધીરજથી રાહ જોવી એ તેમની ખાસિયત હતી. આ ખાસિયતે જ તેમને ભારતીય શેરબજારના જાદુગર બનાવ્યા.

રાકેશ ઝૂનઝૂનવાલાને ભારતના કેટલાક લોકોએ વોરન બફેટ તરીકે પણ ઓળખ આપી છે. અલબત્ત, ઝૂનઝૂનવાલાનો રસ માત્ર શેરબજાર પૂરતો મર્યાદીત નહોતો. થોડા સમય પહેલાં તેમણે એરલાઈન સેક્ટરમાં પણ પ્રવેશ

કર્યો હતો. ઝૂનઝૂનવાલાએ નવી એરલાઈન કંપની અકાસા એરમાં મોટું રોકાણ કર્યું હતું. ૭ ઓગસ્ટથી આ કંપનીએ કામગીરી શરૂ પણ કરી હતી. રાકેશ ઝૂનઝૂનવાલા અને તેમની પત્ની રેખા પાસે અકાસા એર શેરમાં સૌથી મોટો હિસ્સો છે. આ એરલાઈન કંપનીમાં કુલ હિસ્સો 45.97 ટકા છે. આ સિવાય વિનય દુબે, સંજય દુબે, નીરજ દુબે, માધવ ભાટકુલી, PAR કેપિટલ વેન્ચર્સ, કાર્તિક વર્મા પણ Akasa Airના પ્રમોટર છે. રાકેશ ઝૂનઝૂનવાલા પછી આ કંપનીમાં વિનય દુબેની ભાગીદારી 16.13 ટકા છે. અકાસા એરએ

13મી ઓગસ્ટથી તેની બેંગલોર-કોચી સેવા શરૂ કરી છે. સામાન્ય માન્યતા એવી છે કે, શેરબજારમાંથી જંગી કમાણી કર્યા બાદ તેમણે આ નવું સાહસ કર્યું છે પણ હકીકત કંઈ જુદી જ છે. ઝૂનઝૂનવાલા પહેલાંથી બે સફળ કંપની ચલાવી જ રહ્યા છે. એપ્ટેક ભારતમાં વોકેશનલ ટ્રેઈનિંગ સર્વિસ આપતી ટોચની કંપની છે. એરેના એનિમેશ સહિતની બ્રાન્ડ એપ્ટેકની છે. ઝૂનઝૂનવાલાએ શેરબજારમાંથી કમાણી કરી

તેના બહુ પહેલાં એટલે કે ૧૯૮૬માં આ કંપની શરૂ કરી હતી અને ૧૯૯૯માં હંગામા ડિજિટલ મીડિયા એન્ટરટેઈનમેન્ટ કંપની બનાવી.

બાળકો માટેની હંગામા ટીવી ચેનલ અને બોલીવૂડ હંગામા વેબસાઈટ આ કંપનીની છે. ઝૂનઝૂનવાલા આ બંને કંપનીના ચેરમેન હતા. ઝૂનઝૂનવાલા શ્રીદેવીને નેશનલ એવોર્ડ અપનાવનારી ફિલ્મ ઈંગ્લીશ વિંગ્લીશના પણ નિર્માતા હતા. અલબત્ત તેમનો મુખ્ય રસ શેરબજાર જ હતો તેથી મુખ્ય ધ્યાન શેરબજારમાં રોકાણ પર જ કેન્દ્રિત કર્યું.

છેલ્લા એકાદ દાયકાથી જ તેમનું નામ સામાન્ય રોકાણકારોની જીભે રમતું થયું, બાકી ઝૂનઝૂનવાલા તો ચાર દાયકાથી રોકાણ કરતા હતા. માત્ર પાંચ હજાર રૂપિયાથી રોકાણ શરૂ કરનારા રાકેશ ઝૂનઝૂનવાલાની સંપત્તિ ૪૪ હજાર કરોડ રૂપિયા થઈ એ શેરબજારમાં રોકાણનો જ પ્રતાપ છે. વળી, આખા જીવનમાં તેઓ કોઈ વિવાદમાં ફસાયા હોય એવું બન્યું નથી. એક અપવાદરૂપ કિસ્સામાં સેબી દ્વારા બે વર્ષ પહેલા કરાયેલી ઈનસાઈડર ટ્રેડિંગની ફરિયાદ થઈ હતી.

રાકેશ ઝૂનઝૂનવાલા અને તેમનાં પત્ની રેખા બંને સામે સેબીએ તપાસ કરી તે સમયે ઝૂનઝૂનવાલાનો દાવો પોતે કશું ખોટું નહીં કર્યું હોવાનો હતો પણ વિવાદ ચળે નહીં એ માટે રાકેશ ઝૂનઝૂનવાલા અને તેમના સાથીઓએ ૩૫ કરોડ ભરીને વાતનો નિવેડો લાવી દીધો હતો. રાકેશ ઝૂનઝૂનવાલા શેરબજારને બિઝનેસ તરીકે લેતા હતા. લોકોનું કરી નાંખવા એવો વિચાર તેમનો ક્યારેય પણ રહ્યો નહીં. ઝૂનઝૂનવાલા શેરબજારના રોકાણકારો માટે એક મંત્ર મૂકતા ગયા છે. આ મંત્ર શેરબજારના દરેક રસિયાએ યાદ રાખવા જેવો છે. ઝૂનઝૂનવાલાએ શીખવ્યું કે, શેરોમાં રાતોરાત કમાણી કરીને કરોડપતિ નથી બનાવતું, પણ ધીરજપૂર્વક વર્ષો સુધી રોકાણ કરવું પડે છે.

વોરન બફેટ સહિતના વિશ્વના મહાન રોકાણકારો સતત જે સલાહ આપ્યા કરે છે તેને ઝૂનઝૂનવાલાએ બરાબર પચાવી હતી, તેનો જિંદગીભર અમલ કર્યો અને તેના કારણે જ કોઈએ ધારી ના હોય એટલી સંપત્તિ ઊભી કરી. તેમનામાં શેરબજારના આંચકાઓને પચાવવાની હિંમત પણ હતી. સેન્સેક્સની 55000 પોઈન્ટ સુધીની સફરમાં અનેક ખુવાર થઈ ગયા પણ ઝૂનઝૂનવાલા ટકી ગયા. કેમ કે તેમનામાં ધીરજ હતી.

સાયબર રિસર્ચ લેબ્સના સાયબર સિક્યુરિટી નિષ્ણાતો દ્વારા તાજેતરમાં સ્ટેગનોગ્રાફીનો ઉપયોગ કરીને સ્ટેગોમાલવેરની સંખ્યામાં વધારો નોંધવામાં આવ્યો છે. સ્ટેગનોગ્રાફી મુખ્યત્વે એક એવી પદ્ધતિ છે જેમાં સામાન્ય સંદેશ અથવા ફાઇલની અંદર ચોક્કસ રીતે ડેટા છુપાવવાનો સમાવેશ થાય છે. જેમાં ટેક્સ્ટ, ઇમેજ અને વિડિયો નો સમાવેશ થાય છે.

તેમાં કોઈ શંકા નથી કે સ્ટેગનોગ્રાફી એ માલવેરની સૌથી વધુ ટાળી શકાય તેવી અને શોધવામાં મુશ્કેલ પદ્ધતિઓ પૈકીની એક છે. એન્ટિ-વાયરસ સોફ્ટવેર અને એન્ટિ-મોલવેર સિસ્ટમ્સ જેવી ડિટેક્શન મિકેનિઝમ્સને ટાળવા માટે સ્ટેગોમાલવેર ઇમેજ સ્ટેગનોગ્રાફીનો ઉપયોગ કરે છે. ઇમેજ સ્ટેગનોગ્રાફીના ઉપયોગના પરિણામે છેલ્લા 90 દિવસમાં 1800 થી વધુ માલવેર નમૂનાઓ ઓળખવામાં આવ્યા છે.

સ્ટેગનોગ્રાફીનો ઉપયોગ કરતા કેટલાક અગ્રણી માલવેર જેમાં મુખ્યત્વે Knotweed, Web Shells, Hacking Tools: Mimikatz, Rubeus, NanoCore, RAT, AgentTesla અને XLoader સમાવેશ થાય છે.



એવું જાણવા મળ્યું છે કે .JPG+EXE માલવેરના અસંખ્ય કિસ્સાઓ બહુવિધ ખતરનાક એટેક્સના મોનિટરિંગ દરમિયાન જોવામાં આવ્યા છે. મેલીસીયસ exe ફાઇલને સામાન્ય રીતે કાયદેસર ઇમેજ ફાઇલ તરીકે છુપાવવામાં આવે છે અને તે પછી ઇમેજ સ્ટેગનોગ્રાફી ટેકનિકનો ઉપયોગ કરીને ઇમેજ ફાઇલમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. સંશોધકોએ જુલાઈ 2022 ના છેલ્લા કેટલાક અઠવાડિયામાં બે એટેક્સની જાણ કરી છે. જે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યા હતા. આ એટેક્સમાં સ્ટેગનોગ્રાફીનો ઉપયોગ સાયબર એટેક કરવા માટે માલવેર પેલોડ હાર્ડવેરમાં માટે કરવામાં આવ્યો હતો.

APT TAs દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી અસર વિશે વિવિધ અહેવાલો બનાવવામાં આવ્યા છે. exploit DB ફાઇલોનો ઉપયોગ કરીને ICS/SCADA સિસ્ટમ પર SFX ફાઇલને મુકવામાં આવે છે. આ એટેક વેક્ટર સાથે અન્ય સિસ્ટમો પર પણ એટેક કરી શકાય છે. એક્સ્ટેન્શન .SFX સાથે એક્ઝિક્યુટેબલ ફાઇલમાં સંકુચિત ડેટા હોય છે જે અમલીકરણની પ્રક્રિયા દરમિયાન અનકમ્પ્રેસ કરી શકાય છે.

SFX ફાઇલમાં બંધ કરાયેલી સંકુચિત ફાઇલોને એક્ઝિક્યુટ કરવી પણ શક્ય છે, જે TAsને આ ટેકનિક દ્વારા સરળતાથી માલવેરને એક્ઝિક્યુટ કરવાની મંજૂરી આપે છે.

સ્ટેગોમાલવેરથી કઈ રીતે બચી શકાય?

1. ખાતરી કરો કે તમે નવીનતમ એટેક્સ તકનીકોથી વાકેફ છો જે હેકર્સ ગ્રુપ દ્વારા કાર્યરત છે.
2. ખાતરી કરો કે તમારા ડેસ્કટોપ, લેપટોપ અને મોબાઇલ ફોન જે ઈન્ટરનેટથી કનેક્ટ હોય તેવા ડીવાઈસમાં એન્ટિ-વાયરસ હોવું જરૂરી છે.
3. માલવેર અથવા ટ્રોજન દ્વારા ડેટા એક્સફિલ્ટ્રેશનને રોકવા માટે નેટવર્ક લેવલ પર સિક્યુરિટી વધારવી.
4. શંકાસ્પદ ઇમેજ્સનું ખતે જ નિરીક્ષણ કરતી વખતે ફાઇલના સમાવિષ્ટો, તેમજ અસામાન્ય ફાઇલ સિગ્નેચર અને પ્રોપર્ટીસ તપાસો.
5. કોઈપણ ફાઇલ ડાઉનલોડ કરતા પહેલા એ ભલામણ કરવામાં આવે છે કે તમે વિશ્વસનીય સ્ત્રોત પરથી જ ડાઉનલોડ કરો છો.
6. પાસવર્ડ નિયમિત સમયાંતરે અપડેટ કરવા જોઈએ.
7. ખાતરી કરો કે તમે બધી લિંક્સ અને ઇમેઇલ અટેચમેન્ટ ખોલતા પહેલા તેની અધિકૃતતા ચકાસ્યા છે.
8. વાઈરસ ફેલાવતા URL, જેમ કે ટોરેન્ટ અને વેબ્સ ને બ્લોક કરવા જોઈએ.
9. ખાતરી કરો કે કર્મચારીઓની સિસ્ટમ્સ, ડેટા લોસ પ્રિવેન્શન (DLP) સોલ્યુશન્સથી સજ્જ છે.

beinghumanmj

શીર્ષક : જન્મદિન કવચિત્રી : હિના મોદી

આ જન્મદિન - સૌથી પહેલાં તો, આ હૃદયકુંડને ઉલેચી - ઉલેચી ખાલીખમ કરી દેવું છે. ને, પછી - ઠસોઠસ કવિતાઓથી ભરી દેવું છે. પણ, કોણ જાણે કેમ !? હું એ કરી શકતી નથી. હેયું ડૂસકાય છે, મન મૂરખાય છે, ચક્ષુ કરમાય છે. ને, આંગળીઓ ઘુબે છે- સમય કરતાં પહેલાં કવિતાઓ સરી રહી છે હું એને પકડી શકતી નથી કારણ જડતું નથી. અનેક હૈયાપ્રાણો હૃદયકુંડમાંથી ડોકિયું કાઢી રહ્યા છે. હું જ તરણું, હું જ ઝરણું છતાં મારું વહેવું ક્યાં છે ? હું જ જળ, હું જ તળ છતાં મારું ધબકવું ક્યાં છે ? હું જ ફૂલ, હું જ સુગંધ છતાં મારું મહેકવું ક્યાં છે ? આ ડૂસકાવું, મૂરખાવું, કરમાવું, ઘુબવું, વહેવું, ધબકવું, મહેકવુંનું ગણિત મને સમજાતું નથી. તો, પછી - કોણ છે જવાબદાર!? લીલીખમ લાગણીઓની આડમાં શેકાતી જતી હું -


એક્સરસાઈઝથી ચરબી ઉતારી ફિટ & ફાઈન બનો

વેઈટ લિફ્ટિંગ

વેઈટ લિફ્ટિંગની મદદથી અંડરઆર્મની બગલની ચરબી ગાયબ તો થશે જ સાથે જ તમારા શોલ્ડર પણ સ્ટ્રેટ થશે. આ માટે સૌ પહેલાં જમીન પર મેટ પાથરીને પીઠના બળે સૂઈ જાવ. ત્યારબાદ ડમ્બલ ઉઠાવો અને હાથને ઉપરની તરફ ઉઠાવો એ તમારા પર છે કે તમે કેટલા કિલોના ડમ્બલ ઉઠાવી શકો છો.

દોરડાં કૂદવાં

આ સૌથી સહેલું છે. બાળકો મોટાભાગે રમત રમતમાં આ એક્સરસાઈઝ કરતાં જ રહે છે. પણ તેના અનેક ફાયદા છે. એક તો તે વજન ઘટાડવામાં મદદરૂપ છે અને બીજું આનાથી તમારા બોડી મસલ્સ સ્ટ્રેચ થાય છે જેનાથી લચીલાપણું આવે છે. બસ, દોરડાંને બરાબર પકડો અને કૂદવાનું શરૂ કરો. પહેલાં ધીરે પછી સ્પીડમાં જમ્પ કરો. તેનાથી તમારા હાથ સારા મૂવ કરે છે.



પુરશીની મદદથી કરો કસરત

જિમને બદલે તમે ઘરના ફર્નિચરની મદદથી કસરત કરી શકો છો. ખુરશીની મદદથી વ્યાયામ કરવા એ બેસ્ટ રીત છે. તેનાથી હાથની ચરબી ઓછી થાય છે અને એ પરફેક્ટ શેપમાં આવે છે. એવી ખુરશી પસંદ કરો છે જે જમીનથી 2-3 ફિટ ઊંચી હોય. હાથને પાછળ વાળીને ખુરશીના આગળના ભાગ પર મૂકો અને પગને જમીન પર સીધા મૂકી હાથના જોર પર નીચે કરો.

એક્સરસાઈઝ બોલ

એક્સરસાઈઝ બોલથી તમારી ભુજાઓ, પેટ અને બેકના મસલ્સ સારા થાય છે. 20 મિનિટની એક્સરસાઈઝ તમને ફિટ એન્ડ ફાઈન રાખે છે. બસ, આ માટે જમીન પર મેટ પાથરો અને ઘૂંટણના બળે બેસી જાવ અને હાથની મુઠ્ઠી બનાવી અને એક્સરસાઈઝ બોલ પર ટકાવો. બોલ પર શરીરનું સંતુલન બનાવવા માટે મુઠ્ઠીનો ઉપયોગ કરો અને ધીરેધીરે શરીરને આગળ ધકેલો. તેના 3 સેટ લગાવો. દરેક સેટ પછી એક મિનિટનો બ્રેક લો.

કફ્તાનને ડિફરન્ટ રીતે સ્ટાઈલ કરીને મેળવો ગોર્જિયસ લુક

કફ્તાન સ્ટાઈલ છેલ્લા

થોડા સમયથી ટ્રેન્ડમાં છે. યુવતીઓ તેને

અલગ અલગ

સ્ટાઈલમાં કેરી

કરી શકે છે. આ

ટોપ ક્યારેક

ડ્રેસના રૂપમાં

તો ક્યારેક

બ્લાઉઝના

લુકમાં

સ્ટાઈલિશ

લાગે છે.

સાથે તે સુપર

કમ્ફર્ટેબલ પણ

હોય છે. એક

જ કફ્તાન

આઉટફિટને

અનેક ડિફરન્ટ

સ્ટાઈલમાં પણ

કરી શકાય છે.

જેમ કે, કફ્તાન

ટોપ કરી કરી

રહ્યાં છો તો તેમાં

ઈન્ડિયનથી લઈને

ઈન્ડો વેસ્ટર્ન તથા

વેસ્ટર્ન લુક ક્લિએટ

કરી શકાય છે.



પેન્ટની સાથે પૉર કરો

જો તમે ઓફિસમાં કફ્તાન ટોપ કેરી કરવા ઇચ્છો છો તો પેન્ટની સાથે સ્ટાઈલ કરી શકાય છે. પેન્ટની સાથે કફ્તાન ટોપ એક સેમી ફોર્મલ લુક ક્લિએટ કરે છે. એ જોવામાં સારાં લાગે છે. એની સાથે લાઇટ મેકઅપ, મિનિમલ એક્સેસરીઝ અને એલિગન્ટ હેર સ્ટાઈલની મદદથી ઓફિસ લુકને કમ્પ્લિટ કરી શકો છો.

ટોપ સાથે પેન્ટ પહેરવું જરૂરી નથી

આઉટિંગ પર જઈ રહ્યાં છો અને તમે કફ્તાન ટોપને એક સ્ટાઈલ તરીકે કેરી કરવા ઇચ્છો છો તો તેને આઉટફિટ તરીકે કેરી કરો. એની સાથે પેન્ટ કે જિન્સ પહેરવાની જરૂર નથી. તેને એક શોર્ટ ડ્રેસ તરીકે કેરી કરી શકો છો. આ લુક માટે ફૂટવેર પર વધારે ફોકસ કરો. લોંગ બુટ્સથી લઈને ગ્લેડ્સ એટરને કેરી કરી શકો છો. આ દ્વારા તમારા લુકને સ્ટાઈલિંગ બનાવી શકો છો.

ધોતી પેન્ટ સાથે કફ્તાન

જો તમે ડે ટાઇમમાં કોઈ ફંક્શનમાં કફ્તાન ટોપ પહેરવાનું વિચારી રહ્યાં છો તો ધોતી પેન્ટને સ્ટાઈલ કરી શકાય છે. ધોતી પેન્ટ સાથે કફ્તાન ડિફરન્ટ અને ખાસ લુક આપશે. સામાન્ય રીતે વ્હાઇટ અને બ્લેક ધોતી પેન્ટની સાથે કફ્તાન વધુ આકર્ષક લાગશે. આ લુકમાં સ્ટેટમેન્ટ નેકપીસ એલિગન્ટ લાગે છે.

પાર્ટીમાં પહેરો લોંગ સ્કર્ટ

સાંજના સમયે જો તમે કોઈ પાર્ટીમાં જવાના હોવ તો કફ્તાન ટોપ પહેરી શકો છો. એની સાથે લોન્ગ સ્કર્ટને પેર કરી શકો. તમે પ્રિન્ટ્સની સાથે સોલિડ્સને સ્ટાઈલ કરી શકો છો. આ લુકમાં લેયર્ડ નેકપીસ આકર્ષક લાગે છે. જો તમે નેકપીસ સ્કિપ કરી રહ્યાં હોવ તો ડેંગલ્સ એરિંગ્સ કે હૂસ તમારા લુકને ખાસ બનાવશે.

જિન્સ છે બેસ્ટ ઓપ્શન

જો તમે કેઝ્યુઅલમાં પણ તમારી સ્ટાઈલથી કોઈને ઇમ્પ્રેસ કરવા ઇચ્છો છો તો કફ્તાન ટોપની સાથે જિન્સને સ્ટાઈલ કરી શકાય છે. જો તમે જિન્સની સાથે તમારા રેગ્યુલર ટોપને કફ્તાન ટોપની સાથે સ્વિચ કરો છો તો તમારો લુક એકદમ બદલાઈ જશે. આ બદલાયેલા લુકમાં લાઇટ પેન્ટ પહેરી શકો છો.

GPAC દ્વારા સ્વાતંત્ર્ય દિન ઉજવાયો : ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ

ભારત અને કેનેડાના રાષ્ટ્રગીતનું ગાન કરી ધ્વજને સલામી અપાઈ, દેશભક્તિના ગીતો ગૂંજ્યા

ટોરોન્ટો

ગુજરાત પબ્લિક એફરસ કાઉન્સિલ ઓફ કેનેડા કેનેડામાં વસતા ગુજરાતી સમુદાયના હિત અને અવાજ માટે કાર્ય કરતી સંસ્થાના સહયોગ તથા નેતૃત્વ હેઠળ ૧૪ ઓગસ્ટ ૨૦૨૨, રવિવારના દિવસે સવારે ૧૦:૦૦ કલાકે ભારતનો ૭૬મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો.

આશરે ૨૦૦ જેટલા દેશપ્રેમી લોકો અને GPACના હોદ્દેદારોની હાજરીમાં Highfield Park, Etobicoke ખાતે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત હરિભાઈ પટેલે દેશભક્તિના ગીતો સાથે કરી હતી. ત્યારબાદ સેક્રેટરી આનંદ શાહે ભારતનું યશોગાન કરતા જૂની જાહોજલાલી યાદ કરાવી હતી. આ સાથે તેમણે ભારતને આઝાદી અપાવવામાં બલિદાન આપનારા ક્રાંતિકારીઓને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પી હતી.

કાર્યક્રમ અંતર્ગત GPACના પ્રેસિડેન્ટ રજની પટેલ દ્વારા સંસ્થાનો સવિશેષ પરિચય આપી સંસ્થાનો ઉદ્દેશ સમજાવ્યો તથા આજે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કર્યા તે દિવસને શુભ અવસર ગણાવી સૌને ગૌરવાન્વિત કર્યા હતા.



સાથે સાથે અનેક સંતોના આશિર્વાચન અને શુભ સંદેશ વાંચનમાં લેવાયા હતા.

ઓન્ટેરિઓના પ્રીમિયર ડગ ફોર્ડ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અને ઈટોબીકો નીર્ધના MP કીસ્ટી ડંકન દ્વારા પ્રસંગોચિત સંદેશ પાઠવ્યા હતા. ત્યારબાદ પ્રેસિડેન્ટ વાઈસ પ્રેસિડેન્ટ રાજેશભાઈ શાહની કામગીરી બિરદાવી હતી.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રમેશભાઈ ચોટાઈ કે જે ગુજરાતી સમાજ માટે આશરે ૫૦ વર્ષથી કાર્યરત છે અને સફળ ઉદ્યોગપતિ પણ છે

તેમના હસ્તે સેંકડો લોકોની હાજરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો.

કાર્યક્રમને આગળ ધપાવતા ભારતનું રાષ્ટ્રગીત “જન ગણ મન” અને કેનેડાનું રાષ્ટ્રગીત “ઓ કેનેડા”નું આદરપૂર્વક ગાન કરી બંને રાષ્ટ્રના ધ્વજને સલામી અપાઈ હતી. પ્રેસિડેન્ટ રજની પટેલ દ્વારા GPACના અન્ય હોદ્દેદારો વાઈસ પ્રેસિડેન્ટ રાજેશ શાહ, સેક્રેટરી આનંદ શાહ, ખજાનચી દશરથ ચૌધરી, ડાયરેક્ટર (ઈવેન્ટ) પૂર્વિન પટેલ, ડાયરેક્ટર મિલિન્દ દવે, મલય સેરશિયા અને એડવાસરી

કમિટીના સભ્ય જીગ્નેશ ઠક્કર સર્વેનું પુષ્પચ્છથી અભિવાદન કરાયું હતું. અતિથિ વિશેષ નવલ બજાજ અને સુદીપભાઈ વર્મા અને VYO Canada ના ટ્રસ્ટી કૃષ્ણકાંત શાહ પણ કાર્યક્રમમાં haajar રહ્યા હતા. જેમનું પણ પ્રેસિડેન્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

એતે દેશભક્તિના ગીતો ગાઈ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ભારતની રક્ષા કાજે શહિદ થયેલા સૈનિકોને યાદ કરાયા હતા. સેક્રેટરી આનંદ શાહે હરકાંતભાઈ પટેલનો અને આશિષ કવિનો આભાર માન્યો હતો.

ફ્રેન્ચ અથવા અંગ્રેજી સિવાયની ભાષા બોલતા કેનેડિયનોની સંખ્યામાં વધારો

એક કરતાં વધુ ભાષામાં વાતચીત કરનારાઓની ટકાવારી ૩૯થી વધીને ૪૧ ટકા થઈ

ઓન્ટેરિયો

બુધવારે જાહેર કરાયેલા નવા વસ્તી ગણતરીના ડેટા અનુસાર ૨૦૨૧માં મુખ્યત્વે અંગ્રેજી અથવા ફ્રેન્ચ સિવાયની ભાષા બોલતા કેનેડિયનોની સંખ્યા ઊંચી સપાટીએ પહોંચી છે.

સ્ટેટિસ્ટિક્સ કેનેડા અનુસાર અંગ્રેજી અને ફ્રેન્ચ મુખ્ય ભાષાઓ છે, પરંતુ ઘરઆંગણે અન્ય ભાષા બોલતા લોકોની સંખ્યા વધીને ૪.૬ મિલિયન થઈ ગઈ છે, જે વસ્તીના આશરે ૧૩ ટકા જેટલી છે. દરમિયાન, ચારમાંથી ઓછામાં ઓછો એક કેનેડિયને અંગ્રેજી અથવા ફ્રેન્ચ સિવાય ઓછામાં ઓછી એક અન્ય ભાષા બોલતા હોવાનો અહેવાલ આપ્યો હતો. સ્ટેટિસ્ટિક્સ કેનેડાના સેન્ટર ફોર ડેમોગ્રાફીના

આસિસ્ટન્ટ ડિરેક્ટર એરિક કેરોન-મેલનફ્રેને બુધવારે એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, “અમે આજે જે પરિણામો જાહેર કર્યા છે તે મોટાભાગે દર્શાવે છે કે કેનેડામાં આવું વધુ જોવા મળે છે.”

હિન્દી અને પંજાબી સહિત મુખ્યત્વે દક્ષિણ એશિયાની ભાષાઓ બોલતા કેનેડિયનોની સંખ્યામાં વધારો થવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. વધુમાં ૧૦માંથી સાત કેનેડિયન કે જેમની પ્રથમ ભાષા અંગ્રેજી કે ફ્રેન્ચ નથી, તેઓએ કહ્યું કે, તેઓ ઘરે પણ અન્ય ભાષા જ બોલે છે.

વસ્તી ગણતરીના ડેટા અનુસાર ઘણાં કેનેડિયનો પણ એક કરતાં વધુ ભાષા બોલવામાં સક્ષમ છે. એક કરતાં

વધુ ભાષામાં વાતચીત કરવામાં સક્ષમ હોવાની જાણ કરનારા લોકોની સંખ્યા ૨૦૧૬માં ૩૯ ટકાથી વધીને ૨૦૨૧માં ૪૧ ટકા થઈ ગઈ છે.

માત્ર એક તૃતીયાંશ કેનેડિયનોએ સંપૂર્ણ દ્વિભાષી હોવાનો અહેવાલ આપ્યો હતો અને લગભગ સાત ટકા લોકોએ કહ્યું હતું કે, તેઓ ત્રણ ભાષાઓ અસ્ખલિત રીતે બોલી શકે છે અને જેઓ સંપૂર્ણપણે દ્વિભાષી હતા, તેઓ અંગ્રેજી અને ફ્રેન્ચ સિવાયની ભાષાઓ બોલવા વધુ સક્ષમ હોવાનું નોંધાયું હતું.

ક્યુબેકની બહાર, બ્રિટિશ કોલંબિયા સિવાયના દરેક પ્રાંતમાં ફ્રેન્ચને તેમની એકમાત્ર સત્તાવાર ભાષા કહેનારાઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

સપ્ટે. ઈનટેક એડમિશન મેળવનારા અનેક છાત્રોને ભેરવાઈ જવાનો ડર

સપ્ટેમ્બરમાં સત્રની શરૂઆત થશે છતાં હજુ વિઝા નથી મળ્યા મુંબઈ

પાછલા થોડા સમયમાં ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડા ભણવા જવાનો કેઝ જોવા મળ્યો છે. પરંતુ કેનેડા પહોંચવાની સમગ્ર પ્રક્રિયા સરળ નથી હોતી. વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો, સપ્ટેમ્બર ઈનટેક માટે એડમિશન મેળવી ચૂકેલા હજારો વિદ્યાર્થીઓના જીવ અત્યારે તાળવે ચોંટયા છે. સપ્ટેમ્બર મહિનામાં યુનિવર્સિટીમાં સત્રની શરૂઆત થઈ જવાની છે, અને આ વિદ્યાર્થીઓને હજી સુધી વિઝા નથી મળ્યા. યુનિવર્સિટી દ્વારા સૂચના આપવામાં આવી છે કે કેમ્પસમાં હાજર થવામાં આવે અથવા તો એડમિશન કેન્સલ કરવામાં આવે અથવા તો પોસ્ટપોન કરવામાં આવે.

કેનેડાની કોલેજોમાં એડમિશનના ૩ ઈનટેક હોય છે, સપ્ટેમ્બર, જાન્યુઆરી

અને મે. કેનેડાની મોટી યુનિવર્સિટીઓ જેમ કે મેકગિલ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ટોરન્ટો, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયા, વગેરેના વિદ્યાર્થીઓ અત્યારે મુશ્કેલીમાં મૂકાયા છે. તેમણે એક વર્ષની ફી લગભગ ૪૦-૫૦ લાખ રુપિયા ચૂકવી દીધી છે.

એસડીએસની વાત કરીએ તો તેમાં વિદ્યાર્થીને બે અઠવાડિયાથી ઓછા સમયમાં વિઝા મળી જવાની જોગવાઈ હોય છે. પરંતુ તેના માટે વિદ્યાર્થીએ આખા વર્ષની ફી ફરી દેવાની હોય છે, આ સિવાય વધારાના ૧૦,૦૦૦ કેનેડિયન ડોલર પર ડિપોઝિટ કરવાના હોય છે. આઈવેટ્સની સાથે સાથે મેડિકલ ચેકઅપ પણ થઈ ગયું હોવું જોઈએ. ઈન્ટરનેશનલ એજ્યુકેશન કાઉન્સિલર પ્રતિભા જૈન જણાવે છે કે, પાછલા થોડા વર્ષોથી યુનિવર્સિટીઓ તેમજ આઈઆરસીસીદ્વારા આ ડટ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે.

સ્વાતંત્ર્ય દિન, રક્ષાબંધન અને નંદ મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

ગુજરાતી સિનીયર ગ્રુપે ઉજવ્યો તહેવારોનો ત્રિવેણી સંગમ

દેશભક્તિના ગીતોનું ગાન, સભ્યોની જન્મ અને લગ્નતિથિની ઉજવણી સાથે નૃત્યની પ્રસ્તુતિ

દામરન

ગુજરાતી સિનીયર ગ્રુપ દ્વારા ૧૩મી ઓગસ્ટના રોજ ગોરે મેડી લાઈબ્રેરી ખાતે મીટીંગ યોજાઈ હતી. આ સાથે સ્વાતંત્ર્ય દિન, રક્ષાબંધન અને નંદ મહોત્સવનો સુંદર પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો. ઉપરાંત મહેન્દ્રભાઈ અને દક્ષાબેનની ૪૪મી વેડિંગ એનિવર્સરી, ઈન્દિરાબેન પટેલની ૮૧ વર્ષગાંઠ અને શારદાબેનની વર્ષગાંઠ પણ ઉજવાઈ હતી. ત્યારબાદ મીટીંગની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. જન ગણ મન અને ઓ કેનેડા અને વિજય વિશ્વ તિરંગા ગીતનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું.

મુખ્ય અતિથિ તરીકે ઉર્મિલાબેન પધારતા પ્રમુખ દક્ષાબેને તેમનું સ્વાગત કર્યું હતું. મનુભાઈ પટેલ તથા હર્ષદભાઈ પટેલે મંડળની કાર્યવાહીને લગતા કેટલાક સૂચનો કર્યા હતા.



રસિકભાઈ રાજાએ ૨૦૨૩ માટે મેમ્બરશીપની શરૂઆત થઈ હોય, તેની માહિતી આપી હતી.

જયારે સુશીલાબેન જોષીએ વિજય વિશ્વ તિરંગા ગીત ઉપર કસરત કરાવી હતી. સ્વર્ગસ્થ રમણભાઈ પટેલને પ્રાર્થના કરી સૌ ઉપસ્થિતિઓ શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ગુજરાત ફૂડના સ્થાપક સ્વ.

વલ્લભભાઈ પટેલને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કૌશિકભાઈ પંડ્યા દ્વારા ગવાયેલા દેશભક્તિના ગીતોથી થઈ હતી. આર્મીમાં સેવા આપી ચૂકેલા નિશિધભાઈ દલાલે બેઝીસ મેડલ અને યુનિફોર્મમાં સજ્જ થઈ ભારતે કરેલી પ્રગતિની

માહિતી આપી હતી. રક્ષાબંધન અંગે સુંદર નૃત્ય રેણુકાબેન તથા તેના ગૃપે રજૂ કર્યું હતું. ત્યારબાદ મુકેશભાઈ, દીપિકાબેન અને જ્યોતિબેન દ્વારા રજૂ થયેલી નાટિકાએ સૌને ભાવવિભોર કર્યા હતા.

બ્રેકમાં હર્ષદભાઈ પટેલ અને રંજનબેન પટેલની પચાસમી વેડિંગ એનિવર્સરી હોવાથી તેમના તરફથી સૌએ મઠીયા અને પેંડા વહેંચાયા હતા. બ્રેક પછી બર્થ ડે, એનિવર્સરી અને સ્પેશિયલ એનિવર્સરી ઉજવવામાં આવી હતી. હર્ષદભાઈ અને રંજનબેનની ૫૦મી એનિવર્સરીના સંદર્ભમાં કનુભાઈ અને ગ્રુપે સુંદર ડાન્સ કર્યો હતો. નંદ મહોત્સવને અનુરૂપ સ્થાપના તેમજ સુંદર સુશોભન જ્યોતિબેન અને સુભાષભાઈએ કર્યું હતું. ધામધૂમથી ઉજવાયેલા નંદ મહોત્સવ શોભાયાત્રા, મટકી ફોડતી વખતે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

મને ના ઓળખી, વિક્રમ! હું તમારી ભારતીય પત્ની આનલ

ગતિકથી શરૂ...
રાજમાર્ગો પર દોડતી હજારો મોટરકારોના તેજલિસોટાઓ આંખોને આંજી નાખે છે. એવા જ રાજમાર્ગ પરથી કંટાળેલી એક કાર રેસિડેન્શિયલ એરિયામાં પ્રવેશી. કાર પાર્ક કરીને વિક્રમ રોજની જેમ ઝડપથી પગથિયાં ચડી પોતાના ઘરના ડોરબેલનું બટન દબાવી રહ્યો.

થોડીક જ વારમાં બારણું ખૂલ્યું. એક અજાણ્યો પણ સ્વરૂપવાન ચહેરો સ્મિત વેરી રહ્યો હતો. હાથમાં ફૂલોનો ગુચ્છો હતો. વિક્રમ સહેજ વિચારમાં પડી ગયો. સ્તબ્ધ બની બાંભરા કરતાં પણ વધુ રૂપાળી લાગતી આ સ્વરૂપવાન યુવતીને તાકી રહ્યો. એણે વિનયપૂર્વક પૂછ્યું, 'આપ કોણ છો?'

'મને ના ઓળખી, વિક્રમ ! હું તમારી ભારતીય પત્ની આનલ.' કહેતાં આનલે ફૂલોનો ગુચ્છો ધર્યો.

અને વિક્રમ ચમકી ગયો. ઘડીભર તો એને લાગ્યું કે એ મૂર્છિત થઈ જશે. પોતાની આગળ પોતાના જ ઘરમાં આનલ આ રીતે આવીને ઊભી રહેશે એ વાત માનવા તૈયાર નહોતો અને આનલ આટલી રૂપાળી ! વિક્રમના ચહેરા પરનું તેજ ઘડીકવારમાં ઝંખવાઈ ગયું. બાંભરા તો ઘરમાં જ હતી. તે ઝંખવાણો પડી ગયો. વાતચીત

કરવા માટે તે શબ્દો શોધતો હતો એટલામાં જ બાંભરા આવી ગઈ.

બાંભરાએ એને મદદ કરી, 'વિક્રમ ! આ આનલ તારી પત્ની છે. જો આ રહું તમારા લગ્નનું સર્ટિફિકેટ.'

'પણ બાંભરા...!' વિક્રમ કાંઈક બોલવા જતો હતો પણ એ બોલી શક્યો નહીં. કાપો તો લોહી પણ ના નીકળે એવી એની દશા હતી.

વિક્રમ વધુ મૂંઝવણમાં ના મુકાય એટલે તે ઊભી થઈ. એણે સૂટકેસ તૈયાર જ રાખી હતી. સૂટકેસ હાથમાં પકડીને એણે ચાલવા માંડ્યું.

વિક્રમે પૂછ્યું, 'ક્યાં જાય છે, બાંભરા?'

'ક્યાંક... પણ હવે એ પ્રશ્ન તારો નથી. મારો છે. હું ક્યાં જાઉં છું એ તારે જોવાનું નથી. હું તો જાઉં છું. બસ, તારા પર સાચો અધિકાર આનલનો છે. એને દુઃખી ના કરતો ને મારી શોધ પણ ના કરીશ.'

બસ એટલું બોલીને બાંભરા ઘરની બહાર નીકળી ગઈ. થોડીક જ વારમાં ટોચેટો કારનો ઘુરકાટ પણ બંધ થયો. વિક્રમ બારણામાંથી પાછો ફર્યો.

એ ભાંગી પડ્યો હતો. પણ આનલે એને સંભાળી લીધો. વિક્રમના ગળામાં હાથ પરોવીને બોલી, 'વિક્રમ ! જે કાંઈ થવાનું હતું તે થઈ ગયું. મને જે કાંઈ વીત્યું હું ભૂલી

જવા તૈયાર છું. મને તો મોડે મોડેય મારો પતિ મળ્યો ને... બસ. મને હવે સંતોષ છે. મારો પુરુષાર્થ સફળ થયો એનો મને આનંદ છે. હું બાંભરા જેવી જ બનીને તારી સાથે રહીશ. બાંભરાની જેમ જ તને સાચવીશ. વિક્રમ ! તું મને તારી સાથે રાખીશ ને !'



વિક્રમ ભાવવિભોર બની ગયો. એની આંખોમાં પશ્ચાત્તાપનાં આંસુ ઊભરાતાં હતાં. આનલ એના ગળે

વળગી આંસુ લૂછી આપતી હતી અને વિક્રમે આનલના માથે એના સુંદર કાળા વાળમાં હાથનાં આંગળાં પરોવી દીધાં. આનલ એને બાઝી રહી. પછી તો આનલ અને વિક્રમે પોતાનો રૂડો સંસાર નવેસરથી શરૂ કર્યો. ઈતિહાસને ભૂલી જઈને એક નવા ઈતિહાસનું સર્જન

એક દીકરી અવતરી. આનલને સુંદર કેશ હતા. નાનકડી દીકરી પણ નાનકડી આનલ જેવી જ લાગતી હતી. એટલે બેઉએ મળીને એનું નામ પણ સુકેશી એવું રાખ્યું. પણ કુદરતની કૂરતા તો જુઓ, સુકેશી ૧૪ વર્ષની થઈ ને એક દિવસ સ્કૂલેથી ઘરે જ ના આવી. આનલ અને વિક્રમ બહાવરાં બની ગયાં. તેમણે ઠેર-ઠેર તપાસ કરી પણ સુકેશી ક્યાંય ના જડી. ભારે તપાસને અંતે એટલી ખબર પડી કે તે કોઈ અમેરિકન છોકરા સાથે ભાગી ગઈ છે.

આનલ અને વિક્રમ ફરી ભાંગી પડ્યાં. વિક્રમને તો સુકેશી ખૂબ જ વહાલી હતી. વિક્રમ ગમે તેટલો મોડો આવે તે સુકેશી સાથે વાતો ના કરે ત્યાં સુધી સુકેશી ઊંઘતી નહીં. તે ખરીદી લાવતો. તે આટલી મોટી થઈ તોયે જાતજાતની ચોકલેટો ખરીદી લાવતો.

આનલના વિક્રમ સાથે લગ્ન ૧૯૮૦માં થયાં હતાં. ૧૯૮૭માં આનલે અમેરિકા જઈ વિક્રમને શોધી કાઢ્યો હતો. વિક્રમ આનલના જીવનમાંથી બાંભરા કાયમ માટે ક્યાંક ચાલી ગઈ. ૧૯૮૮માં આનલે પુત્રી સુકેશીને જન્મ આપ્યો.

તે ૧૪ વર્ષની થઈ ત્યારે જ ઘર છોડી ભાગી ગઈ હતી. એ વાતને વર્ષો થયાં. પરંતુ ઘણાં

વર્ષો બાદ શિકાગોથી બહેન રેખાનો ફરી પત્ર આવ્યો. તેણે લખ્યું હતું, 'જેમનું જીવન માંડ થાળે પડ્યું હતું તેવા વિક્રમ-આનલને જે ખૂબ જ પ્રિય હતી એવી પુત્રી અચાનક ચાલી ગઈ. વિક્રમ માટે અસહ્ય હતું. ત્યારે શોધખોળ બાદ આજ સુધી સુકેશીનો પત્તો લાગ્યો નથી. આ વાતને પણ વર્ષો વીત્યાં. પરંતુ વિક્રમ હજી યે કોક દિવસ ઠેર-ઠેર તપાસ કરી પણ સુકેશી ક્યાંય ના જડી. ભારે તપાસને અંતે એટલી ખબર પડી કે તે કોઈ અમેરિકન છોકરા સાથે ભાગી ગઈ છે. આનલ અને વિક્રમ ફરી ભાંગી પડ્યાં. વિક્રમને તો સુકેશી ખૂબ જ વહાલી હતી. વિક્રમ ગમે તેટલો મોડો આવે તે સુકેશી સાથે વાતો ના કરે ત્યાં સુધી સુકેશી ઊંઘતી નહીં. તે ખરીદી લાવતો. તે આટલી મોટી થઈ તોયે જાતજાતની ચોકલેટો ખરીદી લાવતો. આનલના વિક્રમ સાથે લગ્ન ૧૯૮૦માં થયાં હતાં. ૧૯૮૭માં આનલે અમેરિકા જઈ વિક્રમને શોધી કાઢ્યો હતો. વિક્રમ આનલના જીવનમાંથી બાંભરા કાયમ માટે ક્યાંક ચાલી ગઈ. ૧૯૮૮માં આનલે પુત્રી સુકેશીને જન્મ આપ્યો. તે ૧૪ વર્ષની થઈ ત્યારે જ ઘર છોડી ભાગી ગઈ હતી. એ વાતને વર્ષો થયાં. પરંતુ ઘણાં

પત્ર અહીં પૂરો થાય છે. જીવનમાં ઉતાર-ચઢાવ અને સુખ-દુઃખ આવતાં જ હોય છે. એનું નામ જ જીવન છે.

દેવેન્દ્ર પટેલ
સંપર્ક
+91 98792 07102

AASTHA CULTURAL GROUP
PROUDLY PRESENTS
GANESH MAHOTSAV-2022
You all are cordially invited to take part in Ganesh Mahotsav 2022

Ganesh Sthapana : on Wednesday 31st August 2022
Time : 12:30pm
Daily Aarti Morning : 10:00am
Evening Aarti : 8:00pm
Visarjan : Sunday 4th, September 2022
Time : 11:00am
Attraction : Garba after Mahaprasad on Saturday 3rd September
Famous "Navrang" Group : Harry Patel
Place : Shree Radha Krishna Temple
1960 Ellesmere Road Unit 9
Scarborough ON M1H 2V9
Tel : 416-431-3311

For, More information Please Contact :
Vijay Patel : 647-606-1900 Yogesh Thaker : 647-995-7989
Krishna Parekh : 416-602-4349 Rajesh Brahmhatt : 647-405-1509

Sri Radha Krishna Temple
1960 Ellesmere Road Unit 9 Scarborough ON M1H 2V9
srkt2000@gmail.com 416-431-3311 www.sriradhakrishnatemple.ca

અભિનંદન !
તમામ ગુજરાતી પરિવારોના માત્ર અને માત્ર અંગેજી ભાષા સમજનાર સંતાનો અને સ્નેહીજનો માટે શ્રી રાધા-કૃષ્ણ મંદિર તરફથી વાસ્તવિક જીવનને પ્રતિબિંબિત કરતા અને જીવનને પ્રગતિના રસ્તે લઈ જતા ક્રાંતિકારી પુસ્તકનું અદ્યતન પ્રકાશન હવે ઉપલબ્ધ છે. આ પુસ્તકની નકલ મેળવવા અને પુસ્તકને સ્પોન્સર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય કમાવવા આજે જ સંપર્ક કરો :
શ્રી શર્માજી (ફોન નં. : ૪૧૬-૪૩૧-૩૩૧૧)

Parents: Our Treasure

Sri Radha Krishna Temple
(The Canadian Hindu Mission Centre Scarborough)
(Registered Charity # 86219 011RR0001)
1960 Ellesmere Rd Unit 9 Scarborough Ontario M1H 2V9
Tel: 416-431-3311 Email: srkt2000@gmail.com

FOREWORD
"Parents : Our Treasure" is a wonderful and very valuable collection of great firsthand experience and priceless thoughts and comments of Parents and Grandparents themselves in an interesting sequence. Particularly for the children and grand children of the immigrant children of the immigrant families living abroad, this book is an eye opening as well as soul searching and thought provoking masterpiece written by Sh. Niranjan Shah. The best part of this book is that you can open the book on any page and read as much you want to read at a time.

Parents and Grandparents are our Precious and Priceless Treasure, Cherish and treasure your time with your parents. Treasure your parents and grandparents in time, lest it is too late. Parents and Grandparents are inspiration. They sow the seeds of greatness. They are the most special and loveliest people on the earth, or in the three worlds for that matter. They guide, they inspire, they encourage, they love you even if you are wrong. Don't imagine life without their Ashirvad (blessings). Parents and Grandparents are a family's greatest assets and should be honoured, valued and celebrated for everything they have done and for what they are.

Specially for the immigrant families Parents and Grandparents are a strong and stable foundation for keeping family together. They are trunks of the family tree and heritage. They have a wealth experience, skills and wisdom of life. You have to overcome the challenge of the long-distance relationship in foreign countries and in the home country. Even if the grandparents live here or in India, visit them often and ignore the cultural gap and language barrier.

Foster a healthy positive relationship between grandparents and grandchildren. Create opportunities as possible for grandparents to spend their quality time with their grandchildren. Encourage grandchildren to know and love their grandparents, before it is too late.

Prof. Ratnakar Narale Parent and Grandparent, Toronto, Canada.

બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવતાં 11 દોષિતો મુક્ત

2002માં પરિવારના સાત સભ્યોની હત્યા અને ગેંગરેપ થયો હતો

અમદાવાદ

ગુજરાતમાં ગોધરાકાંડ દરમિયાન બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં દોષિત ઠરેલા તમામ 11 દોષિત કેદીઓને સ્વતંત્રતા દિવસે મુક્ત કરવામાં આવ્યા છે. સોમવારે આ લોકો ગોધરા સબ જેલમાંથી બહાર આવ્યા હતા. ગુજરાત સરકારે તેની માફી નીતિ હેઠળ રિલીઝ કરવાની મંજૂરી આપી હતી.

3 માર્ચ 2002ના રોજ દાહોદ જિલ્લાના રણધિકપુર ગામમાં બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા

કરવામાં આવી હતી. જ્યારે ગુનો આચરવામાં આવ્યો ત્યારે બિલ્કીસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી. રાધેશ્યામ શાહી, જસવંત ચતુરભાઈ નાઈ, કેશુભાઈ વદાનિયા, બકાભાઈ વાડાનિયા, રાજીવભાઈ સોની, રમેશભાઈ ચૌહાણ, શૈલેષભાઈ ભટ્ટ, બિપિનચંદ્ર જોષી, ગોવિંદભાઈ નાઈ, મિતેશ ભટ્ટ અને પ્રદીપ મોઢિયા સામે FIR દાખલ કરવામાં આવી હતી. આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદમાં ટ્રાયલ શરૂ થઈ. જો કે, બિલ્કીસ બાનોને ડર હતો કે

સાક્ષીઓને નુકસાન થઈ શકે છે અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા સાથે છેડછાડ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2004માં કેસને મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો.

21 જાન્યુઆરી, 2008ના રોજ, મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે આ કેસમાં 11 આરોપીઓને દોષિત ઠરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યાર બાદ બોમ્બે હાઈકોર્ટે તેની સજા યથાવત રાખી હતી. આ દોષિતોએ 18 વર્ષથી વધુ સમયની સજા ભોગવી હતી.

ન્યાય ઉપરથી મારો ભરોસો ઉઠી ગયો: બિલ્કીસ બાનોની હૈયાવરાળ

20 વર્ષ પહેલાની પીડા ફરી તાજી થઈ હોવાની મહિલાની કેફિયત

અમદાવાદ

ગુજરાત સરકારે ગત મંગળવારના રોજ 2002માં થયેલા ગોધરા કાંડ દરમિયાન બિલ્કીસ બાનો સાથે ગેંગરેપ કરનારા તમામ 11 દોષિતોને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ બિલ્કીસ બાનોનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. બિલ્કીસ બાનોએ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા તેના કારણે પોતાનો ન્યાય પ્રત્યેનો વિશ્વાસ ખળભળી ઉઠ્યો છે તેમ જણાવ્યું હતું.

બિલ્કીસ બાનોએ જણાવ્યું કે, '2 દિવસ પહેલા, 15 ઓગસ્ટ 2022ના રોજ પાછલા 20 વર્ષની પીડા ફરી ઉભરી આવી. જ્યારે મેં સાંભળ્યું કે, જે

11 દોષિતોએ મારા પરિવાર અને મારી જિંદગીને તબાહ કરી નાખી હતી તથા મારી 3 વર્ષની દીકરીને મારા પાસેથી છીનવી લીધી હતી, તે આઝાદ થઈ ગયા છે.' 'મારા પાસે કહેવા માટે શબ્દ નથી બચ્યા. હું સ્તબ્ધ છું. હું ફક્ત એટલું જ કહી શકું કે- કોઈ મહિલા માટે ન્યાય આ રીતે પૂરો કરી રીતે થઈ શકે? મેં આપણાં દેશની સર્વોચ્ચ કોર્ટ પર વિશ્વાસ મુક્યો, મેં સિસ્ટમ પર વિશ્વાસ મુક્યો અને હું ધીમે-ધીમે આ મોટા 'આઘાત' સાથે જીવવાની આદત પાડી રહી હતી. આ દોષિતોને મુક્તિ મળી એ કારણે મારા જીવનની શાંતિ છીનવાઈ ગઈ છે અને મારો ન્યાય પરથી વિશ્વાસ ડગમગી ગયો છે.'

નક્લી પોસપોર્ટ પર ઓસ્ટ્રેલિયા ફરી પરત આવેલી મહિલા અમદાવાદ એરપોર્ટથી પકડાઈ

અમદાવાદ

મોટેરામાં દેવપ્રયાસ સોસાયટીમાં રહેતા અમદાવાદ એસવીપીઆઈ એરપોર્ટ ઉપર ઇમીગ્રેશન વિભાગમાં ફરજ બજાવતા યાકીસ્વરૂપ કટારીયાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જોતાણા ગામના ભારતીબહેન જયેશભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે કે બુધવારે રાતે ૧૧.૩૦ વાગે સિંગાપોર એરલાઈન્સ ફ્લાઈટમાં મહિલા ઓસ્ટ્રેલિયાથી આવી રહી હતી. ચેકિંગ વખતે શંકા જતાં અધિકારીએ તેમની પાસે આધાર પુરાવા માગ્યા હતા જેથી ખબર પડી કે મહિલા પાસે જે પાસપોર્ટ હતો તેમાં મુંબઈ બ્રાન્ડા રોડ ઉપર ચિંબાઈ રોડ ઉપર ગંગાઈ બિલ્ડીંગમાં રહેતા રૂઢી મુસફર રાજપરના નામે પાસપોર્ટ હતો અને આ પાસપોર્ટમાં પકડાયેલી મહિલાનો ફોટો લગાડેલો હતો.

જામનગરમાં વીર શહીદનો શ્રદ્ધાંજલ આપવાની પરંપરા

ગુજરાતમાં ૫૦૦૦ રાજપૂતોનું પ્રદર્શન તલવાર બાજુમાં વિશ્વવિક્રમ સર્જાયો

જામનગર

ભૂયરમોરી ખાતે ખેલાયેલા આશરો ધર્મના યુદ્ધ દરમિયાન રાજપૂત સહિત જ્ઞાતિના અનેક વીર શહીદ થયા હતાં. જેને હાલાર પંથકના રાજપૂત સમાજ દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. જેના ભાગરૂપે છેલ્લા ૩૦ વર્ષથી ભૂયરમોરી શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે. શીતળા સાતમના રોજ ક્રોલ ભૂયરમોરી ખાતે ૩૧માં ભૂયરમોરી શહીદ શ્રદ્ધાંજલિ

સમારોહમાં ૫૦૦૦ રાજપૂત યુવાઓએ સવારે ૧૦ વાગ્યાથી ૧૧ મિનિટ સુધી તલવારબાજી કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં સ્થાન મેળવવા બદલ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સની નરિક્ષણ ટીમના અશ્વિન ત્રિવેદી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મંત્રી જાડેજા, ડો. જયેન્દ્રસિંહ જાડેજા, સહિત અગ્રણીઓ, યુવાઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણી: AAPની વધુ 9 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર

અમદાવાદ

વિધાનસભા ચૂંટણીના અનુસંધાને આપને ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ભાજપ-કોંગ્રેસની પહેલા જ 10 ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. જેમાં સૌરાષ્ટ્રની 4, મધ્ય ગુજરાતની 2, ઉત્તર ગુજરાતની 3 અને દક્ષિણ ગુજરાતની 1 બેઠકના ઉમેદવારોના નામ જાહેર થયા હતા જ્યારે બીજી યાદીમાં યાદીમાં 1. રાજી કરપડા, ચોટીલા, 2. પિયૂષ પરમાર, માંગરોળ (જૂનાગઢ), 3. કરસનભાઈ કરમૂળ, જામનગર ઉત્તર, 4. નિમિષા ખૂંટ, ગોંડલ, 5. પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર, ચોર્યાસી (સુરત), 6. વિક્રમ સોરાણી, વાંકાનેર, 7. ભરત વખાલા, દેવગઢ બારિયા, 8. જેજે મેવાડા, અસારવા, 9. વિપુલ સખિયા, (ધોરાજી)ના નામ જાહેર કરાયા હતા.

ગુજરાતમાં ચાલુ સીઝનનો 84 ટકા વરસાદ ખાબક્યો : છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ

41 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ : કપરાડામાં 127, ધરમપુરમાં 103 ઈંચ નોંધાયો

અમદાવાદ

ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યારસુધી સીઝનનો ૮૪.૨૬ ટકા વરસાદ નોંધાયેલો છે. છેલ્લા ૮ વર્ષમાં રાજ્યમાં ૧૪ ઓગસ્ટ સુધી નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી ૧૨.૧૮ ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર ૩૬.૮૪ ટકા વરસાદ નોંધાયો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે



વરસાદનું પ્રમાણ બમણાથી પણ વધુ છે. આ વખતે રાજ્યના ૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયેલો છે. ગુજરાતમાં આ વખતે સરેરાશની

રીતે કચ્છમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષે ૧૪.૫૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૩૨ ટકા વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૫ ઈંચ સાથે મોસમનો ૮૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૧.૧૨ ઈંચ સાથે મોસમનો ૭૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૧.૧૫ ઈંચ સાથે મોસમનો ૭૫ ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં ૨૩ ઈંચ સાથે મોસમનો ૭૩ ટકા વરસાદ નોંધાયો છે.

મણિનગર સ્વામિનારાયણ મંદિરની જમીન પચાવી પાડવા મોટું ષડયંત્ર

અમદાવાદ

સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી તરીકે અમદાવાદના સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓએ 4 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઘોડાસર સ્મૃતિ મંદિરની પાસે આવેલી જમીન પચાવી પાડવાના ઈરાદાથી ખોટા વેચાણ કરાર કરાવી પાવર ઓફ એટર્ની આધારે રજીસ્ટર વેચાણ કરાવી તેમજ મંદિરના ટ્રસ્ટીની ઓફિસ ખાતે જઈને ટ્રસ્ટીને અને સંતો મહંતોને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ તપાસ હાથ ધરી છે. અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા અને મણિનગર ખાતે આવેલ

સ્વામિનારાયણ મંદિરમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત હરજીવનભાઈ પટેલ નામના 71 વર્ષીય વૃદ્ધ મણિનગર પોલીસ સ્ટેશનમાં તુષાર પટેલ, શમીમબાનુ અન્સારી, મઝહર અબ્બાસ બુખારી અને સહેનાજ બાનુ બુખારી સામે ફરિયાદ નોંધાવી છે. સ્વામિનારાયણ ટ્રસ્ટની માલિકીની જમીન ઘોડાસરમાં સ્મૃતિ મંદિર પાસે આવેલી છે, જે જમીનમાં આરોપીઓએ ખોટા હક દાવા લખાણો ઊભા કરી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો છે. તેમજ ફરિયાદીને સમાધાન કરવા માટે ધમકીઓ આપી હતી.

અમદાવાદ શહેરમાં એક અઠવાડિયામાં કોલેરાના નવ કેસ નોંધાતા તંત્ર સતર્ક

અમદાવાદ

અમદાવાદ શહેરમાં સતત વરસી રહેલા વરસાદ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની વધતી જતી ફરિયાદનો સમયસર નિકાલ કરવામાં આવતો ના હોવાની વ્યાપક ફરિયાદોની વચ્ચે માત્ર એક અઠવાડિયામાં કોલેરાના નવ કેસ નોંધાતા મ્યુનિસિપલ હેલ્થ વિભાગ સતર્ક બની ગયું છે. ૧૩ દિવસમાં ઝાડા ઉલટીનાં ૫૨૧ કેસ નોંધાયા હતા. ઓગસ્ટ મહિનામાં તપાસ બાદ ૩૨ સેમ્પલ અનફાઇટ જાહેર કરવામાં આવ્યા છે. ૧૩ ઓગસ્ટ સુધીમાં શહેરમાં મેલેરિયાના ૭૯, જેરી મેલેરિયાના આઠ, ડેન્ગ્યુના ૭૬ અને ચિકનગુનિયાના ૧૧ કેસ નોંધાયા છે.

હાઈકોર્ટમાં ગુજરાતીને સત્તાવાર રીતે માન્ય ગણવા માટે માંગણી

અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટની કોર્ટ પ્રોસીડીંગ્સ ચલાવવા માટે અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતી ભાષાને પણ સમાવિષ્ટ કરવા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશને ગુજરાતના રાજ્યપાલને એક પત્ર પાઠવી માંગણી કરી છે. એસોસિએશન તરફથી ભારતીય બંધારણની કલમ-૩૪૮(૨) હેઠળ ગુજરાતી ભાષાને હાઈકોર્ટની સત્તાવાર ભાષા બનાવવા પણ માંગણી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા રાજ્યપાલને ઉદ્દેશીને પાઠવાયેલા પત્રમાં

એવી રજૂઆત કરાઈ છે કે, ભૂતકાળમાં રાષ્ટ્રપતિએ મંજૂરી આપેલી છે કે બંધારણની જોગવાઈ મુજબ રાજ્યપાલને સત્તા છે કે, રાજ્યમાં સરકારી કામકાજના હેતુ માટે સત્તાવાર રીતે તેઓ હિન્દી કે અન્ય કોઈપણ પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે. જેમાં, હાઈકોર્ટની કામગીરીનો પણ સમાવેશ થાય છે. ગુજરાત હાઈકોર્ટ રૂલ્સ-૧૯૮૩ના વિવિધ નિયમોના લીધે પક્ષકાર કે વકીલોએ કેસ સાથે સંકળાયેલા વિવિધ દસ્તાવેજ કે જે ગુજરાતીમાં હોય તેને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને રજૂ કરવા પડે છે.

ગુજરાત પોલીસ વિભાગ માટે 550 કરોડનું ભંડોળ મંજૂર કરતી રાજ્ય સરકાર

ગાંધીનગર

ગુજરાત પોલીસના ગ્રેડ પે પર રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સરકાર દ્વારા પોલીસ વિભાગ માટે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઈને ત્વરિત ધોરણે સમિતિની રચના કરાઈ હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠકોનું આયોજન થયું હતું. પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે.

મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી પરપ્રકોપ ચંબલ ક્ષેત્રમાં 40 ગામનો સંપર્ક તૂટ્યો

મધ્યપ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આઘએમડીની આગાહી

ભોપાલ

ઓડિશાની મહાનદીમાં આવેલા પૂરને કારણે પરિસ્થિતિ હજુ પણ ગંભીર બનેલી છે. રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે મહાનદીના જળસ્તરમાં ભારે વધારાને કારણે રાજ્યમાં 237 ગામોમાં નદીના પાણી ફરી વળ્યા છે અને તેના કારણે 1.5 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. તો મધ્યપ્રદેશમાં પણ વરસાદને લીધે પરપ્રકોપ, ચંબલ ક્ષેત્રમાં 40 ગામનો સંપર્ક તૂટ્યો છે. હવામાન વિભાગે રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. આ ભારે વરસાદને કારણે તાપમાનમાં પણ ત્રણથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો થવાની આગાહી કરાઈ છે. તે ઉપરાંત 18 ઓગસ્ટ



સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. કોંકણ અને ગોવા વિસ્તારમાં 20 તારીખ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગંગા અને યમુના નદીના જળસ્તરમાં ભારે વધારાને કારણે કછારી વિસ્તારમાં પૂરનો ખતરો વધ્યો છે.

માસ્ક ના પહેરનારા મુસાફરો પર કાર્યવાહી કરો: DGCAનો આદેશ

દિલ્હી સહિત દેશમાં કોરોનાના કેસોમાં ફરી વધારો નવો દિલ્હી



દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમિતોના દૈનિક આંકડાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણને ફેલાવતું અટકાવવા માટે ફરીથી સખ્ત પગલા લેવાનું શરૂ થઈ ગયું છે. જે અંતર્ગત એરલાઈન્સ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે, મુસાફરો વિમાનની અંદર માસ્ક પહેરીને રાખે. DGCA દ્વારા આજે કોરોનાના દૈનિક કેસોની વધતી જતી સંખ્યાને જોતા આપેલા પોતાના આદેશમાં જણાવ્યું છે કે, મુસાફરોએ નવા આદેશનું પાલન ફરજિયાત કરવું

પડશે. જો કોઈ મુસાફર માસ્ક સહિતના કોવિડ પ્રોટોકોલનું પાલન ના કરે, તો એરલાઈન્સ દ્વારા આવા મુસાફરો પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં DGCAએ જણાવ્યું છે કે, એરપોર્ટ અને ફ્લાઈટમાં મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરમાં હવે બહારના લોકો પણ મતદાન કરી શકશે

ચૂંટણી પંચના નિર્ણયથી જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષનો હોબાળો

શ્રીનગર

જમ્મુ-કાશ્મીરમાંથી કુલમ ૩૭૦ નાબૂદ થયા પછી પહેલી વખત કેન્દ્રશાસિત પ્રદેશના ચૂંટણી પંચે ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે જમ્મુ-કાશ્મીરમાં રહેતા અન્ય રાજ્યના લોકો પણ મતદાન કરી શકશે તેમ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર હદેશ કુમારે જણાવ્યું હતું. જોકે આ નિર્ણયથી વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. વધુમાં જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા સલામતી દળના જવાનોને પણ મતદાનની

મંજૂરી અપાઈ છે. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષના અંતમાં અથવા આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે ત્યારે ચૂંટણી પંચનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ નિર્ણયના પગલે જમ્મુ-કાશ્મીરમાં અન્ય રાજ્યના લોકો સહિત ૨૫ લાખ નવા મતદારો ઉમેરાશે. એવામાં જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી કમિશનર હદેશ કુમારે જમ્મુ-કાશ્મીરમાં રહેતા અન્ય રાજ્યના લોકોને પણ મતદાનનો અધિકાર આપવાની જાહેરાત કરી છે.

ગુલામ નબીએ કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

નવો દિલ્હી

જમ્મુ કાશ્મીરના રાજકારણમાં ભારે મોટી હલચલ જોવા મળી છે. દિગ્ગજ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે જમ્મુ કાશ્મીર કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. પ્રચાર સમિતિના અધ્યક્ષ પદે નિયુક્તિના અમુક કલાકોમાં જ તેમણે રાજીનામું આપી દીધું હતું. આ સાથે જ તેમણે જમ્મુ કાશ્મીરમાં પાર્ટીના રાજકીય મુદ્દાઓની સમિતિની સદસ્યતામાંથી પણ ત્યાગપત્ર આપી દીધો છે. ગુલામ નબી આઝાદે કયા કારણસર રાજીનામું આપ્યું તે હજુ સ્પષ્ટ નથી થયું.

પોલિટિકલ ન્યૂઝ

હિમાચલમાં કોંગ્રેસના પવન કાજલ, લખવિંદર રાણા ભાજપમાં જોડાયા

શિમલા : હિમાચલ પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી નજીક છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્ય પવન કુમાર કાજલ અને લખવિંદર સિંહ રાણા રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. CM જયરામ ઠાકુરની હાજરીમાં બંને ધારાસભ્યો નવો દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુરેશ કશ્યપ પણ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં કોંગ્રેસના બંને ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. બીજી તરફ ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓમાં ચાલી રહેલી વૃથાબંધી પણ સામે આવી છે.

અપહરણ કેસમાં વોન્ટેડ કાર્તિકેય સિંહ બિહારના નવા કાયદા મંત્રી બન્યા

પટના : બિહારમાં નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ છે પણ મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે પ્રથમ ગ્રાસે ૪ મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. બિહારના મંત્રીમંડળમાં કાયદા મંત્રી બનાવાયેલા કાર્તિકેય સિંહ પોતે ૪ અપહરણના કેસમાં વોન્ટેડ છે તેવો આક્ષેપ ભાજપના નેતા સુશીલ મોદી વારંવાર કરી રહ્યા છે. આ મુદ્દે ભરોઈ પડેલા નિતિશ કુમારને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, મને આ અંગે કશું ખબર નથી. જેના પર સુશીલ મોદીએ કહ્યું છે કે, જો નિતિશ કુમારને પહેલા નહોતી ખબર તો હવે તો ખબર પડી ગઈ છે તો કાર્તિકેય સિંહને તેમણે મંત્રીમંડળમાંથી પાછીચું પકડાવી દેવું ખેઈએ. કાર્તિકેય સિંહ બિહારના બાહુબલી અનંત સિંહના રાઈટ હેન્ડ છે.

હરિયાણામાં પણ નીતીશાળી થવાના અણસાર, JJPનું નિવેદન ચર્ચામાં

ચંદીગઢ : બિહારમાં નીતીશ કુમારે NDA સાથે છેડો ફાડીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ RJD-કોંગ્રેસ ગઠબંધન સાથે મળીને સરકાર બનાવી છે. ત્યારે બિહારમાં થયેલા સત્તા પરિવર્તન બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સહયોગી દળો સતત ભગવા પાર્ટી પર દબાણ બનાવવા પ્રયત્નો કરી રહ્યા હોવાનું જણાય છે. તેની અસર હરિયાણામાં પણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં ભાજપ જનનાયક જનતા પાર્ટી (JJP) સાથે મળીને સરકાર ચલાવી રહી છે. જેજેપીના પ્રદેશ અધ્યક્ષ નિશાન સિંહે વર્ષ 2024માં નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાને હરિયાણાના આગામી મુખ્યમંત્રી બનાવવાની વાત કરી છે. નિશાન સિંહે જણાવ્યું હતું કે, 'સૌ કોઈ આગળ વધવા ઈચ્છે છે અને મને તેમાં કશું ખોટું નથી લાગતું. તથા રાજ્યના દરેક પાર્ટી કાર્યકરો અને યુવાનો ઈચ્છે છે કે દુષ્યંત ચૌટાલા રાજ્યના આગામી મુખ્યમંત્રી બને.'

રાહુલ ગાંધીએ કોંગ્રેસને અસમંજસમાં મુકી, રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં વિલંબ સંભવ

નવો દિલ્હી : કોંગ્રેસ પાર્ટીએ પહેલા તો ઘોષણા કરી હતી કે, પક્ષ પ્રમુખની ચૂંટણી તા.૨૧ ઓગસ્ટથી ૨૦ સાપ્ટે. સુધીમાં સંપન્ન કરવામાં આવશે, પરંતુ ઘણા નેતાઓના પ્રયત્નો છતાંયે રાહુલ ગાંધીએ તેમનું વલણ સ્પષ્ટ નથી કર્યું, પરિણામે પક્ષ પ્રમુખની ચૂંટણી વિલંબમાં પડવા સંભવ છે. તેઓએ પોતે પણ હજુ સુધી ચૂંટણી લડવા અંગે કોઈ સ્પષ્ટ સંકેત આપ્યો નથી તેથી કોંગ્રેસ કારોબારીની બેઠક પણ બોલાવવામાં આવી નથી. આ બેઠકમાં જ ચૂંટણી તારીખ નિશ્ચિત કરવામાં આવે છે. કોંગ્રેસ ચૂંટણી ઓથોરિટી પ્રમાણે પાર્ટીએ પ્રમુખપદની ચૂંટણી માટેની તૈયારીઓ પૂરી કરી દીધી છે તેનું કહેવું છે કે, હવે દડો કારોબારીના પટમાં છે. આ પ્રાધિકરણના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રી છે તેઓ તેમ પણ જણાવે છે કે, રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા હજુ સુધી પૂરી નથી થઈ.

કાશ્મીરી પંડિતો પર વધુ હુમલાની ભીતિ સૈન્ય તેમજ પોલીસને હાઈએલર્ટ કરાવું

સુનીલ ભટ્ટના હત્યા આદિલની સંપત્તિ જપ્ત, શરણ આપનારા ત્રણ ભાઈઓની ધરપકડ

શ્રીનગર

કાશ્મીરી પંડિત સુનીલ ભટ્ટની હત્યાએ ફરી કાશ્મીરમાં પંડિતોની સુરક્ષા અંગે અનેક સવાલો ઉઠાવ્યા છે. હવે એવા અહેવાલો છે કે સરહદેથી આતંકીઓ માટે મોટા પાયે હથિયારો ઘુસાડવામાં આવ્યા છે જેનો ઉપયોગ કાશ્મીરી પંડિતોની હત્યા માટે થઈ શકે છે. હાલ રાજોરીમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો, આ દરમિયાન આતંકીઓ છટકીને ભાગી ગયા હોવાથી જમ્મુમાં સૈન્યને હાઈ એલર્ટ કરાવ્યું છે. આતંકીઓ રાજોરીના જંગલોમાં જોવા મળ્યા હતા, ત્રણ જેટલા આતંકીઓ આ વિસ્તારમાંથી છટકીને અન્ય કોઈ સ્થળે છુપાઈ ગયા છે. જેને પગલે હાલ મોટા



પાયે જમ્મુમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે. સુનીલ ભટ્ટના હત્યા આદિલની સંપત્તિ જપ્ત કરીને પોલીસે આ કેસમાં આરોપીને શરણ આપનારા ત્રણ ભાઈઓની ધરપકડ કરી છે.

મુખ્તાર અંસારી સામે ઔરોપો નિર્ધારિત થયા, 29 ઓગષ્ટે સુનાવણી

લખનઉ

યુપીના બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. લખનૌની એમપી-એમએલએ કોર્ટે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી સામે બનાવટ, શત્રુ સંપત્તિ પર કબજો અને ગેરકાયદે બાંધકામના આરોપો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આગામી સુનાવણી 29 ઓગષ્ટના રોજ થશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્તાર અંસારીને હાજર કરવામાં આવ્યા હતા. હવે વ્યક્તિગત રૂપે હાજર થવા પર મુખ્તારના હસ્તાક્ષર કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ મામલે 27 ઓગષ્ટ 2020ના રોજ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં મુખ્તાર અને તેમના પુત્ર પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

કોર્ટમાંથી ભાગી ગયેલા રેપના આરોપીની ટોળાએ ભેગા મળી હત્યા કરી

ઉત્તર લખીમપુર

આસામના લખીમપુર જિલ્લામાં બે દિવસ પહેલા કોર્ટમાંથી ભાગી ગયેલા બળાન્કાર અને હત્યાના ૪૫ વર્ષીય આરોપીની ગુરુવાર ટોળાએ ભેગા મળી હત્યા કરી હતી તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. ગરજાઈ બરુઆ ઉર્ફે રાજુ બરુઆને પોલીસે ભયજનક અપરાધી ગણાવ્યો હતો. આ અપરાધી કોર્ટમાંથી ભાગી જઈને ઘીલમાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કીલાકીલી ગામમાં સંતાયો હતો. આજે વહેલી સવારે સ્થાનિક લોકોએ તેને પકડી લીધો હતો. તેમણે પોલીસને જાણ કરી હતી પણ તેને આવવામાં મોડું થયું હતું. ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ ગઈ હતી અને તેણે આરોપીને મારવાનું શરૂ કરી દીધું હતું.



આંતર અવસરનું પર્વ એટલે “પર્યુષણ”

ક્ષમા માગવા અને ક્ષમા આપવાનું તો જગતનો દરેક ધર્મ કહે છે, કિન્તુ ક્ષમાપના માટે જ એક ખાસ દિવસનું આધ્યાત્મિક પર્વ ઊજવવાની પરંપરા માત્ર જૈન ધર્મમાં જ છે.

પર્યુષણ બાહ્ય ઉત્સવનું પર્વ નહીં, પરંતુ આંતર ઉત્સવનું પર્વ છે. તેનો મૂળ હેતુ “આત્માને શુદ્ધ કરી પરમાત્માની સમીપે પહોંચવાનો છે”
- ડૉ.કુમારપાળ દેસાઈ.

ભગવાન મહાવીરના મૂળ સિદ્ધાંત “અહિંસા પરમો ધર્મ”ના માર્ગને અનુસરવાનું છે. સૌના કલ્યાણની ભાવનાને જીવંત કરવાનું આધ્યાત્મિક પર્વ છે. આનાથી જ મોક્ષ પ્રાપ્તિ ના દ્વારે પહોંચી શકાય છે. “પર્વાધિરાજ પર્યુષણ ક્રોધ, માન, માયા અને લોભ વગેરે આંતર શત્રુઓને હટાવીને આત્માને નિર્મળ કરીને આત્માને પરમાત્મા સાથે જોડતું પર્વ શિરોમણિ પર્વ છે.
- ગજજર ઉપેન્દ્ર.

સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે જૈનો ‘મિચ્છામિ દુક્કડમ્’ કહે છે. તેનો અર્થ છે - મિથ્યા મે દુષ્કૃતમ્, અર્થાત્ મારાં તમામ દુષ્કૃત્યો મિથ્યા - ફોગટ થાવ, જગતના સર્વ જીવો સાથે મૈત્રી કરવાનું આ પર્વ છે. સંવત્સરી તો સાત્ત્વિક અને આત્મિક મૈત્રીનું પર્વ છે !
- પ્રો. નૌતમભાઈ વડીલ (ધર્મતત્ત્વ ચિંતક).

જૈન ધર્મના સર્વપ્રથમ આગળ ‘શ્રી આચારાંગ સૂત્ર’માં કહ્યું છે કે, ‘જે રીતે કેરીના હૃદયમાં છુપાયેલી ગોટલીમાં એક વિશાળ આંખનું વૃક્ષ છુપાયું છે, એ રીતે હે માનવ, તારી કાયામાં પરમાત્મા વસેલો છે, એને તું શોધી લે. આથી જ પર્યુષણને અનેક ઉપમાઓ આપી છે. જેમકે અમૃતની (ઔષધમાં શ્રેષ્ઠ), જેમ કે કલ્પવૃક્ષની (વૃક્ષમાં શ્રેષ્ઠ), જેમ કે ચંદ્રની (તારાઓમાં શ્રેષ્ઠ). જેમ સુગંધ વગર ફૂલ કામનું નથી અને શીલ વિના નારી શોભતી નથી. તેમ પર્યુષણ પર્વની આરાધના વિના સાધુ કે શ્રાવકનું કુળ શોભતું નથી. આમ, પર્યુષણ પર્વ ખરેખર મહાન છે, પર્વ શિરોમણિ છે. જગતના સર્વ જીવો સાથે મૈત્રી કરવાનું આ પર્વ છે. સાત્ત્વિક અને આત્મિક મૈત્રીનું પર્વ છે. આવી મૈત્રી વ્યહાર શુદ્ધિ અને મન શુદ્ધિ વિના પ્રાપ્ત થતી નથી. માટે જ આ પર્વને આધ્યાત્મિક પર્વ કહ્યું છે
- પ્રો. નૌતમભાઈ વડીલ (ધર્મતત્ત્વ તત્ત્વ ચિંતક).

જૈન સંપ્રદાયમાં વર્ષ દરમિયાન બે મોટા ઉત્સવો સૌથી મહત્વના મનાય છે. (1). પર્યુષણ (2). દિવાળી.

પર્યુષણને “ પર્યુષણ” પણ કહેવાય છે. પર્યુષણ શબ્દ એ પરિ+ઉષન આ બે શબ્દોથી બન્યો છે. ‘પરિ’નો અર્થ છે ચારે બાજુથી અને ઉષનનો અર્થ પ્રભુની સમક્ષ વસવાટ કરીને ધર્મની આરાધના કરવી.

પર્યુષણનો અર્થ અને માહાત્મ્ય

પર્યુષણ શબ્દનાં અનેક અર્થ, ભાવ જાણવા મળે છે. શબ્દ શાસ્ત્રનાં નિયમ પ્રમાણે એક શબ્દ વ્યુત્પત્તિ ભેદ પી, વ્યાખ્યા ભેદથી તેના વ્યાખ્યાભેદો અનેક અર્થો દર્શાવે છે. પર્યુષણની બાબતમાં પણ આવું છે. એના પણ ઘણા બધા સૂચિતાઓ છે.

પર્યુષણનો એક અર્થ નીકળે છે, ‘ પરિવસન’- એટલે કે, એક જ સ્થાન પર સ્થિર રહેવું. આમ પર્યુષણનો અર્થ ચતુર્થમાસની વર્ષાઋતુમાં એક જ સ્થળે મુકામ કરવો.

પર્યુષણનો બીજો અર્થ થાય છે, ‘પર્યુષણમન’. આ શબ્દનો ભાવાર્થ છે, સંસારમાંની અનેક પ્રકારની વ્યાધિ, ઉપાધિ વચ્ચે પણ સમતા અને શાંતિ ધારણ કરવી. સદીઓથી માનવમનમાં અનેક પ્રકારનાં કષાયો અને વિકારો છૂપાયેલા પડેલા છે. તેનું શમન કરવાનું આ પર્વ છે.

એક અર્થમાં, પરિવશન એટલે કે, નિકટ રહેવું. વ્યક્તિએ પોતાનાં આત્મભાવમાં રમણ રહેવાનું છે.

આત્માની નજીક જઈ રમણતા કેળવવાની છે. પર્યુષણમાં વર્ષાવાસ શબ્દ, સમય ગાળો સૂચવતા અર્થ માટેનો છે. પરંતુ કષાપ, સમતા અને આત્મારમણતા. આ બધાનાં ભાવવાચક અર્થો નીકળે છે. પણ અહીં શબ્દોનાં બાહ્યઅર્થને જાણવાને બદલે એની પાછળનાં ભાવાર્થને સમજવાની કોશિષ કરવી જોઈએ. પર્યુષણ શબ્દ પાછળનાં ભાવાર્થને સમજવાની કોશિષ કરવી જોઈએ.

પર્યુષણ શબ્દ પાછળનો ભાવાર્થ એ નીકળે છે કે, સાધકે સર્વ પ્રકારે આત્મભાવમાં રહેવું. પરભાવમાં, બ્રાહ્મ વિષયોમાં દોડતાં ચિત્તને વાળીને આત્મભિમુખ કરવું.

જૈન સંપ્રદાયોમાં શ્વેતાંબર અને દિગંબરમાં પર્યુષણની આરાધનાનો ક્રમ આ પ્રમાણે હોય છે. હિન્દુ પંચાંગ અનુસાર શ્વેતાંબરમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અને દિગંબર સંપ્રદાયમાં ભાદ્રપદના શુકલપક્ષમાં પર્યુષણ પર્વની આરાધના કરવામાં આવે છે. શ્વેતાંબર જૈનમાં આ તહેવાર 8 દિવસ સુધી પર્યુષણના રૂપમાં અને દિગંબર સંપ્રદાયમાં 10 (દશ) લક્ષણા પર્વ તરીકે ઊજવવામાં આવે છે. જેને દશ દિવસ સુધી મનાવવામાં આવે છે.

આ પવિત્ર દિવસોમાં બધા જિનાલયોમાં સ્નાત્ર પૂજા, પ્રભુજીની ભવ્ય આંગી અને રાત્રે પ્રભુ ભક્તિના (રાત્રિ જાગરણ)ના ભવ્ય કાર્યક્રમો યોજાય છે.

આમ ટૂંકમાં કહીએ તો પર્યુષણ પર્વ એટલે આત્મ જાગૃતિ, આત્મ ઓળખ, આત્મ (આત્મિક)આનંદ.

પર્યુષણ મહાપર્વની આરાધનાનો ઇતિહાસ

ભગવાન મહાવીરને નિર્વાણના 980 વર્ષ વીત્યા બાદ “આનંદપુર “ કે જે આજે વડનગર નામે પ્રસિદ્ધ છે તે પાવન ભૂમિમાં યુગપ્રધાન આચાર્ય કાલકસુરિ મહારાજ સાહેબે ચાતુર્માસમાં સ્થિરતા કરી હતી. તે સમયે ધર્મ આરાધક, ન્યાય પ્રિયને સદાચારી રાજવી ધ્રુવસેન રાજાની આજ્ઞા પ્રવર્તતી હતી. તેમના લાડકવાયા રાજકુંવરનું અકાળે મૃત્યુ થતાં રાજા અને સમગ્ર પ્રજા શોકમગ્ન બની ગઈ. ઘણા પ્રયત્નો કરવા છતાં રાજા પુત્ર વિયોગના શોકમાંથી મુક્ત થઈ શકતા નહોતા. આ વાત

આચાર્ય કાલકમુનિના કાને પડતાં તેમણે અથાક મનોમંથન કરીને “કલ્પસૂત્ર”નો સહારો લીધો કે જે માત્ર સાધુઓને જ ઉપલબ્ધ હતું. તેનું પ્રવચન જિનમંદિરમાં રાજા અને પ્રજા સમક્ષ કર્યું. તે દિવસથી રાજા શોકમુક્ત બની ગયો. આ દિવસથી પવિત્ર પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો.

પર્યુષણ પર્વને પર્યુષણ પણ કહે છે. શ્વેતાંબર જૈનો આ ઉત્સવની આઠ દિવસ સુધી ઊજવણી કરે છે. આ આઠ દિવસ દરમિયાન કલ્પ સૂત્રનું વાંચન કરવામાં આવે છે. જેમાં પાંચમા દિવસે ભગવાન મહાવીરના જન્મનું વાંચન કરવામાં આવે છે. ભાદરવા સુદ ચોથના દિવસે આ પર્વની સમાપ્તિ થાય છે. આ દિવસ સંવત્સરી તરીકે ઓળખાય છે.

દસલક્ષણા પર્વ દિગંબર જૈનો ભાદરવા સુદ પાંચમથી શરૂ કરી દસ દિવસ સુધી આ પર્વની ઉજવણી કરે છે. જેને દસલક્ષણા કહેવામાં આવે છે. આ દસ લક્ષણો છે ક્ષમા, માર્દવ, અર્ણવ, સત્ય, સંયમ, શૌર્ય, તપશ્ચર્યા, ત્યાગ, અસુવિધા અને બ્રહ્મચર્ય.

ઉપવાસનું મહત્વ- પર્યુષણમાં તીર્થંકરોની પૂજા, સેવા અને સ્મરણ કરવામાં આવે છે. તો સાથે જ તેમાં સૌથી વધારે મહત્વ છે ઉપવાસનું. ઉપવાસ દ્વારા વ્યક્તિ શારીરિક અને માનસિક



રીતે સ્વયંને તપસ્યા માટે સમર્પિત કરે છે. પર્યુષણમાં ઉપવાસનો સમયગાળો 1 દિવસથી લઈ 30 દિવસ સુધીનો હોય છે. જેમાં સૂર્યોદયથી લઈ સૂર્યાસ્તની વચ્ચે માત્ર ઉકાળેલું પાણી જ ગ્રહણ કરી શકાય છે.

પ્રતિક્રમણનો મહિમા

પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવું ! પર્યુષણના દિવસની શરૂઆત પ્રતિક્રમણથી જ થતી હોય છે. દરેક જૈન સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા નિત્ય બે વખત પ્રતિક્રમણ કરતા હોય છે. પણ, પર્યુષણ પર્વ દરમિયાન દરેક જૈન માટે તેની મહત્તા છે. આ સામાયિક તરીકે ઓળખાતી એક ધ્યાન વિધિનો પ્રકાર છે. જે દરમિયાન વ્યક્તિ તેના જીવનના આધ્યાત્મિક દૃષ્ટિકોણ તરફ વિચાર કરે છે. વાર્ષિક એક પ્રતિક્રમણ શ્રાવક માટે ફરજિયાત મનાય છે.

જે સંવત્સરી તરીકે ઓળખાય છે. આ સંવત્સરી ભાદરવા સુદ ચોથે ઊજવાય છે. જૈન સમુદાય માટે પવિત્ર પર્યુષણ એ સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક પર્વ છે કે જેમાં તેઓ સંયમ અને આત્મબળ દ્વારા પોતાનાં તન અને મનની શુદ્ધિ કરે છે,

મહાપર્વ પર્યુષણ એ આઠ દિવસનો તહેવાર હોય છે અને તેમાં વિવિધ નિયમોનું પાલન કરવામાં આવે છે. જેમ કે, ‘કલ્પસૂત્ર’ ગ્રંથનું પઠન કરવું, અહંભાવનો ત્યાગ કરવો, 24 તીર્થંકરોની સ્તુતિ કરવી, ગુરુવંદના કરવી, ભૂતકાળમાં કરેલા વ્રતભંગ કે વ્યવહારમાં થયેલી અનૈતિક વ્યવહારની ક્ષમાચના કરવી, જાત ઉપર નિયંત્રણ રાખી શરીરથી છુટા પડવું અર્થાત શરીરની નશ્વરતાને જાણવી, પ્રતિક્રમણ કે કોઈ નિયંત્રણ કે વ્રત કરવું. આવા વ્યવહાર પાળવાથી તન, મન, ધનથી શુદ્ધિ થઈ જાય છે તથા આ એવો સમય છે કે જે દરમિયાન સામાન્ય જન સમુદાય ટૂંક સમય માટે સાધુ જેટલી તીવ્રતાથી આધ્યાત્મનો અભ્યાસ અને તપ આદિ કરવાના પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા) કરે છે..

સાધુઓના 5 કર્તવ્યો નીચે મુજબ હોય છે

1. સંવત્સરી પ્રતિક્રમણ
2. કેશલોચન
3. તપશ્ચર્યા
4. આલોચના
5. ક્ષમાચાચના.

”આમ, પર્યુષણ પર્વ ખરેખર મહાન છે, પર્વ શિરોમણિ છે. શ્રાવકો(ગૃહસ્થો) માટે પર્યુષણ દરમિયાન પાંચ કર્તવ્યો કરવાનું શાસ્ત્ર-વિધાન છે. આ પાંચ કર્તવ્યો આ પ્રમાણે છે.

અમારિ પ્રવર્તન : કોઈને મારવું નહિ એટલે કે અહિંસા.

સ્વામી વાત્સલ્ય : સમાન ધર્મ પાળનાર પ્રત્યે સ્નેહ વહાવવો, તેની સેવા કરવી.

અહમ તપ : સળંગ ત્રણ દિવસના ઉપવાસ કરવા.

ચૈત્ય-પરિપાટી : ચૈત્ય એટલે દેરાસર, દેરાસરે જઈને પ્રભુદર્શન કરવું.

ક્ષમાપના : પોતાના દોષોનું પ્રાયશ્ચિત્ત કરીને ક્ષમા માગવી અને બીજાઓના દોષોને ઉદાર દિલે ક્ષમા આપવી.

દરરોજ સવારે ઊઠીને ‘રાઈ’ પ્રતિક્રમણ કરવામાં આવે છે, જેમાં નિદ્રા દરમિયાન અજાણતાંય પાપકૃત્ય થયું હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરાય છે. દરરોજ રાત્રે ‘દેવસિ’ પ્રતિક્રમણ કરીને દિવસ દરમિયાન થયેલાં પાપકૃત્યોનું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે. આ ન થઈ શકે તો પાશ્વિક અને ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવામાં આવે છે. એ પણ શક્ય ન હોય તો સાંવત્સરિક (વાર્ષિક) પ્રતિક્રમણ-પર્યુષણના છેલ્લા દિવસે કરવામાં આવે છે.

ક્ષમા માગવા અને ક્ષમા આપવાનું તો જગતનો દરેક ધર્મ કહે છે, કિન્તુ ક્ષમાપના માટે જ એક ખાસ દિવસનું આધ્યાત્મિક પર્વ ઊજવવાની પરંપરા માત્ર અને માત્ર જૈન ધર્મમાં જ છે.

ટૂંકમાં કહીએ તો પર્વાધિરાજ પર્યુષણનો આપણે એક જ સાર લઈએ તે એ છે કે “આત્મા રૂપે હું એકલો જ છું, કોઈપણ વસ્તુ મારી નથી અને હું કોઈનો ય નથી. મારો આત્મા જ શાશ્વત છે. બાકી આ દેહ, સ્વજનો, સંપત્તિ વગેરે તમામ પદાર્થો બાહ્ય ભાવો છે. તે તમામ મને સંયોગવશ પ્રાપ્ત થયા છે અને આ સંયોગોનું ઋણ પુરું થતાં મારાથી સઘળાં દૂર થઈ જવાનાં છે.”

એક સ્તવનમાં કહ્યું છે.

“અવતાર માનવીનો ફરીને નહીં મળે

અવસર તરી જવાનો ફરીને નહીં મળે.”

ધર્મ વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ તેમજ જિન આજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાઈ ગયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડડ..

- ડૉ.જયેન્દ્ર નાયક.
(અમદાવાદ.)

CHANGE OF NAME

I Siddika Ismail Mehtar daughter of Hanif Rashid Patel. Hanif Rashid Patel holder of Indian Passport No. K4195687. Issued at Surat Gujarat on 05/05/2012, Permanent resident of At Patel Falia Po.Manekpore Takoli, Ta.Jallapore, Navsari 396445, Gujarat, India. Presently residing at 82 Marcos Blvd M1K5B1, Scarborough, Ontario, Canada do hereby change the name from Siddikah Ismail Mehtar to Siddikah Hanif Patel with immediate effect.

- Siddika Ismail Mehtar



નામ બદલ્યું છે.

હું સીદીકા ઇસમાઇલ મેહતર તે પટેલ હનીફ રસીદની પુત્રી ભારતીય પાસપોર્ટ નંબર K4195687 ધરાવું છું. આ પાસપોર્ટ મને સુરત (ગુજરાત - ભારત) પાસપોર્ટ કચેરીથી 05-05-2012ના રોજ જારી કરવામાં આવ્યો હતો. મારું કાયમી સરનામું : AT પટેલ ફળિયું, Po. માણેકપોર ટેકોલી, તા. જલાલપોર, નવસારી - 396445 ગુજરાત - ભારત છે. હાલ 82 માર્કોસ બોલવરહ M1K 5B1 સ્કારબોરો ઓન્ટેરિયો કેનેડા ખાતે રહું છું. મેં મારું જુનું નામ સીદીકા ઇસમાઇલ મેહતર છે તે હું મારું નવું નામ સીદીકા હનીફ પટેલ કર્યું છે. જેની સંબંધિતોએ નોંધ લેવી.

- સીદીકા ઇસમાઇલ મેહતર

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ, યલો એલર્ટ જાહેર કરાયું

ઇંગ્લેન્ડના દક્ષિણ અને પૂર્વના 19 જેટલા વિસ્તારો માટે પૂરની ચેતવણીઓ જારી કરી

લંડન

હવામાન વિભાગે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરમાં વાહનવ્યવહારને અસર થવાની સાથે વીજળીની સમસ્યા સર્જવાની આશંકા વિભાગે વ્યક્ત કરી છે. જોરદાર આંધી, ગાજવીજ અને વરસાદની ચેતવણી આપી છે. દક્ષિણ ઈંગ્લેન્ડમાં સ્થિતિ વધુ ખરાબ હોવાનું કહેવાય છે. અહીં પૂરના કારણે અન્ય વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે રસ્તાઓ બંધ થઈ શકે છે. તેમજ પૂરના પાણીના જોરદાર પ્રવાહને કારણે જાન-માલને ખતરો છે. પર્યાવરણ એજન્સીએ મિડલેન્ડ અને ઈંગ્લેન્ડના દક્ષિણ-પૂર્વના 19 વિસ્તારો માટે પૂરની ચેતવણીઓ જારી કરી છે ભારે વરસાદ બાદ પૂરથી પ્રભાવિત બ્રિટનના



વીડિયો અને તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તેમાં દક્ષિણ ઈંગ્લેન્ડ અને વેલ્સના શહેરોમાં પૂરના પાણીનો સમાવેશ થાય છે. કોર્નવોલમાં ન્યુક્યે, ડેવોનમાં બિશપ ટાઉટન, વેસ્ટ સસેક્સમાં હેવર્ડ હીથ, દક્ષિણ-પશ્ચિમ વેલ્સમાં પોર્ટ ટેલ્બોટ અને ડોર્સેટના બ્રિજપોર્ટને પણ અસર થઈ હતી.

ફાન્સમાં મંકીપોક્સનો પહેલો અનોખો કેસ, માણસના સંપર્કથી શ્વાન સંક્રમિત

મેડિકલ રિસર્ચ જનરલ લેન્સેટે કેસને લઈ રિપોર્ટ પ્રકાશિત કર્યો

પેરિસ

સમગ્ર વિશ્વમાં મંકીપોક્સના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન એક ચોકાવનારી માહિતી સામે આવી છે. ફાન્સના પેરિસમાં એક કૂતરાને માણસ દ્વારા મંકીપોક્સનો ચેપ લાગ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ વિશ્વનો પ્રથમ દુર્લભ કેસ છે. મેડિકલ રિસર્ચ જનરલ લેન્સેટે આ કેસને લઈને એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. વૈજ્ઞાનિકોના મતે જો મંકીપોક્સ જુદી જુદી વસ્તીમાં ફેલાય છે, તો તેમાં અલગ રીતે વિકાસ અને પરિવર્તનની શક્યતા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ માનવથી કૂતરા સુધી વાયરસના સંક્રમણનો મામલો સામે આવ્યા બાદ ચેતવણી જારી કરી છે. WHOએ મંકીપોક્સથી પીડિત લોકોને પ્રાણીઓના સંપર્કમાં ન આવવાની સલાહ આપી છે.

WHOના ઈમરજન્સી ડાયરેક્ટર માઈકલ રેયાનના જણાવ્યા અનુસાર આ વધુ ખતરનાક સ્થિતિ છે. જો કે, તેણે આશા વ્યક્ત કરી છે કે વાયરસ એક જ કૂતરામાં એક જ માણસ કરતાં વધુ ઝડપથી વિકસિત થશે નહીં. તેમણે કહ્યું કે લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.

ઓસ્ટ્રેલિયાના બે રાજ્યોમાં સ્વસ્તિક પ્રતિકને પ્રતિબંધિત કરવાનો નિર્ણય

ઓસી.ના સાઉથ વેલ્સ અને વિક્ટોરિયામાં પ્રતિબંધ લદાયો, ક્વીન્સલેન્ડ અને તાસ્માનિયામાં પણ તૈયારી

મેલબોર્ન

ઓસ્ટ્રેલિયાના બે રાજ્યો સાઉથ વેલ્સ અને વિક્ટોરિયામાં સ્વસ્તિક પ્રતીકને પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે ક્વીન્સલેન્ડ અને તાસ્માનિયામાં પ્રતિબંધ થાય તેવી શક્યતા છે. કહેવાયું છે કે સ્વસ્તિક નાઝીઓનું પ્રતીક છે. આ પહેલાં કેનેડામાં પણ સ્વસ્તિક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી કેનેડાએ તે નિર્ણય મુદ્દે માફી માગવી પડી હતી. અહેવાલ અનુસાર લગભગ એક વર્ષ સુધી ચાલેલી ચર્ચા

કોરોના ફરી ત્રાટક્યો : જાપાનમાં નવા 1,78,286 કેસ નોંધાયા, 284ના મોત

હાલ કોરોનાના લગભગ બે કરોડ દર્દીઓ સારવાર હેઠળ, રોજના છ લાખ કેસો આવે છે

ન્યુયોર્ક

દુનિયાભરમાં ફરી એકવાર કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. હાલ દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા બે કરોડ નજીક પહોંચી ગઈ છે જ્યારે રોજ સરેરાશ નવા છ લાખ કેસો નોંધાઈ રહ્યા છે. કોરોના કેસોની સંખ્યા રસીકરણ કરાવવા છતાં ઝડપથી વધી રહી હોવાથી લોકો ફરી ચિંતિત બન્યા છે. બીજી તરફ જાપાનની વાત કરીએ તો એક જ દિવસમાં નવા 178286 કેસો નોંધાયા હતા. જ્યારે 284 નાગરિકોના મોત થયા હતા.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર ઓમિક્રોન અને તેના પેટાવેરિઅન્ટ્સનો ચેપ ખૂબ વધી ગયો છે. આઠ જુલાઈથી આઠ ઓગસ્ટ દરમિયાન દુનિયાભરમાં ૧.૭૫ લાખ સેમ્પલનું સિક્વેન્સિંગ કરવામાં આવ્યું હતું જેમાં ૧.૭૪ લાખ એટલે કે ૯૯ ટકા સેમ્પલમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સ જણાયા હતા. વર્લ્ડોમીટર વેબસાઈટ અનુસાર દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૫૯.૭૧ કરોડ કેસો

નોંધાયા છે. જ્યારે ૬૪.૫૯ લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. છેલ્લા થોડા દિવસોથી નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પણ હજી સરેરાશ ૬ લાખ નવા કેસો નોંધાઈ રહ્યા છે. હાલ ૧.૯૪ કરોડ કરતાં વધારે કેસો સક્રિય છે. જો કે તેમાં રાહતની વાત એ છે કે મોટાભાગના દર્દીઓમાં કોરોનાના લક્ષણો હળવા જણાયા છે. અલબત્ત ૪૪,૦૦૦ દર્દીઓમાં કોરોનાના ગંભીર લક્ષણો હોવાથી તેઓ વધારે બિમાર જણાયા છે.

ચીનમાં ભીષણ ગરમી, ચાંગકિંગ પ્રાંતમાં 6 લાખ લોકોને અસર, પાકને પણ અસર

ચીનના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે પાક અને પીવાના પાણી પુરવઠાને અસર થઈ છે. ચીનમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ મેગા-સિટી ચાંગકિંગમાં વિસ્તારમાં કે જ્યાં પર્વતો અને નદીઓનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે છેવાડાના ગામડાઓમાં પીવાનું પાણી પહોંચાડવા અને સિંચાઈ માટે અગ્નિશામક ટ્રકોમાં પાણી મોકલવામાં આવી રહ્યું છે.

ચાંગકિંગમાં આ વર્ષે અપેક્ષા કરતા ઓછું વરસાદ પડ્યું છે. જેના કારણે નાના જળમાર્ગ સૂકાઈ ગયા છે. અધિકારીઓએ ચેતાવણી આપતા કહ્યું કે તાપમાન 40 ડિગ્રીને પણ આંબી શકે છે. આ વર્ષે ચીનના મોટાભાગના



વિસ્તારોમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. ચાંગકિંગમાં પહેલા દુષ્કાળને કારણે 6 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. જ્યારે 36,700 હેક્ટર જમીનને અસર થઈ છે. ચાંગકિંગના પાડોશી પ્રાંત હુબૈઈ પ્રાંતમાં પણ આવી જ સ્થિતિ છે.

અલ્જેરિયાના જંગલમાં આગથી 38 લોકોના મોત, 200 ઈજાગ્રસ્ત

અલ્જેરિયા

અલ્જેરિયામાં દુષ્કાળ અને હીટવેવને કારણે થયેલા જંગલમાં લાગેલી આગને કારણે ઓછામાં ઓછા 38 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. ફાયર ફાઈટરના કર્મચારીઓ અગ્નિશામક વાહનોની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ઉત્તર આફ્રિકન દેશમાં ઘાતક જંગલની આગ વાર્ષિક આપત્તિ બની ગઈ છે. અલ્જેરિયાની પૂર્વી સરહદ પાસેના વિસ્તારોમાં ઓછામાં ઓછા 38 લોકોના મોત નીપજ્યાં

છે. અલ્જેરિયાની પૂર્વી સરહદ અને ટુનિશિયા પાસેના વિસ્તારમાં તાપમાન 48 ડિગ્રી પર પહોંચી ગયું છે. સ્થાનિક મીડિયા પ્રમાણ દાઝી જવાથી અથવા ધૂમાળાને કારણે શ્વાસને લગતી સમસ્યાઓને કારણે 200 લોકોને અસર થઈ છે. સ્થાનિક પત્રકારે જણાવ્યું હતું કે આગના વંટોળે થોડિક જ ક્ષણમાં બધું નષ્ટ કરી નાખ્યું હતું. મોટાભાગના લોકો જે મૃત્યુ પામ્યા છે, તેઓ વાઈલ્ડલાઈફ પાર્કની આસપાસ જ હતા. સ્થાનિક હોસ્પિટલમાંથી 100 મહિલાઓ અને 17 નવજાત બાળકોને બચાવવામાં આવ્યા હતા.

અમેરિકા યુકેન યુદ્ધ લંબાવવા પ્રયત્નો કરી રહ્યું હોવાનો પુતિનનો દાવો

મોસ્કો

રશિયાના પ્રમુખ વ્લાડીમીર પુતિને અમેરિકા ઉપર આક્ષેપ મુકતા કહ્યું હતું કે, વોશિંગ્ટન અકારણ યુકેન યુદ્ધ લંબાવી રહ્યું છે. બીજી તરફ રશિયાના તાબા નીચેના ક્રીમીયા દ્વીપકલ્પમાં રશિયાના લશ્કરી મથકો ઉપર ભારે વિસ્ફોટો થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. રશિયા- યુકેન યુદ્ધ અત્યારે તો ધમાસાણ ચાલી રહ્યું છે તેમ છતાં યુનો અને તુર્કીએ મહાપ્રયાસે સમજૂતી સધાવી યુકેનમાંથી અનાજ ભરેલું જહાજ ભૂખે મરતા આફ્રિકા તરફ રવાના કરાવ્યું હતું. જ્યારે કેમ્બ્રનમાં યોજેલી સલામતી પરિષદમાં બોલતા પ્રમુખ પુતિને જણાવ્યું હતું કે, યુકેનની પરિસ્થિતિ જ દર્શાવી આપે છે કે અમેરિકા યુદ્ધને લંબાવવા માંગે છે.

ટીપી પીવડાવવા ગયેલી ટીમ પર ગોળીબાર થયો પાક.માં પોલિયોનો શિકાર થતાં બાળકો, આતંકીઓની વિચારસરણી બની આફત

ઈસ્લામાબાદ

પાકિસ્તાનમાં બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવા ગયેલી એક ટીમની સુરક્ષામાં તેનાત બે પોલીસ અધિકારીઓને આતંકીઓએ ઠાર માર્યા છે. આ ઘટના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ટાંક જિલ્લાની છે. સમાચાર એજન્સી DPAએ સ્થાનિક પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, હુમલાખોરો મોટરસાઈકલ પર સવાર હતા, જેઓ ગુનો કર્યા બાદ તરત જ ભાગી ગયા હતા. અત્યાર સુધી કોઈ આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી.

પ્રાંતીય સરકારે પાંચ વર્ષથી ઓછી ઉંમરના લાખો બાળકો માટે પોલિયો વિરોધી રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો. તે જાણીતું છે કે પાકિસ્તાનમાં પોલિયો વિરોધી રસીકરણ કાર્યક્રમ લગભગ એક વર્ષથી ફરી વેગ પકડ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં, હિંસા પ્રભાવિત વિસ્તારોમાંથી રસીકરણ કામદારો પર હુમલાના 14 નવા કેસ નોંધાયા છે.

21મી ઓગસ્ટે ટોરોન્ટોમાં નટરાજ યુથ કલ્ચર ગુજરાતનો ફ્લોટ રજૂ કરશે

બેઈજિંગ

નટરાજ યુથ કલ્ચરલ ઓર્ગનાઈઝેશન નોટ ફોર પ્રોફીટ ઓર્ગનાઈઝેશન ઈન્ડિયા ડે પરેડમાં છેલ્લાં 12 વર્ષથી ભાગ લે છે. આ વર્ષે પણ ગુજરાતના ફ્લોટને એક નવી થીમ સાથે સંગઠને પ્રસ્તુત કરવા આયોજન કર્યું છે. ગુજરાતી ભાઈ-બહેનોને ભાતીગળ કપડામાં (ચણિયાચોળી, કુર્તા, પાયજામા, કેડિયું) સજ્જને આવવા અનુરોધ કરાયો છે. 21મી ઓગસ્ટે નાથન ફિલીપ સ્ક્વેર, ડાઉન ટાઉન ટોરોન્ટો ખાતે યોજાનારા કાર્યક્રમમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન પરેડ રજૂ થશે. જેમાં ગુજરાતનો ફ્લોટ પણ રજૂ કરાશે. કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે ચિંતન ભાવસાર (647-989-3490)નો સંપર્ક કરવો.

ICC દ્વારા 2023થી 2027નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર

પાંચ વર્ષમાં 173 ટેસ્ટ, 281 વન ડે અને 323 T20 યોજાશે



આઈસીસીએ પ્રથમ વખત વુમેન્સ FTPની જાહેરાત કરી

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ પ્રથમ વખત વુમેન્સ ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP) ની જાહેરાત કરી છે. અત્યાર સુધી ICC માત્ર મેન્સ ક્રિકેટ માટે જ FTP તૈયાર કરતી હતી પરંતુ પ્રથમ વખત 16 ઓગસ્ટ 2022થી 2025 દરમિયાનના વુમેન્સ ફ્યુચર ટૂર પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટની સૌથી મોટી સંસ્થાએ મેગા ઈવેન્ટ વિશે પણ જાહેરાત કરી દીધી છે કે કઈ ટૂર્નામેન્ટ ક્યારે અને ક્યાં રમાશે? FTP આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરની રૂપરેખા તૈયાર કરે છે. તેમાં ICC ઈવેન્ટ્સ ઉપરાંત દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય શ્રેણીનો પણ સમાવેશ થાય છે. મહિલા ક્રિકેટ માટે રચાયેલ FTPમાં એપ્રિલ 2025ના અંત સુધીમાં તમામ દેશો માટે આંતરરાષ્ટ્રીય શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે. આમાં ભારતમાં યોજાનારી ICC મહિલા વિશ્વ કપ માટે ફ્યુચર ટૂર પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વિશે વાત કરીએ તો, વર્ષ 2022થી 2025 સુધી હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમ 2 ટેસ્ટ, 24 વન-ડે આંતરરાષ્ટ્રીય અને 36 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. T-20 વર્લ્ડ કપ અને અન્ય ઈવેન્ટની મેચો આમાં સામેલ નથી.

ICC વુમેન્સ મેગા ઈવેન્ટની લિસ્ટ : ફેબ્રુઆરી 2023માં સાઉથ આફ્રિકામાં વુમેન્સ T-20 વર્લ્ડ કપ • સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024માં બાંગ્લાદેશમાં વુમેન્સ T-20 વર્લ્ડ કપ • સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025માં ભારતમાં વુમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ • જૂન 2026માં ઈંગ્લેન્ડમાં વુમેન્સ-વુમેન્સ T-20 વર્લ્ડ કપ • ફેબ્રુઆરી 2027માં શ્રીલંકામાં વુમેન્સ T-20 ચેમ્પિયન્સ ટ્રોફી

નવી દિલ્હી

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમ ઈન્ડિયાના 2023 થી 2027 સુધીના ક્રિકેટ પ્રવાસનુ શીડ્યુલ જાહેર કરી દેવાયું છે.

ચાર વર્ષ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ક્રિકેટ કાર્યક્રમ ભરચક છે. ટીમ ઈન્ડિયાના કાર્યક્રમને આઈસીસીએ પણ મંજૂરી આપી દીધી છે. સૌથી ધ્યાન ખેંચનારી વાત એ છે કે, ટીમ ઈન્ડિયા આ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટની સિરિઝ રમશે. નવા ટુર પ્રોગ્રામમાં રિઝર્વ ટાઈમ પણ રાખવામાં આવ્યો છે. જેથી ટી-20 મેચો અને પાસ કરીને આઈપીએલનું યોગ્ય રીતે આયોજન થઈ શકે. હવે પછી આઈપીએલ ટુર્નામેન્ટ અઢી મહિના સુધી રમાવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 30 વર્ષ બાદ પાંચ ટેસ્ટની સિરિઝ રમાવા જઈ રહી છે. છેલ્લે 1992માં બંને દેશો પાંચ ટેસ્ટની સિરિઝ રમ્યા હતા. એ પછી બંને દેશો મહત્તમ ચાર ટેસ્ટની સિરિઝ જ રમ્યા છે.

ચાર વર્ષમાં ભારતીય ટીમ 38 ટેસ્ટ રમશે. જેમાં સૌથી વધારે ટેસ્ટ મેચો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે છે. જ્યારે ઈંગ્લેન્ડ આ સમય ગાળા દરમિયાન 42 અને ઓસ્ટ્રેલિયા 41 ટેસ્ટ રમવાનું છે. 2023 થી 2025 સુધીમાં ભારત 19 ટેસ્ટ રમવાનું છે. જેમાં 10 ટેસ્ટ ઘર આંગણે અને 9 ટેસ્ટ વિદેશમાં રમાશે.

ટીમ ઈન્ડિયાનો સંપૂર્ણ કાર્યક્રમ

ICC FTP પ્રોગ્રામમાં ભારતીય ક્રિકેટ ટીમના ભાવિ પ્રવાસ કાર્યક્રમનો શેડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ભારત પાંચ વર્ષમાં બે વાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સામે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ રમશે. સૌથી મહત્વની વાત એ છે કે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાની વચ્ચે 5 ટેસ્ટ મેચોની સીરીઝ રમશે. 30 વર્ષમાં આ પ્રથમ વખત બંને જયારે ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં 5 મેચની શ્રેણી રમશે. ભારતીય ટીમે છેલ્લી વખત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ વર્ષ 1992માં રમી હતી. વર્ષ 2023-25માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જશે અને 5 ટેસ્ટ મેચ રમશે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ 2025-27માં ભારત આવશે.

ભારતનો બે વર્ષનો કાર્યક્રમ નીચે મુજબ છે.

- જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝમાં બે ટેસ્ટ મેચ
- ડિસેમ્બર 2023માં સાઉથ આફ્રિકા સામે સા.આફ્રિકામાં બે ટેસ્ટ
- ઈંગ્લેન્ડ સામે જાન્યુઆરી 2024માં ઘર આંગણે પાંચ ટેસ્ટ
- બાંગ્લાદેશ સામે સપ્ટેમ્બર 2024માં ઘર આંગણે બે ટેસ્ટ
- ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ઓક્ટોબર 2024માં 3 ટેસ્ટ મેચ
- ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયામાં ડિસેમ્બર 2024માં પાંચ ટેસ્ટની સિરિઝ

T20-ODI વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી

આ સાથે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ મળીને 2024 T20 વર્લ્ડકપની યજમાની કરવા જઈ રહ્યા છે. આ સિવાય પાકિસ્તાનની ટીમ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે. ફ્યુચર ટૂર પ્રોગ્રામ હેઠળ 2026માં ભારત અને શ્રીલંકાની ટીમ એકસાથે 2026 T20 વર્લ્ડકપની યજમાની કરશે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની ટીમ 2027માં ODI ક્રિકેટ વર્લ્ડકપની યજમાની કરશે.

યુઝવેન્દ્ર ચહલના લગ્નજીવનમાં દોઢ વર્ષ બાદ જ ભંગાણ: પંજાબની કોર્ટમાં ડિવોર્સ માટે અરજી



નવીદિલ્હી: ભારતના સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને સોશિયલ મીડિયા સેન્સેશન કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ પંજાબની કોર્ટમાં ડિવોર્સ માટે અરજી કરી હતી. બંનેના સંબંધમાં છેલ્લા કેટલાક સમયથી સમસ્યા હોવાની અફવાઓ સામે આવી હતી. આજે બંનેએ દોઢ વર્ષના લગ્નજીવનનો અંત લાવવાનો નિર્ણય કરતા કોર્ટમાં ડિવોર્સની અરજી કરી હતી.

સોશિયલ મીડિયા સેન્સેશન કોરિયોગ્રાફર ધનશ્રી અને ઈન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તેમના અંગત જીવનને કારણે હાલ ચર્ચામાં છે. બંનેએ પંજાબની કોર્ટમાં ડિવોર્સ માટે અરજી કરી છે. ધનશ્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી 'ચહલ' સરનેમ હટાવી દીધી છે. લગ્ન બાદ ધનશ્રી વર્માએ પતિની સરનેમ લગાવી હતી. જોકે ધનશ્રીએ હજી સુધી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી યુઝવેન્દ્ર ચહલ સાથેની તસવીરો ડિલિટ કરી નથી. ધનશ્રીએ સરનેમ દૂર કરી તો યુઝવેન્દ્ર ચહલે પણ એક પોસ્ટ શેર કરી હતી. તેણે ફોટો શેર કર્યો જેમાં લખ્યું હતું, 'ન્યૂ લાઈફ લોડિંગ' (New life Loading). 22 ડિસેમ્બર, 2020માં બંનેએ લગ્ન કર્યા હતા.

FIFAએ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને કર્યું સસ્પેન્ડ

ભારતમાં ઓક્ટોબરમાં યોજાનાર ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ નહીં યોજાય

નવી દિલ્હી

વિશ્વની સૌથી મોટી ફૂટબોલ સંસ્થા એટલે કે FIFA એ મંગળવારે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ને લઈને એક ઘોષણા કરી હતી. FIFAએ AIFFને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ફિફા કાઉન્સિલના બ્યુરો દ્વારા સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. FIFAએ જણાવ્યું છે કે, AIFFમાં ત્રીજા પક્ષકારોના અયોગ્ય પ્રભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જે FIFA કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે. FIFA દ્વારા જારી કરાયેલ એક સત્તાવાર મીડિયા રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને FIFA દ્વારા સસ્પેન્ડ કરવા પાછળ થઈ પાર્ટીની દખલનું કારણ આપવામાં આવ્યું છે. ફિફા અનુસાર આ પ્રકારનો હસ્તક્ષેપ એ ફિફાના નિયમોની વિરુદ્ધ છે. આ કારણોસર ભારત પરથી U17 મહિલા વર્લ્ડ કપની યજમાની ઈનવી લેવાની કગાર પર છે પરંતુ હજી થોડો સમય બાકી છે.

હવે સસ્પેન્શન ક્યારે પાછું ખેંચાશે ?

સુપ્રીમ કોર્ટ વતી મેના રોજ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ પ્રફુલ પટેલ અને તેમની એક્ઝિક્યુટીવ કમિટીને તેમના હોદ્દા પરથી મુક્ત કર્યા હતા અને તમામ કાર્યભારના સંચાલન માટે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ)ની રચના કરી હતી. જોકે ફિફા આ ઘટના ક્રમને ત્રીજા પક્ષકારની દરમિયાનગીરી માને છે. તેમણે સસ્પેન્શન અંગે પાઠવેલા પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, આ સસ્પેન્શન ત્યારે જ ઉઠાવી લેવામાં આવશે કે, જ્યારે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ) વિદાય લે અને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનની કમિટી ફરી ભારતીય ફૂટબોલના સંચાલનની રોજબરોજની જવાબદારી સંભાળી લે.

મહિલા ફૂટબોલ વર્લ્ડકપનું આયોજન પણ નહીં થાય

ફિફાએ ભારતને સસ્પેન્ડ કરી દેતા હવે ઓક્ટોબરમાં ભારતમાં રમાનાર અંડર-૧૭ મહિલા ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન નહીં થાય. હવે આ બુનિયત વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની અન્ય કોઈ દેશને સોંપવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે ફિફા તેની બ્યુરો ઓફ કાઉન્સિલને જ્યારે જરૂર જણાશે ત્યારે જાણ કરશે.

પ્રથમ વન ડેમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટ હરાવ્યું, ધવને શાનદાર 81 રન ફટકાર્યા

હરારે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 10 વિકેટ હરાવી સિરીઝની શાનદાર શરૂઆત કરી હતી. ભારતીય ઓપનરો શિખર ધવન અને શુભમન ગીલે ધમાકેદાર બેટિંગ કરતા ભારતને 10 વિકેટ જીત અપાવી હતી.

ભારતીય ક્રિકેટમાં ગબ્બરના નામથી પ્રખ્યાત ઓપનર અને સિનીયર બેટ્સમેન શિખર ધવને આજની મેચમાં વધુ એક સિદ્ધિ હાસિલ કરી હતી. ગબ્બરે વન-ડે ક્રિકેટમાં તેના 6,500 રન પૂર્ણ કર્યા હતા.

ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

હતો. હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલ મેચમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતા 189 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ભારતને જીતવા 190 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઝિમ્બાબ્વે તરફથી કેપ્ટન ચકાબાવાએ સૌથી વધુ રન 35 રન બનાવ્યા હતા. પૂંછડિયા બેટર બ્રેડ ઈવાંસ (33) અને રિચર્ડ નાગરવા (34) એ જોરદાર લડત આપી હતી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ ગયા હતા. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઝિમ્બાબ્વેના બેટ્સમેનોને મોટો સ્કોર કરવાથી રોક્યા હતા. ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ કમબેક કરનાર દીપક ચાહરે ધારદાર બોલિંગ કરતા ત્રણ વિકેટ ઝડપી હતી.

કેનેડિયન ઓપનમાં સિમોના હાલેપ ત્રીજી વખત ચેમ્પિયન બની

રોમાનિયાની સિમોના હાલેપે ત્રણ સેટ સુધી રમાયેલી ફાઈનલમાં બિટ્લિઝ હદાદ માઈયાને 6-3, 2-6, 6-3થી હરાવીને કારકિર્દીમાં ત્રીજી વખત કેનેડિયન ઓપન ડબ્લ્યુટીએ ટેનિસ ટુર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સનું ટાઈટલ જીતી લીધું હતું. હાલેપે પ્રથમ સેટમાં ચાર વખત ડબલ ફોલ્ટ કર્યા બાદ પોતાની રિધમ હાંસલ કરી લીધી હતી. બે વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન હાલેપે કારકિર્દીમાં નવમી વખત ડબ્લ્યુટીએ 1000 ટુર્નામેન્ટનું ટાઈટલ પોતાના નામે કર્યું હતું.



॥ સ્વામી શ્રીજી ॥

પ્રમુખ પરિમલ લેખમાળા- 3

સમાજમાં સમાનતા અને સંવાદિતા લાવવા સંતની ઝુંબેશ

આ પૃથ્વી ઉપરના તમામ મનુષ્યો સમાન સગવડો અને સન્માનના અધિકારી છે. પરંતુ જ્યારે જ્યારે આ ભાવના ઉપર પ્રહાર પડ્યા છે, ત્યારે સમાજે અસંતોષ અનુભવ્યો છે અને સમાજના ઉપલા અને નીચલા એમ બે ભાગલા પડી ગયા છે. પરમાર્થી સંતોએ આ બે ભાગોને જોડતો સેતુ રચવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે એમનો વિરોધ પણ થયો છે. નરસિંહ મહેતાનો આ પ્રકારનો વિરોધ થયો ત્યારે એમણે લલકાર્યું હતું - એવા રે અમો એવા રે...

પરંતુ સંતો સમાજમાં સમાનતા અને સંવાદિતા લાવવા માટે પ્રયત્ન કરતાં જ રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે પહેલેથી જ આ બાબતમાં કાંઈક કરવાની ગાંઠ વાળી રાખી હતી. તેનો ત્યારે જ ખ્યાલ આવ્યો કે જ્યારે એમણે અવિરત વિચરણ શરૂ કર્યું. એમણે સમાજના દરેક સ્તરના, દરેક વર્ગના અને દરેક જ્ઞાતિના એકે એક વ્યક્તિને એકસરખો પ્રેમ આપ્યો. તા.૨૭-૧૧-૭૫ના દિવસે તેઓ આશી ગામમાં પધાર્યા. ત્યારે પ્રથમ તો એમનું ભરબપોરે સામેયું કરવામાં આવ્યું અને ત્યારપછી તેઓ પધરામણી કરવા એટલે કે વ્યક્તિને ઘરે જઈને મુલાકાત આપવા નીકળી પડ્યા. નિશ્ચિત પધરામણીઓ પૂરી થતાં વેંત તેઓ હરિજનવાસમાં જઈ પહોંચ્યા. આ જ રીતે ઘણીવાર તેઓ સમાજના શિરે ચોંટાડું અસ્પૃશ્યતાનું કલંક ધોવા કોર્ટના દરવાજે નહીં પણ હરિજનોના ઘરના દરવાજે જઈને ઊભા રહેતા. હરિજનોના તો આશ્ચર્યનો પાર ન હતો કે, આવા મોટા વિશ્વપ્રસિદ્ધ સંત આપણા જેવા સામાન્ય માણસના દરવાજે આવી ઊભા છે. ! અસ્પૃશ્યતાના દૂષણને નિવારવા સ્વામીશ્રીએ

આસ્કાલ્ટની સ્વચ્છ સડકો પર સરઘસો કાઢ્યા નહીં પણ હરિજનવાસની ગલીઓમાં જઈને સીધી પધરામણી કરી.

આ પાપ ધોવા તેઓએ વાતાનુકૂલિત મશીનો વચ્ચે બેસીને સભાઓ સંબોધી નહીં, પણ હરિજનવાસમાં પહોંચીને તેઓની વચ્ચે જ આસન જમાવી દીધું. સમાજ વિસ્ફારિત નેત્રે સ્વામીશ્રીની આ ક્રાંતિને નિહાળી રહ્યો. સ્વામીશ્રીએ આશીના હરિજન બંધુઓને સદુપદેશ આપ્યો, તેમાં પ્રેમના પાલવ પાછળ જીવન-પરિવર્તનની વાત હતી. ધર્મ-પરિવર્તનની નહીં. સ્વામીશ્રીની મદદમાં મહાનતા રહેતી, પણ ભોળા-અબુધ-તરછોડા યેલાંઓનો ગેરલાભ ઉઠાવવાની મલિનતા નહીં.

૧૯૮૪ના ફેબ્રુઆરી માસમાં ડાંગ જિલ્લામાં આવેલા સિદ્ધમ્બર ગામે ૧૦૦૦ વનવાસીઓના 'વનવાસી પરિવાર સંમેલન'માં તેઓ પધાર્યા. ત્યાં ઉતારા, ભોજન કે વાહન-દરેક બાબતોમાં એમના માટે અગવડો સિવાય બીજું કંઈ જ હાજર નહોતું. પરંતુ તેઓ ત્યાં વનવાસી બંધુઓની વચ્ચે જ રહ્યા. સભામાં એમને જીવન-ઉત્તરિતિની પ્રેરણા તો આપી, પરંતુ તેમની સાથે જ તેમની વચ્ચે જમવા પણ બેઠા.

ત્યાંથી તા.૨૮-૨-૮૪ના દિવસે પ્રમુખસ્વામીએ નવસારીમાં હરિજનભાઈઓની

વસાહત 'ઠક્કરબાપા વાસ'માં નૂતન સંસ્કારભવનનો ખાતમુહૂર્તવિધિ કરી હતી. જેમાં ત્રિકમના પાંચ ટચકા મારી ભૂમિખનન પણ કરી આપ્યું. સ્વાગત માટે તેઓ હારતોરા લઈને આવ્યા ત્યારે તેઓ સ્વામીશ્રીને સીધેસીધા હાર પહેરાવવાને બદલે દૂર ઊભા રહીને સ્વામીશ્રીના ગળામાં હાર ફેંકતા હતા. સ્વામીશ્રીએ આ જોયું એટલે એ લોકોનો અસ્પૃશ્યતા અંગેનો સંકોચ દૂર કરવા તેઓ પોતે ઊભા થઈ ગયા અને પોતાને પહેરાવવામાં આવેલો એક-એક હાર તેમને જ ગળામાં પાછા પહેરાવ્યા. હરિજનભાઈઓનાં હૈયાં આ મહાપુરૂષની પ્રેમગંગામાં વહીને દિવ્યતાના સાગરમાં હિલોળવા લાગ્યાં.

તા.૩-૫-૧૯૮૮ના દિવસે ધરમપુરમાં સ્વામીશ્રીના સાન્નિધ્યમાં આદિવાસી સંમેલન યોજાયું હતું. હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો લાભ લેવા ઉમટી પડ્યાં હતાં. એક જમાનામાં જેમના જીવનમાં વ્યસનો, વહેમ, ચોરી વિગેરે દુષ્કર્મો સિવાય બીજું કંઈ હતું જ નહીં, પરંતુ સ્વામીશ્રીના અથવા એમના સંતોના ઉપદેશને લીધે જેઓ હવે એકદમ પવિત્ર અને નિષ્કલંક જિંદગી જીવતાં થઈ ગયાં હતાં. એવા કેટલાંક ભાઈઓએ પોતાની વિકત કથા રજૂ કરી.

એમાંથી એક ભાઈ સામાન્ય કુલહાર લઈ સ્વામીશ્રીનું સન્માન કરવા આવ્યા. આવી મોટી હસ્તીની નજીક પોતાને જવા મળ્યું એ વાતનો તો એમના અંતરમાં સાશ્વર્ય આનંદ તો હતો જ, પરંતુ એમાં કલગી ત્યારે ઉમેરાઈ ગઈ કે જ્યારે એમણે જોયું કે હાર પહેરાવતી વખતે એમણે માથે ઓઢેલી ટોપી પડી જતી હતી, તે સ્વામીશ્રીએ અદ્ધર જીલી લીધી હતી અને હાર પહેરાવ્યા બાદ તેમના હાથમાં પાછી આપી રહ્યા હતા.

પોતે જેમનું સન્માન કરવા આવ્યા હતા, એ તો પોતાને માન આપી રહ્યા હતા!

બોડેલી પાસે આવેલા ચુલી ગામમાં આવું જ આદિવાસી સંમેલન યોજાયું હતું. પરંતુ વિશેષતા એ હતી કે સ્વામીશ્રી એક પછી એક ગામોને પાવન કરતાં કરતાં ત્યાં પહોંચ્યા, ત્યારે રાતે એક વાગી ગયો હતો. પરંતુ આટલી મોડી રાતે દૂર દૂરથી આવી ગયેલાં હજારો મુમુક્ષુઓને જોઈને સ્વામીશ્રીનું હૈયું પણ હાથ ન રહ્યું. તેઓ ભાવાર્દ સ્વરે બોલવા લાગ્યા, "આપ સૌમાં મને ભગવાનનાં દર્શન થાય છે." આદિવાસી લોકો માટે આટલા ઉચ્ચ પ્રકારના શબ્દોનો પ્રયોગ કદાચ પહેલીવાર જ કોઈએ કર્યો હશે.

ઈશાવાસ્ય ઉપનિષદનો મંત્ર- 'ઈશાવાસ્યમ ઈદમ્ સર્વમ્' ત્યાં જીવંત થઈ ગયો હતો !

જીવ-પ્રાણીમાત્રના હૃદયમાં પરમાત્માને નિહાળવાની દ્રષ્ટિ ધરાવતા પ્રમુખસ્વામી જેવા સંત જ આદિવાસી લોકો પ્રત્યેની સૂગ કે અસ્પૃશ્યતા જેવા કુરિવાજોના બંધન તોડી સમાજમાં સમાનતા લાવી શકે.

- સાધુ યોગેન્દ્રદાસ, BAPS (Los Angeles, USA)



કાબુલની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થતાં 20ના મોત, 40થી વધુ ઘાયલ

ઇંગ્લેન્ડના દક્ષિણ અને પૂર્વના 19 જેટલા વિસ્તારો માટે પૂરની ચેતવણીઓ જારી કરી

ઈસ્લામાબાદ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ખાતે એક મસ્જિદમાં બુધવારે સાંજેની નમાજ દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં મુખ્ય મૌલવી સહિત ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અને એક પ્રત્યક્ષદર્શીએ આ અંગે માહિતી આપી હતી. જોકે હાલનાં આ હુમલાની જવાબદારી તાત્કાલિક કોઈએ લીધી નથી.

વિસ્ફોટ કથિત રીતે ખેર ખાના વિસ્તારની સિદ્દિકિયા મસ્જિદમાં થયો હોવાનું કહેવામાં આવે છે. અફઘાન સુરક્ષા સૂત્રએ બુધવારે અલ જઝીરાને જણાવ્યું હતું કે, સાંજની નમાજ દરમિયાન કાબુલની ઉત્તરે એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં 20 લોકોના મોત થયા છે અને અન્ય 40 લોકો ઘાયલ થયા છે. તાલિબાને દાવો કર્યો છે કે, અફઘાનિસ્તાન પર તેમનું



સંપૂર્ણ નિયંત્રણ છે પરંતુ ઈસ્લામિક સ્ટેટ દેશભરમાં નાગરીકો અને પોલીસ પર હુમલાઓ કરી રહ્યું છે. નામ ન આપવાની શરતે, એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલા મૌલવી મુલ્લા અમીર મોહમ્મદ કાબુલી હતા. તેમણે કહ્યું હતું કે, આ ઘટનામાં 40થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઓસ્ટ્રેલિયાના કેનબરા એરપોર્ટ પર અંધાધૂંધ ગોળીબારથી ભાગદોડ મચી

આરોપીની ધરપકડ કરાઈ, થોડાક સમય માટે બધા ઉડ્ડયનો અટકાવાયા હતા, હાલ સ્થિતિ નિયંત્રણમાં

કેનબરા

ઓસ્ટ્રેલિયાના કેનબરા એરપોર્ટ પર રવિવારે બપોરે એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જોકે, આ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી કે કોઈને ઈજા થયાના અહેવાલ નથી. ગોળીબાર પછી ટર્મિનલના કેટલાક ભાગને બંધ કરી દેવાયો હતો તેમજ થોડાક સમય માટે બધા જ ઉડ્ડયનો રદ કરી દેવાયા હતા. હુમલાખોરની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરાના

એરપોર્ટ પર ગોળીબારની આ ઘટનામાં એક જ વ્યક્તિ સંડોવાયેલ હતી. જોકે, ગોળીબારનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હુમલાખોર પાસેથી એક ગન જપ્ત કરાઈ છે. પોલીસ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. એસીટી પોલીસે કહ્યું કે, મુખ્ય ટર્મિનલવાળી ઈમારતમાં બપોરે લગભગ દોઢ વાગ્યે ગોળીઓ છૂટવાનો અવાજ સંભળાયો હતો. ગોળીબારના કારણે લોકોએ જીવ બચાવવા આમ-તેમ ભાગદોડ કરી હતી.

ઈજિપ્તના કેરોના ચર્ચમાં ભીષણ આગમાં ફૂલ મૃતાંક 41 થયો

કેરો

ઈજિપ્તમાં રવિવારે આગની એક મોટી ઘટના બની છે. રાજધાની કેરોમાં કોપ્ટ ક્રિસ્ચિયન ચર્ચમાં આગ લાગતા ઓછામાં ઓછા 41 લોકોના મોત થઈ ગયા. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસનું માનવું છે કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. આગ અબુ સિફિન ચર્ચમાં લાગી, જે રાજધાની કેરોના ઉત્તર-પશ્ચિમ વિસ્તારના ઈબાબા જિલ્લામાં સ્થિત છે. તે ગીચ વસ્તીવાળો વિસ્તાર છે. ફાયર બ્રિગેડે ઘણી જહેમત પછી આગ પર કાબુ મેળવ્યો. પ્રેસિડન્ટ અબ્દેલ ફતાહ અલ-સિસીએ જણાવ્યું કે, મેં બધા પ્રકારની મદદ કરવા માટે રાજ્યની સર્વિસને કામ પર



લગાવી છે. આરોગ્ય મંત્રાલય મુજબ, એમ્બ્યુલન્સ દ્વારા 55 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડાયા. મધ્ય પૂર્વ દેશોમાં કોપ્ટ સૌથી મોટો ખ્રિસ્તી સમુદાય છે. ઈજિપ્તની 10 કરોડની વસ્તીમાં આ સમુદાયની ભાગીદારી લગભગ 1 કરોડ છે.

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશનાર 6 ગુજરાતી યુવાનોએ નોકરી મેળવી

વોશિંગ્ટન

હજુ સાડા ત્રણ મહિના પહેલા જ કેનેડાની બોર્ડર કોસ કરીને અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસતા પકડાયેલા ઉત્તર ગુજરાતના છ યુવાનોએ ત્યાં નોકરી ચાલુ કરી દીધી હોવાની માહિતી બહાર આવી છે. આ તમામ છ યુવકોને અમેરિકાની કોર્ટે ડીપોર્ટ કરવાનો ઓર્ડર કર્યો છે. તેઓ હાલ જેલમાં નથી, પરંતુ તેમના પર નજર રાખવા માટે અમેરિકાની પોલીસે તેમના હાથમાં ઈલેક્ટ્રોનિક ટ્રેકર બાંધ્યું છે. તેમ છતાંય આ યુવાનોએ એક સ્ટોરમાં નોકરી શોધી લીધી છે. ગુજરાત પોલીસને તો એવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે કે જેલમાં ના રહેવું પડે તે માટે તેમણે કાયદાની છટકબારીનો

ઉપયોગ કર્યો હોવાની શક્યતા છે. ૨૮ એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના આ છ યુવકો કેનેડાથી સેન્ટ રેજિસ નદીમાં બોટમાં સવાર થઈ અમેરિકા આવવા નીકળ્યા હતા. તેઓ ન્યૂયોર્ક સ્ટેટની હદમાં ઘૂસ્યા ત્યારે તેમની બોટ નદીમાં ડૂબવા લાગી હતી. જેનો મેસેજ મળતાં જ સ્થાનિક પોલીસે આ તમામ યુવકોને નદીમાં ડૂબતા બચાવી લીધા હતા. ત્યારબાદ તમામની ધરપકડ કરીને ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અમેરિકાની કોર્ટે તમામને ભારત પાછા મોકલવા માટે ઓર્ડર કર્યો હતો, જોકે તેમના પ્રત્યે માનવીય અભિગમ દાખવતા કિમિનલ પ્રોસિડિંગમાંથી મુક્તિ આપી હતી.

ગુજરાતમાં ગેસ આધારિત આઠ પાવર પ્લાન્ટ છેલ્લા છ માસથી બંધ હાલતમાં

ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ ચાર્જમાં ખાસો ઘટાડો થઈ જશે

અમદાવાદ

ગેસનો સપ્લાય જ ન મળતો હોવાથી ગુજરાતમાં છેલ્લા ચારથી છ મહિનાથી સાવ જ બંધ પડેલા આઠ પાવર પ્લાન્ટને ભંગારમાં નાખી દઈને ગુજરાતના ૧.૪૦ કરોડ વીજજોડાણધારકોને વાર્ષિક રૂ. ૨૦૦૦ કરોડના બિનજરૂરી બોજામાંથી મુક્તિ આપવાની માગણી કરવામાં આવી છે.

ગુજરાત સરકારનો ધુવારણનો પલ્પ મેગાવોટનો અને ઉત્ત્રાણનો ૩૭૫ મેગાવોટના પાવર પ્લાન્ટમાં ગેસનો પુરવઠો મળતો જ નથી. તેથી

છેલ્લા ચાર મહિનાથી આ પાવર પ્લાન્ટ સાવ જ બંધ છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સ સાથે પણ વીજળી ખરીદવાના કરાર ગુજરાત સરકારની વીજ કંપનીઓએ કરેલા છે. આ ગેસ આધારિત પાવર પ્લાન્ટ પણ છ મહિનાથી બંધ જ છે. તેમાં એક પણ યુનિટ વીજળી પેદા કરવામાં આવતી નથી. આ તમામ પાવર પ્લાન્ટના કર્મચારીઓને પગાર આપવાના, પ્લાન્ટને જાળવણી કરવાના અને કર્મચારીઓના પગારનો ખર્ચ ચાલુ જ છે. તેમ જ આ પાવર પ્લાન્ટ નાખવા

માટે લાંબા ગાળાની લીધેલી લોનના વ્યાજ અને મુદ્દલના હમ્મા ચૂકવાય જ છે. આ રકમનો બોજ ગુજરાતના ૧.૪૦ કરોડ વીજ ગ્રાહકોને માથે જ નાખવામાં આવે છે. આ બોજથી ગુજરાતના ૧.૪૦ કરોડ વીજજોડાણ ધારકોને મુક્તિ અપાવવી જરૂરી છે.

તેને બદલો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સૌર ઉર્જા અને પવન ઉર્જાથી પેદા કરવામાં આવતી વીજળી ખરીદી શકે છે. અત્યારે આ બંને સ્ત્રોતોમાંથી પેદા થતી વીજળી યુનિટદીઠ મહત્તમ રૂ. ૪ના ભાવથી આસાનીથી મળી શકે છે.

કોંગ્રેસ નેતા નરેશ રાવલ અને રાજૂ પરમારનો ભાજપમાં પ્રવેશ

અમદાવાદ

કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ નરેશ રાવલ અને રાજૂ પરમારે આજરોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. અગાઉ નરેશ રાવલ અને રાજૂ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. એ બાદ તેમની ભાજપમાં જોડાવાની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. જે બાદ આજરોજ બંને નેતાઓએ ભાજપની એક જ બેઠકમાં પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.

કોંગ્રેસ છોડતાં જ બંને નેતાઓએ કોંગ્રેસ હાઈકમાન્ડ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. નરેશ રાવલે

કહ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતીઓનું સતત અપમાન કરે છે. કેટલાક ગણ્યાં ગાંઠ્યા નેતાઓ જ હાલ પાર્ટીનું સંચાલન કરી રહ્યા છે. અન્ય નેતાઓની અવગણના થવાથી પાર્ટીના મોટા ભાગના કાર્યકરો પ નાખુશ છે. આથી લોકોની સેવા કરવાની નવી તકો પ્રાપ્ત થાય તે માટે તેઓ ભાજપમાં જોડાયા છે.

જ્યારે રાજૂ પરમારે આક્ષેપો કરતા કહ્યું હતું કે પહેલાની કોંગ્રેસ અને અત્યારની કોંગ્રેસ ખૂબ અલગ છે. ગુજરાતમાં અત્યારે ૩ થી ૪ લોકો જ પાર્ટી ચલાવી રહ્યા હોય તેવું લાગે છે. કોંગ્રેસમાં ગુજરાત પ્રત્યે તિરસ્કારની ભાવના જોવા મળી રહી છે.

જેલમાં બંધ કિટલીએ વેપારી પાસે 5 લાખની ખંડણી માંગી હુમલો કરાવ્યો

અમદાવાદ

ગુજરાતીટીક હેઠળ જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર અઝહર કિટલીએ મીઠાઈના વેપારી પાસેથી 5 લાખની ખંડણી માંગી ઘરે ગુંડા મોકલી હુમલો કરાવ્યો હતા. બનાવને પગલે વેપારીએ અઝહર કિટલી, અઝહર કબૂતર બબલુ સહિત છ જેટલા લોકો વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં સોમવારે ફરિયાદ નોંધાવી છે. જુહાપુરામાં સંકલીતનગરમાં રહેતા અને શેખ સ્વીટના નામે મીઠાઈઓ વેપાર કરતા ઝાકીરહુસેન હસમતભાઈ શેખએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં અઝહર

કિટલી, અઝહર કબૂતર, બબલુ સહિત 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ગત તા.૩૦મી જુલાઈના રોજ અઝહર કિટલીએ વેપારી ઝાકીર હુસેનને ફોન કરી જામીન કરાવવા 5 લાખની જરૂર હોવાનું કહી ઘરે પૈસા મોકલવા જણાવ્યું હતું. ઝાકીરહુસેને મારી પાસે પૈસા નથી તેમ જણાવતા આરોપીએ ફોન કાપી નાખ્યો હતો. અઝહર કિટલી અવારનવાર ફોન કરી અપશબ્દો બોલી ધમકી આપતો બીજા તરફ અઝહર કબૂતર સમજાવટથી વાત કરતો હતો.

આઠ વર્ષની બાળકીની જાતીય છેડતી કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદ

બાળકીની જુબાનીના આધારે આરોપીને આકરી સજા ફટકારી, 50 હજાર દંડ

અમદાવાદ

માત્ર આઠ વર્ષની બાળકીના ગુમાંગમાં આંગળીઓ નાંખી ગંભીર જાતીય છેડછાડના પોકસો કેસમાં અત્રેની અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી કાકા અવધેશ ઉર્ફે બુધવા ગીરધારી નિષાદને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૫૦ હજાર દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટના પાંચમા એડિશનલ

સેશન્સ જજ એ. એચ સીબીયાએ ભોગ બનનાર બાળકીની જુબાની અને નિવેદનના આધારે આરોપીને ૨૦ વર્ષની આકરી સજા ફટકારી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીના અત્યંત ઘૃણાસ્પદ કૃત્યની પણ ગંભીર આલોચના કરી હતી.

ગત તા.૭-૫-૨૦૨૦ના રોજ સીંગરવા ખાતે ફરિયાદીના મકાનમાં તેમની આઠ વર્ષની બાળકી સંડાસમાં

ગઈ ત્યારે આરોપી અવધેશ ઉર્ફે બુધવા રાજકારણ ગીરધારી નિષાદે તેણીને મોટું પતલુ કાર્ટનું બતાવવાની લાલચ આપી ફોસલાવી તેણીના ગુમાંગમાં આંગળીઓ નાંખી તેણીની સાથે દુષ્કર્મનો હીન પ્રયાસ કર્યો હતો. આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ-૩૭૬(એબી) તથા પોકસો એક્ટની કલમ-૩(એ),૪,૫(એમ), ૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

HONEST - DEDICATED - TEAMWORK

Don't Let Confusion Cast A Shadow over Buying Your Dream Home.



CENTURY 21

Innovative Pinnacle Real Estate Group

We Look forward to providing you with an unusually High Level of Service and Commitment giving you a New definition of results in the Real Estate Industry. After all it is your Satisfaction that defines our Success!!!

- Free Staging
- Free Professional Photography & virtual tour
- Free Marketing, Flyers, Newspapers, Media Advertising
- Free Comparative Market Analysis
- Team of Professional for same price as hiring a single realtor
- Over 15 years of combined experience



Spacious 3 Bedroom Condo With Unobstructed View Of Frenchman's Bay & Lake Ontario. Master W/Walk In Closet & 3Pc Ensuite. Lots Of Storage Space. New Flooring In Living Room. Within Walking Distance To Go Train, Pickering Town Centre, Restaurants, Entertainment, Waterfront Trail And Cycling Paths, Hwy 401



Welcome To This Stunning Double Garage Detached Home In Elegant Ajax Neighbourhood. Modern Features Include Sunken Living Room With Stacked Stone Elect. Fireplace, Hardwood Flowing Through Main Floor To Family Space In The Formal Dining Room. Kitchen Features Quartz & Coffered Ceiling With Large Eat-In Area & W/O To Backyard Deck. Rooms Feature Charming Accent Walls, Large Master With His/Hers Closets. Finished Basement Space For Family Games & Entertainment.



15 Yr Old Large 3+1 Bedroom 4 Washroom Semi-Detached Built By Monarch! Entertainment-Sized Great Room With Walk-Out To A Huge Backyard With Patio! Approx 2,000 Sq.Ft. Hardwood Floor On Main, 2nd Flr & Stairs. Stainless Steel Appliances. Finished Basement With 3 Pc Ensuite Bath. Ensuite Laundry, Direct Garage Entry! Near Warden Station, Close To Downtown, Shopping Malls, Worship Place.

You have Nothing to Loose... Call us for a Free Consultation on How to Get Started.

Use The Advantage of a Team, Because... Teamwork Makes Your Dreams Work !

Shamim & Amin Kharodia
Broker of Record / Sales Representative
teamkharodia@gmail.com

300-2855 Markham Rd Toronto ON M1X 0C3

D: (647) 501-6786 | D: (647) 308-2941

F : (416) 298-8303 | P: (647) 666-8676



Grand Centennial Office

Each office owned and Operated. This is not intended to solicit buyers/sellers currently under contract with any brokerage.